

વર્ષ : ૪૧ + અંક : ૮
ઓગસ્ટ - ૨૦૧૭


Retail Price Rs. 10/- Each

શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી પ્રેરિત

પર્યાખણ
વિરોધાંક

દિવ્યાધ્વનિ

આદ્યાત્મિક મુખપત્ર



શ્રીમદ્ રાજચંદ્ર આદ્યાત્મિક સાધના કેન્દ્ર

(શ્રી સત્યુત - લેવા - સાધના કેન્દ્ર સંચાલિત)

કોલા ૩૮૨ ૦૦૭. (નિ. ગાંધીનગર, ગુજરાત)

ફોન : (૦૭૯) ૨૩૨૬૬૨૧૬, ૨૩૨૬૬૪૮૩-૮૪

E-mail : mail@shrimadkoba.org, Web. : www.shrimadkoba.org



ગુરૂપૂર્ણિમા નિમિતે સંસ્થામાં યોજાયેલ આધ્યાત્મિક શિબિર વેળાની તસવીરો
 (તા. ૮-૭-૨૦૧૭ થી તા. ૧૦-૭-૨૦૧૭)



જિનાલિખેક



દીપ-પ્રાગટ્ય



પૂજયશ્રીલી પાવનનિશ્ચા



આદ.ડૉ. કુમારપાણ દેસાઈ



આદ.ડૉ. જિતેંદ્રભાઈ રાહુ



બા. ફા. શ્રી સુરેશાજુ



ભક્તિસંગીત



વૃક્ષારોપણ

હે પ્રભુ! હે પ્રભુ! હું કનુ.....
 ઘરનિયમ કંજમ આપ દિયો.....
 રક વાણે રક પરિણામે.....
 પરમ પુણ્ય પ્રભુ સદગુરુ,
 પરમ રાન સુજાણિમ;
 ચેઠો આપણું વાન નિય,
 તેને સરા પરિણામ.
 જિનિયર કદે છે રાન તેને,
 નાંડ-૨૩૭, ૨૩૮, સર્વ ભવ્યો સાંલખો.
 ૧૫૫, ૧૫૬

દિવ્યધન

અનુક્રમણિકા

- (૧) શ્રી સદ્ગુરુપ્રસાદ શ્રીમદ્ રાજચંદ્ર ૫
(૨) પર્વનો મહિમા અને સાર્થકતા
..... પૂજ્યશ્રી આત્માનંદજી ૭
(૩) ક્ષમાપનાનો સંકલ્પ ડૉ. કુમારપાળ દેસાઈ ૮
(૪) પરમપદ પ્રાપ્તિનું પર્વ મા. ચંદાબહેન પંચાલી ૧૨
(૫) પર્યુષણ મહાપર્વ-ક્ષમાપનાનું પર્વ .. પૂજ્ય બહેનશ્રી ૧૫
(૬) શ્રી દેવચંદ્ર ચોવીશી... શ્રી અશોકભાઈ પી. શાહ ૧૬
(૭) શ્રી ભક્તામર સ્તોત્ર શ્રી મહેન્દ્રભાઈ ખંધાર ૨૦
(૮) મનન-મંથન-અમૃતની પ્રાપ્તિ
..... શ્રી વલભજી હીરજી ૨૩
(૯) શ્રી પર્યુષણ મહાપર્વ શ્રી પૂર્ણિમાબેન શાહ ૨૫
(૧૦) પર્યુષણ પર્વનો પાવન સંદેશ-કર્મથી ધર્મ તરફ
..... શ્રી પારુલબેન ગાંધી ૨૬
(૧૧) પર્યુષણ-આત્માની સમીપતા ... શ્રી ભાનુબેન શાહ ૨૮
(૧૨) પર્યુષણ પર્વનો મહિમા શ્રી વિભાબેન મહેતા ૩૧
(૧૩) તપની આરાધનાનું પર્વ શ્રી મિતેશભાઈ શાહ ૩૩
(૧૪) જીવનદીપ-દિવાળી પુસ્તિકા ૩૪
(૧૫) સમાજ-સંસ્થા દર્શન ૩૭

વર્ષ : ૪૧

ઓગસ્ટ, ૨૦૧૭

અંક - ૮



શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક શાધના કેન્દ્ર
(શ્રી સત્શુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત)

કોબા - ૩૮૨ ૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત)

ફોન: (૦૭૯) ૨૩૨૭૬૨૧૮/૪૮૩/૮૪

mail@shrimadkoba.org, www.shrimadkoba.org

Bank Detail : Shrimad Rajchandra Adhyatmik Sadhana Kendra

Name of Bank : Kotak Mahindra Bank

Branch : Chandkheda, Ahmedabad - 382424.

A/c. No. : 08390020000044 • IFS Code : KKBK0000839

લેખકો / ગ્રાહકો / વાચકોને

- ☞ ‘દિવ્યધનિ’ દર મહિને પ્રગટ થાય છે.
- ☞ કોઈ પણ અંકથી ગ્રાહક થઈ શકાય છે.
- ☞ ગણ વર્ષથી ઓછી મુદ્દતનું લવાજમ સ્વીકારવામાં આવતું નથી.
- ☞ ચેક/ડ્રાઇટ/એમ.ઓ. ‘શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા’ના નામનો મોકલવો.
- ☞ સહુ સ્વજનો-મિત્રો વધુમાં વધુ ગ્રાહકો નોંધાવીને સહયોગી બને તેવી વિનમ્ર અપેક્ષા છે.
- ☞ ગ્રાહકોએ પત્રવ્યવહારમાં પોતાનો ગ્રાહક નંબર અને પૂરું સરનામું અવશ્ય લખવું. ગ્રાહક નંબર સરનામાની ઉપર લખેલો હોય તે નોંધી રાખવા વિનંતી છે.
- ☞ સરનામામાં ફેરફાર થાયાની જાણ તાત્કાલિક કરવા વિનંતી છે.
- ☞ કોઈપણ લેખ સ્વીકારવો કે ન સ્વીકારવો કે કમશા: લેવો તેનો સંપાદકશ્રીને સંપૂર્ણ અધિકાર રહેશે.
- ☞ લેખકોનાં ભંતબ્યો સાથે સંપાદકશ્રીનું સહમત હોવું આવશ્યક નથી.



: મુદ્રણસ્થાન :

ભગવતી ઑફસેટ

૧૫/સી, બંસીધર ઑસ્ટેટ, બારડોલપુરા,
અમદાવાદ - ૩૮૦ ૦૦૪
ફોન : ૨૨૧૬ ૭૬૦૩



પ્રાર્થના

હે પરમદૂપાળુદ્વ !

સર્વધર્મમાં મનુષ્યભવને શ્રેષ્ઠ કર્યો છે, કારણ કે ચાર ગતિના જીવોમાં માત્ર મનુષ્યપ્રાણી જ પોતાના હિતનો વિચાર કરી શકે છે, અને તેને માટે પુરુષાર્થ પણ કરી શકે છે. આપે તો કહ્યું જ છે કે આત્મહિત અતિ દુર્લભ છે અને તેથી જ સર્વ કાર્યોમાં આત્માર્થ જ કર્તવ્ય છે. પરંતુ આ વાત તો બહુ જ થોડા લોકો સમજે છે અને “સમજને શર્માઈ જનારા” જીવો તો અતિ વિરલ જ છે.

હે પ્રભુ ! અમને આપના ચરણ મળવા છતાં અને સદગુરુદેવનું શરણ મળવા છતાં પણ અમે કર્મરૂપી કાદવમાં ફસાયેલા છીએ ! તળાવમાંના કમળને લેવા જતો હાથી કાદવમાં એવો ફસાઈ જાય છે કે તે કમળ લેવા આગળ પણ જઈ શકતો નથી અને બહાર પણ આવી શકતો નથી. અમારી દશા પણ એવી જ છે. અમને સંસારમાં રહેવું ગમતું નથી અને સંસારથી છૂટવું બનતું નથી. અમને દઢ નિશ્ચય પણ નથી, અને આગળ વધવાનું બળ પણ નથી ! આપ જ કહો, હવે અમે પામર જીવો શું કરીએ ?

છતાં પણ અમને એક આશાસન એ છે કે, હવે અમને સંસારમાં નીરસતા થવા લાગી છે અને પરમાર્થની પ્રવૃત્તિ ગમવા લાગી છે. તેથી આપને ગ્રાથીએ છીએ-નિર્બળ ને પામર છીએ અમે તો, આપ છો શક્તિના ભંડાર, ભવસાગરને પાર કરીએ, એવી શક્તિ દેજો દાતાર, અનંતવાર આતમને ગાળ્યો, દેહને અર્થે હે ગુરુરાજ ! શક્તિ એવી દેજો અમને, દેહને ગાળીએ આતમકાજ. નાવ અમારી ભરદરિયે છે, નાવિક વિના શું કરીએ અમે ? આપ તો તરણતારણ છો, આપનો જ્યકાર કરીએ અમે.

॥ ઓં શાંતિ: શાંતિ: શાંતિ: ॥

શ્રી સદગુરુપ્રસાદ

શ્રીમદ્ રાજયંદ્રભુ

પત્રાંક - ૧૨૮

વવાણિયા, પ્રથમ ભાગ. સુદ્ર ૬, ૧૯૪૬
ધર્મચક્ર ભાઈઓ,

પ્રથમ સંવત્સરી અને એ દિવસ
પર્યત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો
અવિનય, આશાતના, અસમાધિ મારા
મન, વચન, કાયાના કોઈ પણ
યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે
પુનઃ પુનઃ ક્ષમાવું છું.

અંતર્જાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ
જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે
સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-
વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે ‘સમાધિ’
ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે,
અને એ મહા વૈરાગ્યને આપે છે.

વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ
સ્વચ્છંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ?
બીજા જીવો પરતે કોધ કરતાં, માન કરતાં, માયા
કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માહું છે
એમ યથાયોગ્ય કાં ન જાણ્યું ? અર્થાત્ એમ જાણવું
જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ
કરવાનો વૈરાગ્ય આપે છે.

વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ
પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો
(સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયોગ
થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના
જિવાયું એ કંઈ થોડું આશ્રયકારક નથી. અર્થાત્ જે
જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે
કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો ? એ ફરી



ફરી વૈરાગ્ય આપે છે.

વળી જેનું સુખ કોઈ કાળે પણ
નહીં જોઉં; જેને કોઈ કાળે હું ગ્રહણ
નહીં જ કરું; તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે,
દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા
માટે જન્મ્યો ? અર્થાત્ એવા દ્વેષથી એવા
રૂપે જન્મવું પડ્યું ! અને તેમ કરવાની
તો ઈશ્વા નહોંતી ! કહો એ સ્મરણ
થતાં આ કલેશિત આત્મા પરતે જુગુપ્સા નહીં
આવતી હોય ? અર્થાત્ આવે છે.

વધારે શું કહેવું ? જે જે પૂર્વનાં ભવાંતરે
ભાંતિપણે ભ્રમણ કર્યું; તેનું સ્મરણ થતાં હવે કેમ
જીવનું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું
અને ફરી એમ ન જ કરવું એવું દફત્ર આત્મામાં
પ્રકાશે છે. પણ કેટલીક નિરુપાયતા છે ત્યાં કેમ
કરવું ? જે દફતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી
એ જ રટણ છે, પણ જે કંઈ આહું આવે છે, તે કોરે
કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે, અને તેમાં
કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા
દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી,
એમ દફતા છે તેનું કેમ કરવું ? કદાપિ કોઈ રીતે
તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં
જઈને રહીએ ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે, કે જ્યાં
જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ ? ત્યારે
હવે કેમ કરવું ?

“ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે
તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન
કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી
ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી

પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુર્નિમિત હો, પણ એમ કરવું જ.

ત્યાં સુધી હે જીવ ! ધૂટકો નથી.”

આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે.

કાણે કાણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આર્થિકરણ (આર્થ પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી.

ક્ષમાપનાનો સંકલ્પ

(પાના નં. ૧૧ પરથી ચાલુ...)

પણ જાણ મેળવવી જોઈએ. એ એટલા માટે જરૂરી હશે કે તે પાપની માર્ગી આપણે માર્ગી શકીશું. કારણ કે માનવીએ પોતાના પાપનો એકરાર કરવો પણ જરૂરી છે. એણે કોઈ ગરીબનું શોખણ કર્યું હોય કે કોઈના શોખણમાં સાધનરૂપ બન્યો હોય, કોઈને લાંચ આપી હોય કે કોઈની લાંચ લીધી હોય, પરિગ્રહથી બીજાને પીડા આપી હોય કે હિંસાથી કોઈનું હનન કર્યું હોય ત્યારે માનવીએ પોતે પોતાની જાતના તાજના સાક્ષી બનીને અપરાધોનો એકરાર કરવો જોઈએ. ક્ષમાપનામાં આ નિખાલસ એકરાર ઘણો મહત્વનો છે. આથી જ આચાર્ય ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે :

મિથ્યા મિ દુક્કડમ્

જાણતાં-અજાણતાં અમારા તરફથી આપને કંઈ પણ મનહુઃખ થયું હોય તો
‘દિવ્યધ્વનિ’ના સુજ્ઞ વાયકમિત્રોને સમસ્ત કોબા પરિવાર તથા તંત્રી તરફથી
ભાવપૂર્વકના મિથ્યા મિ દુક્કડમ્.
- તંત્રી ‘દિવ્યધ્વનિ’ તથા સમસ્ત કોબા પરિવાર

ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્તસંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંશાસ્તી લોકાશ્રે જવાતું નથી. લોકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે.

“એ કંઈ ખોઢું છે ?” શું ?

પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેનાં પ્રત્યાખ્યાન લઈએ તો ?

લઈ શકાય.

એ પણ આશ્રયકારક છે.

અત્યારે એ જ. ફરી યોગવાઈએ મલીશું.

એ જ વિજ્ઞાપન.

વિ. રાયચંદના યથાયોગ્ય.

• • •

જ દુક્કડ તિ મિથ્યા, તે ભુજજો કારણં અપૂરતો,
તિવિહેણ પડિહતો, તસ્સ ખલુ દુક્કડ મિથ્યા.

(જ સાધક મન, વચન અને કાયાના ગ્રણેય યોગથી પ્રતિકમણ કરે છે, જે પાપને મિથ્યામિ દુક્કડ દે છે અને પુનઃ તે પાપ કરતો નથી તેનું દુષ્ટ્યત્ય - પાપ મિથ્યા થઈ જાય છે. પાપને જાણીને, તેનો નિખાલસ એકરાર કરીને તેમ જ એ પાપો ફરી ન કરવાની કૃતનિશ્ચયી પ્રતિજ્ઞા લેવાય ત્યારે જ ક્ષમાપનાની નજીક પહોંચાય છે.)

મિથ્યા મિ દુક્કડનો અર્થ જ એ છે કે એક વાર જે ભૂલને માટે ક્ષમાપના કરી, જે દોષને માટે પશ્ચાત્તાપ કર્યો, જે પાપને માટે પ્રાયશ્ચિત્ત કર્યું એવી ભૂલ, એવો દોષ કે એવું પાપ કરવાથી હુંમેશને માટે દૂર રહીશું એવો સંકલ્પ કરવો.

પર્વનો મહિમા અને સાર્થકતા

પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી

● ભૂમિકા :

કાળના ચક સાથે સમય બદલતો જ રહે છે. ફેશનની દુનિયામાં જેમ રોજ નિત-નવું દેખાતું રહે છે, તેમ સામાન્ય મનુષ્યનું મન પણ કંઈને કંઈ નવું માગે છે અને તેના દ્વારા જાણે કે મનોરંજનની પ્રાપ્તિમાં સંતોષ માને છે. રોજબરોજના ઘરેરું જીવનથી કંટાળેલો મનુષ્ય કંઈક નવીનતાને જંખે છે.

સમાજ અને ધર્મના અગ્રણીઓએ આ વાતને લક્ષ્યમાં રાખીને વખતોવખત અમુક દિવસો એવા મુકરર કર્યા, કે જે દરમ્યાન મનુષ્ય રૂઢિગત જીવનથી છૂટો થઈ બાબ્ય જીવનમાં ઉત્સાહ, ઉલ્લાસ અને ઉમંગથી કંઈક નવું કરવા પ્રેરાય અને વિવેકી વર્ગ સમાજોપયોગી કાર્યોમાં અથવા અંતઃકરણની શુદ્ધિના કાર્યમાં યોજાય. આમ, દિવાળી, પર્યુષણ વગેરે ખાસ દિવસોનું આયોજન કરી લોકસમુદ્દાયને નાવીન્યની સાથે સાથે નવરાશ મળે અને આ લોકની સાથે પરલોકનું હિત પણ વિચારી શકાય તેવી સામૂહિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી.

● પર્યુષણ પર્વ : વીતરાગ પરમાત્માના માર્ગમાં નિશ્ચયનયની દાખિએ તો એક વીતરાગતાને જ ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) ભાવ તરીકે સ્વીકારેલ છે. તેથી આવા પર્યુષણના દિવસોમાં પણ મૂળ મનીષીઓએ તો જીવનમાં પવિત્ર વિચારો અને પવિત્ર આચારોની વૃદ્ધિ અર્થે જ સર્વ આયોજન કરેલ. પરંતુ બહુજનસમાજ ઉત્સવપ્રિય હોવાથી સારું ખાવું-પીવું અને પહેરવું-ઓઢવું એ તરફ વય્યો. જે વિચારક વર્ગ હતો તેણે આ પવને વિવેક જગાડવાનું, સાદાઈ અપનાવવાનું, પરમાત્માની ભક્તિ-પૂજાનું, સંતોના



સમાગમનું, ચિંતન-મનનનું અને તપોમય સંયમી જીવન ગાળવાનું નિમિત્ત બનાવ્યું. આ સઘણ ઉપરથી જ આ પર્વનું નામ પર્યુષણ (પરિ =ચારે બાજુથી, ઉસ્ર = વસવું) પાડવામાં આવ્યું. આપણે આવા વિવેકી મનુષ્યોના જગત અભિગમનો વિચાર કરીએ.

(૧) વિવેકની જગૃતિ : વિશ્વની પ્રાણી-સૂષ્ઠિમાં મનુષ્ય શિરમોર છે. પરંતુ આધુનિક ભૌતિક વિજ્ઞાનની સગવડોમાં અટવાઈને સારા-નરસાનો, અહિસા-હિસાનો, સ્વધન-પરધનનો, વિવેક અને વિશ્વમૈત્રીનો, સદ્ગુણોના વિકાસનો, સ્થીર અને શાંતિપ્રિય સામાજિક અને કૌટુંબિક જીવનનો રાહ ભૂલીને સ્વાર્થી, સંકીર્ણ, હઠાગ્રહી અને વિષયાંધ બન્યો. આવી સ્થિતિમાં બહાર નીકળવા સત્સંગ, સદ્ગ્રાવાચન અને સાવધાની અપનાવીએ તો જીવનમાં ઉચ્ચ મૂલ્યો તરફ વળીને પોતાનું અને પરનું ભલું કરી શકીએ, અધ્યાત્મજીવન જીવવાની પાત્રતા મેળવી શકીએ. જીવનના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ — આ ચારેય પુરુષાર્થનું મૂળ વિવેક છે, માટે જીવનમાં વિવેકને અપનાવીએ.

(૨) જીવનમાં સાદાઈ : પ્રાચીન કાળથી ભારતમાં હંમેશાં ત્યાગની મહત્ત્વા રહી છે. મહાપુરુષોએ અને ઉમદા રાજા-મહારાજાઓએ પણ સાદું જીવન અને ઉચ્ચ વિચારની નીતિ અપનાવી છે. આ જમાનામાં પણ શ્રીમદ્ રાજયંત્રજી, મહાત્મા ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, રાજેન્દ્રભાબુ, લાલભાદુર શાસ્ત્રી અને રવિશંકર દાદાએ આવા જીવનને અપનાવી આપણાને પ્રત્યક્ષ જીવન જીવી બતાવ્યું છે. આપણે આ માર્ગથી વિમુખ થઈને

દેખાડેખીથી અને ખોટા મોભાની લાલચથી ખર્ચળ અને મોજશોખવાળું જીવન જીવતા થઈ ગયા છીએ. એટલે જ ચિંતા, સતત માનસિક તણાવ, ફાજલ સમયનો અભાવ, ઈર્ધાનું સામ્રાજ્ય, દહેજનું દૂષણ અને મિથ્યા આંદબરથી આપણે પીડાઈ રહ્યા છીએ. પ્રેમ, શાંતિ, સ્થિર કૌટુંબિક જીવન અને અન્ય પ્રત્યે લાગણીનો અભાવ આપણા જીવનમાં દણિંગોચર થાય છે. સાદાઈને અપનાવવાથી આમાંના ઘણા પ્રશ્નો સહેલાઈથી હલ થઈ શકશે; માત્ર જરૂર છે દઢ નિશ્ચયની.

(૩) પરમાત્મા - સંતો પ્રત્યેની ભક્તિ : સમાજના મૂલ્યોમાં ભૌતિકતાની મુખ્યતા થવાથી રામ-કૃષ્ણ-મહાવીર-બુદ્ધ-નાનક-વિવેકાનંદ-રાજયંદ ઇત્યાદિ મહાપુરુષોના જીવન અને વ્યક્તિત્વ વિશે આપણા અંતરમાં માત્ર રૂઢિગત સદ્ગ્રાવ રહ્યો છે, પણ તાત્ત્વિક શ્રદ્ધા રહી નથી. ભણેલાગણેલા ઘણા મનુષ્યો ધર્મને ધર્તિંગ માનવા લાગ્યા છે અને સાચા જ્ઞાન, સાચી ભક્તિ અને સાચા ચારિત્યબળનો જીણે કે આપણા વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં અભાવ થતો જાય છે. સમાજના ખાનદાન, સંસ્કારપ્રેમી અને વિચારક વર્ગો આ બાબતને ગંભીરતાથી વિચારી, ભારતીય સંસ્કૃતિના પાયારુપ પરમાત્મા-સંતોની ભક્તિને અપનાવી પોતે આસ્તિકતામાં આવવું જોઈએ, કારણ કે ગુણાનુરાગ, ગુણાનુવાદ અને ગુણગ્રાહકતાથી જ માનવીનું જીવન સત્ત્વશીલ અને વિકાસોન્મુખ બની શકે છે.

(૪) સંયમ-તપોમય જીવન : સામાન્ય માનવી તો પોતાનું સદ્ગુરુસ્થનું જીવન જીવીને પણ વ્યસનરહિતપણું, શાકાહારી ભોજન અને ખોટા ખર્ચનો અભાવ — આ બધાને સેવીને કંઈક આગળ વધી શકે છે. વિચારક પુરુષો તેથી આગળ વધીને સાદું ભોજન, સાદો પહેરવશ, ઉદાર વૃત્તિ સહિત સુપાત્રો દાન, મિતાહાર, નિયમિતપણે આધ્યાત્મિક વાચન-વિચાર, તીર્થયાત્રા, સેવા- પરોપકારમય

જીવન અને જીપ-ધ્યાન આદિ સત્ત્સાધનો દ્વારા દિવ્ય જીવન જીવવાનો દઢ સંકલ્પ કરે છે. આવું જીવન નિશ્ચિતપણે, નિર્ભયપણે અને છતાં સુદૃઢ નિશ્ચયપૂર્વક જીવી શકાય તે અર્થે તેઓ જીવનની બધી આંતરબાધ્ય વ્યવસ્થાને પણ તેને અનુરૂપ ફેરફાર કરીને ફરીથી ગોઈવે છે. આમ, સંતુલિત આયોજનથી પ્રવૃત્તિ અને નિવૃત્તિના સમન્વયપૂર્વક તેઓ વર્તમાન જીવનમાં પ્રસન્નતા, મૃત્યુ સમયે નિર્ભયતા, શાંતિ અને સમતા તથા અલ્પ કાળમાં પૂર્ણ મોક્ષના અનંત સુખનો અનુભવ કરે છે. આવા વિવેકી મનુષ્યો જ સાચા ગૃહસ્થધર્મને મુનિધર્મને પાળીને વીતરાગપ્રભુને માર્ગ ચાલનારા બની શકે છે.

આ પર્યુષણ પર્વને પવિત્રતાની વૃદ્ધિના નિભિત તરીકે સ્વીકારીને આપણા જીવનને નિઃસ્વાર્થ, પ્રબુદ્ધ તે મજ સ્વપરકલ્યાણમય બનાવીએ, અનો મહાવીરપ્રભુના બોધના હાર્દનો સ્વીકાર કરીએ એ જ ભાવના અને એ જ પુરુષાર્થ પ્રગટો.

॥ ઊં શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥

પર્યુષણ મહાપર્વ-ક્ષમાપનાનું પર્વ

(પાના નં. ૧૫ પરથી ચાલુ...)

ક્ષમાગુણનો ઉદ્ભબ થાય છે — કર્મોનો આસ્ત્રવ રોકાઈ જાય છે અને સાધક સંવર - નિર્જરા તત્ત્વને પ્રાપ્ત કરે છે, જે ઉપાદેય તત્ત્વ છે.

- ક્ષમા આત્માના દસ ધર્મોમાંથી પ્રથમ ઉત્તમ ધર્મ છે.
- ક્ષમા એ સત્યની સખી છે, કરુણાની બહેન છે અને અહિસાની દીકરી છે.
- ઉત્તમ ક્ષમા ગુણના ધારક મુનિને ક્ષમાશ્રમણ કહેવાય છે.
- ખામેભિ સવ્યે જીવા, સવ્યે જીવા ખમંતુ મે, મિતીભે સવ્યે ભૂઅષ્ટુ, વેરં મજજું ન કેણાઈ.

॥ ઊં શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥

॥ શ્રી સદ્ગુરુચરણપર્ણમસ્તુ ॥

ક્ષમાપનાનો સંકલ્પ

પદ્મશ્રી ડૉ. કુમારપાણ દેસાઈ



પર્વાધિરાજ પર્યુષણ સમયે વજ હૈયાનાં બોલ છે ક્ષમાપના. ધર્મહૈયાના કોલ ક્ષમાપના છે. આથી જ “ક્ષમા વીરસ્ય ભૂષણમ्” એમ કહેવાયું છે. ક્ષમાનો અર્થ છે શક્તિ. ક્ષમા માગે વિરાટ હૃદયનું સામર્થ્ય. હૃદયમાં વેર હોય તો કોઈ પણ ધાર્મિક કિયા સફળ થતી નથી. જૈન ધર્મમાં તો ક્ષમા વિશે ઘણી ઊંડી ચર્ચા થઈ છે. ક્ષમાને બધા ગુણોની કૂખ કહેવામાં આવી છે. એનાથી આપણામાં ઘણા ગુણો આવે છે. ક્ષમા આવે તો લોભ મટે, ક્ષમા આવે તો ત્યાગ આવે, સરળતા આવે, વિનય આવે અને સંતોષ આવે. મન અને ઇન્દ્રિયો પર કાબૂ આવે. બીજી રીતે જોઈએ તો આ બધા ગુણો હોય તો ક્ષમાની સાધના થઈ શકે.

ક્ષમાનો એક અર્થ છે નિર્ગ્રથ થવું, એટલે કે ગ્રંથિ-ગાંઠ છોડવી, “ક્ષ એટલે ગાંઠ અને મા એટલે નાણ કરવું.” આજના જીવનમાં ઘણી ગાંઠ છે. બાપ-દીકરામાં મતભેદ છે, ગુરુ-શિષ્ય વચ્ચે કલાક છે, પતિ-પત્ની વચ્ચે ગેરસમજ છે, મિત્ર-મિત્ર વચ્ચે મારામારી છે. શેઠ અને નોકરનાં દિલ દુખાયેલાં છે. પડોશી સાથે વઢવેર છે. નજીકના સાથે સ્નેહ તૂટ્યો છે. આવે સમયે ભાંગેલા હૈયાને સાધવાનું કામ ક્ષમા કરે છે. ક્યાંક મદની ગાંઠ છે તો ક્યાંક વેરની ગાંઠ છે. ક્યાંક મનનો મતભેદ છે તો ક્યાંક તણાવ છે. કેટલાય ચિત્રવિચિત્ર માનસિક રોગો માનવીને થવા લાગ્યા છે. શેરડીમાં જોયું હશે કે જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ હોતો નથી, આથી જ વ્યક્તિ - વ્યક્તિ વચ્ચેના સંબંધો શુષ્ણ અને નિરસ બની ગયા છે. તેને જીવંત કરવાનો ઉપાય છે ક્ષમા. બીજાથી તેવીસમાં તીર્થકર સુધીના સમયગાળાનું જીવન પ્રમાણમાં સરળ હતું. ભૂલ થાય એટલે ક્ષમા

માગી લેતા. પણ આજનું જીવન જટિલ બન્યું છે. માણસ પોતે અશાંત છે. જગતને અશાંત કરે છે. કાજળની કોટી જેવો ક્યાંક સંસાર ચાલે છે. જાણતાં મદ, માન, કામ, કોધ થઈ જાય. અજાણતાંય થઈ જાય. કાયાથી ન થાય તો વચ્ચનથી થાય. વચ્ચનથી ન થાય તો મનથી થઈ જાય.

અસત્ત માનીએ અને સત્ત નીકળો. સત્ત વળી અસત્ત ઠરે. આંખ જુએ કંઈ અને નીકળો કંઈ. વાટે અને ઘાટે વિષયવૃત્તિઓ વેરાયેલી છે ત્યારે ક્ષમાપનાનું પર્વ એ વિશ્વમૈત્રીનું પર્વ છે. ત્રણ લોકના જીવોને અભય બક્ષનારું પર્વ છે. આવો, કોમળ કંઠે અને ઉદાર દિલના અવાજે પોકારીએ —

જગતના સર્વ જીવની મૈત્રી

દિલના સર્વ શુભાશયની દોસ્તી !

આવો ક્ષમો, આવો ક્ષમીએ !

દુનિયા દોષની છે — દેખની છે;

અમાં મૈત્રીનાં ફૂલછોડ રોપીએ !

જગત તો જ જીવવા જેવું રહેશે !

રે ! ભાઈ ! તારા ગળે કાંચકી કાં વળગે ? એવો તું ભવોભવનો કર્મકઠિયારો છે : ને ભવોભવ સુધી તું કર્મકષાયનાં કરગઠિયાંની ભારી લઈને ભમવાનો છે, કે મુક્ત કંઠે, ખુલ્લા દિલે બોલી શકતો નથી —

મિથ્યા મિ દુક્કડ !

મિથ્યા હો

મમ દુષ્કાર્ય ને દોષ !

મૈત્રીનો પ્રારંભ માતાથી કરવાનો છે, પછી ભાઈબહેન સાથે અને પછી એનો વિકાસ થતાં

પરહિત ચિંતા અને પ્રાણીમાત્ર પ્રત્યેની કરુણા સુધી પહોંચવાનું છે.

ક્ષમા એ ધર્મઅનુષ્ઠાનનો માપદંડ છે. ધર્મના અનુષ્ઠાન કેટલે અંશે આત્મસાત્ થાય છે તેનો તાળો ક્ષમા પરથી મળી શકે, ક્ષમાવૃત્તિના વિકાસ પરથી મળી શકે. ક્ષમા ધર્મભાવનાનું બેરોમીટર છે. ક્ષમા ન હોય તો બધા પ્રત, જપ, તપ, ધ્યાન, અનુષ્ઠાન સફળ થતાં નથી. આ ક્ષમા તે આત્માનો ગુણ છે, જે કોધ અને કષાયથી વિકૃત થાય છે. જેમ પાણી સ્વભાવે શીતળ છે પણ અભિનો સંયોગ થતાં ઉષ્ણ થાય છે. આમ, ઉષ્ણતા એ જળનો સ્વભાવ નથી પરંતુ એનો વિભાવ છે. અભિનો સંપર્ક દૂર થતાં જ એ જળ પોતાની સ્વાભાવિક શીતળતા પ્રાપ્ત કરી લેશે. પાણીમાં શીતળતા માટે કોઈ અન્ય સાધનની જરૂર પડતી નથી કારણ કે એ એનો સ્વાભાવિક ગુણ છે. એ જ રીતે ક્ષમા આત્માનો સ્થાયી ગુણ છે. એને માટે અન્ય કોઈ બાધ્ય સામગ્રીની જરૂર નથી, પણ પાણીમાં જેમ ઉષ્ણતા આવે છે એ રીતે આત્માનો સ્વાભાવિક ગુણ ક્ષમા એ કોધ કષાયના ઉદ્યથી વિકૃત થઈ જાય છે પણ એ વિકૃતિ સ્વાભાવિક હોતી નથી. એ જ રીતે અભિના સંપર્કના અભાવમાં ઉષ્ણતા શાંત થઈ જાય છે, એ જ રીતે એ કોધ કષાયના અભાવમાં વિકાર શાંત થઈ જાય છે.

જ્યારે જીવ પોતાના નિજભાવ રૂપમાં પરિણમે છે ત્યારે સુખી થાય છે, કારણ કે સુખ એના આત્મસ્વભાવથી પ્રાપ્ત થાય છે. પોતાના સ્વભાવમાંથી ડગી જઈને પરભાવ અથવા વિભાવને પ્રાપ્ત કરે છે ત્યારે એ દુઃખી થાય છે. આમ, કોધભાવ એ આત્માનો સ્વભાવ નથી પરંતુ અન્ય પદાર્થના સંયોગથી ઉત્પન્ન થયેલો વિભાવ છે અને તેથી જ એ આત્માને અહિતકારક છે. આમ, કોધ જેવી કોઈ હાનિકારક વસ્તુ નથી અને ક્ષમા જેવી

કોઈ ગુણકારક બાબત નથી. કોધ માત્ર આલોકમાં જ નહીં, પરલોકમાં પણ દુર્ગતિ અપાવે છે. આથી જ ક્ષમા વિશે કહ્યું છે –

ઉત્તમ ખમ તિલ્ખોયહ સારી, ઉત્તમ ખમ જમ્મોદહિતારી,
ઉત્તમ ખમ રયણતય ધારી, ઉત્તમ ખમ દુર્ગાઈદુહહારી.

(ઉત્તમ ક્ષમા ગ્રણે લોકમાં સારરૂપ છે. જન્મમરણરૂપ સંસારસમુદ્રને તારનારી છે. રત્નત્રયને પ્રાપ્ત કરાવનારી છે તથા દુર્ગતિને હરાણ કરનારી છે.)

આવી ઉત્તમ ક્ષમાનું ઉદાહરણ ભગવાન મહાવીરસ્વામીનું જીવન છે. એમના જીવનમાં અનેક ઉપસર્ગો આવ્યા પરંતુ એ બધાને ભગવાને ધૈર્યથી સહન કર્યા. ભગવાન મહાવીરની મોટાઈ દેવરાજ હંડ ગાતા હતા ત્યારે સંગમ નામના એક દેવને દેવોની અસ્મિતાનો ગર્વ ચઢ્યો. એણે ભગવાન મહાવીરની કસોટી કરવાનું નક્કી કર્યું. છ-૭ મહિનાથી અનેક ઉપસર્ગો કર્યા.

ઉચિત બિક્ષાન્ મળ્યું ન હતું. પણ નમે તો એ મહાવીર નહીં ! આત્માની અભિપરીક્ષામાં આખરે કાંચન શુદ્ધ નીવડ્યું !

આખરે સંગમદેવ મહાવીરના પગમાં પડ્યો. એમના આત્મવિજય આગળ આ દેવનું ગુમાન હારી ગયું. એમની સહનશીલતા સામે સંગમની બધી યાતનાઓ મીણની માફક ઓગળી ગઈ. ભગવાન મહાવીરે છ-૭ મહિના સુધી અનેક રીતે હેરાન-પરેશાન કરનાર સંગમને ક્ષમા આપી. ક્ષમાના આ ભાવને જૈનશાસ્ત્ર આ રીતે સાકાર કરે છે –

જહિં આકોસણવયણ સહિજજઈ,

જહિં પરદોસ ણ જહિં ભાસિજજઈ,

જહિં ચેયણગુણ ચિત ધરિજજઈ,

તહિં ઉત્તમ ખમ જિણો કહિજજઈ.

(જે માનવીઓ દુર્જનોનાં આકોશવચન માટે

બીજાને દોષ આપવાને બદલે પોતાના પૂર્વોપાર્કિંગ કર્માનું ફળ છે એમ માનીને સહન કરે છે તથા પોતાના ચૈતન્ય ગુણોનો અનુભવ કરે છે તે આત્માનુભૂતિમાં લીન થઈ જાય છે અને એને જ જિનેશ્વર ભગવાન ઉત્તમ ક્ષમા કહે છે.)

જૈન ધર્મમાં તો શ્રમણને એવી આજ્ઞા કરવામાં આવી છે કે જ્યાં સુધી તારી ભૂલની ક્ષમા માગે નહીં ત્યાં સુધી થૂંક પણ ગળાથી નીચે ઉતારવું નહીં. કંટા બિધાવનાર તરફ સ્નેહ રાખવો એ ક્ષમાની અભિજ્ઞાતી છે. એકવાર મહાત્મા બુદ્ધના પોતાના જ શિષ્યે ઈર્ઝાના આવેશમાં મહાત્મા બુદ્ધ પર એક મોટી શિલા ફેંકી. મહાત્મા બુદ્ધના પગમાં ઈજા થઈ. ઘણા દિવસો સુધી તેઓ ચાલી શકતા નહોતા. આમ છતાં મહાત્મા બુદ્ધને તેમના શિષ્ય તરફ સહેજે કઢુતાનો ભાવ નહોતો. એથીય વધુ તેઓ કહેતા કે આપણે આવું સહન કરીશું તો તેમને અંતે તો ભૂલ સમજશે.

ક્ષમા સહજ હોવી જોઈએ, બનાવટ નહીં. આપણે પર્યુખણપર્વની ઉપાસના કરવાની છે, ઉજવણી નહીં. શું ક્ષમા આપણા જીવનમાં ધૂંટાઈ છે કે માત્ર મૌખિક કે ઔપચારિક બની ગઈ છે? શું આપણે એક જ કૂદકે આત્માને પરમાત્માની નિકટ મૂકી દેતી પ્રયંડ તાકાત ધરાવતી આ ભાવનાને માત્ર સગવડિયા ક્ષમા બનાવી દીધી નથી ને? સંવત્સરી પ્રતિકમણ કરી, “ખામેમિ સબ્બે જીવા, સબ્બે જીવા ખમતુ મે” એટલું કહી દીધું એટલે ઉદ્ઘાટનાં બધાંય પાપ રાતોરાત ધોવાઈ ગયાં અને આપણો આત્મા નિર્મળ થઈ ગયો એમ તો માની બેઠા નથી ને? માત્ર બે હાથ જોડીને બોલી દેવાથી, ફોન પર કહી દેવાથી કે ધાપેલું કાર્ડ મોકલી દેવાથી કશું નહીં વળે. ક્ષમા તો એવી હોવી જોઈએ કે જે માગતાં મનનો મોરલો ક્ષણ વાર પણ આધાત અનુભવે નહીં અને હૈયાની વેલી કરમાય નહીં.

સંસારની શેરીઓમાં જેનાથી હેતપ્રીતનાં તોરણ બંધાય અને વઢવેલના કાતિલ કંટા અવળા ફરી જાય એનું નામ ક્ષમા. અંતરના તાર અમી વરસાવે, સંસાર મનનો મીત લાગે તેનું નામ ક્ષમાપના. ક્ષમાની સાહજિકતા વિશે સંત જ્ઞાનદેવ કહે છે —

“સહન કરત સબમેં બડો, ગર્વ ન ક્ષમા કરાય; જિંમ શરીર રોમહિં ધરત, તાકો સુધી વિસરાય.”

(શરીર પર અસંખ્ય રોમાવલિઓ છે પણ જે રીતે શરીરને એનો ખ્યાલ રહેતો નથી એ જ રીતે બધું સહન કરવા છતાં જરા પણ અભિમાન થવા દેવું નહીં તે ક્ષમા છે.)

આવી ક્ષમાને — “ક્ષમા તેજસ્વિનાં તેજઃ ક્ષમા બ્રહ્મ તપસ્વિનાં” એટલે કે ક્ષમા તેજસ્વીઓનું તેજ અને તપસ્વીઓનો બ્રહ્મ છે. પણ ખરેખર આપણે તપસ્વી રહ્યા છીએ ખરા ? કે પછી દંભ, ડર કે કાયરતાનો અંચળો ઓઢીને બેઠા છીએ ? આપણે જોઈએ છીએ કે ઘણાંને જૂઠનો ભય નથી પણ જૂઠાણું પકડાઈ જવાનો ભય છે; પાપનો ભય નથી પણ પાપ આચરતાં ઝડપાઈ જવાનો ભય છે; ચોરીની બીક નથી પણ ચોરી ઉઘાડી પડી જવાની ભીતિ છે.

માનવી જ્યાં સુધી ભયભીત છે ત્યાં સુધી ક્ષમાપનાને પામી શકતો નથી. આપણે માત્ર બીજાનું જ મન દુઃખી નથી કરતા, માત્ર અન્યને જ કઢુ વચ્ચે કહેતા નથી કે માત્ર સામી વ્યક્તિના જ આત્માને નથી દુભાવતા, પરંતુ આપણા પોતાના આત્માને પણ દુભવીએ છીએ. મન, વચ્ચનથી તેને ત્રાસ આપીએ છીએ. ખુદ આપણે આપણા પર ગુસ્સે થયા છીએ.

આમ, માત્ર સામી વ્યક્તિ તરફ કરેલાં પાપોની જ નહીં પણ સ્વ પ્રત્યેના આપણા પાપોની (અનુસંધાન પાના નં. ૬ પર)

પરમપદ પ્રાપ્તિનું પર્વ - પર્યુષણ મહાપર્વ

＊＊＊＊＊ પ્રા. ચંદાબહેન વી. પંચાલી (બોટાડ) ＊＊＊＊＊

ચૈતન્યદશાના મેરુશિખરે શોભતા, ચૈતન્ય વિહારી, ચૈતન્ય આહારી, ચૈતન્ય પ્રહરી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની અમૃત સરસ્વતી છે, “વિચારવાન પુરુષને કેવળ કલેશરૂપ ભાસે છે, એવો આ સંસાર તેને વિષે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. ત્રણે કાળને વિષે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાસ્યમાન થવા યોગ્ય નથી, અને ભાસે એવું ત્રણે કાળને વિષે સંભવતું નથી” પત્રાંક ઉટેમાં આત્મભાવનાની અચલતા દર્શાવી છે. સંસાર-સ્વરૂપનું રહસ્ય આ વચનામૃતમાં ઉદ્ઘટિત થયું છે. વિચારવાન પુરુષની અંતરંગ પરિણાતિને ઉદ્ઘોષિત કરી છે. આ પરિણાતિમાં વિહરતો સાધક અનુકૂળે પરમપદ પ્રાપ્તિને પામે છે.

સંસ્કૃત સાહિત્યના મૂર્ધન્ય મહાકવિ કાલિદાસ લખે છે ‘ઉત્સવપ્રિયા જનાઃ ।’ મનુષ્યો ઉત્સવપ્રિય હોય છે. ઉત્સવ બે મ્રકારના છે. – લૌકિક ઉત્સવ અને લોકોત્તર ઉત્સવ. સંસારભાવ પોષક લૌકિક ઉત્સવ છે અને અધ્યાત્મભાવ પોષક લોકોત્તર ઉત્સવ છે. પર્યુષણપર્વ લોકોત્તર મહાપર્વ છે, જેમાં સાધકનો પ્રવેશ આત્મમય બને છે. વિભાવથી વિરક્ત થાય છે. સ્વમાં વાસ થાય છે. પરભાવથી મુક્તિ થાય છે. નિત્યત્વમાં નિવાસ થાય છે. અનિત્યપણું ધૂટતું જાય છે. તમસો મા જ્યોતિર્ગમય - અંધકારનો અનાદર અને જ્યોતિર્ભય આત્મામાં આદર વર્તે છે. અસતો મા સદગમય — અસત્યમાંથી ધૂટકારો અને સત્તમાં સ્થિરતા થાય છે. મૃત્યોર્મા અમૃતં ગમય - નાશવાન તત્ત્વમાંથી નિવૃત્તિ અને અમૃત સ્વભાવમય આત્માના રસપાનમાં પ્રવૃત્તિ થાય છે. તેવા મહાપર્વને પર્યુષણપર્વ કહેવાય છે.

પર્યુષણ — સંસ્કૃત શબ્દ છે. પરિ + વસ્ - ઉસ ધાતુમાંથી પર્યુષણ શબ્દ થયો છે. પરિ - ઉપસર્ગ છે. પરિ એટલે ચારે બાજુથી, ચારે તરફથી. વસ્ એટલે વસવું, રહેવું, નિવાસ કરવો. આત્મામાં નિવાસ કરવો. ચારેય તરફના વિભાવથી નિવૃત થઈ, આત્મસ્વભાવમાં નિવાસ કરવો તેને પર્યુષણ કહેવાય છે. અન્યભાવમાંથી ઉપયોગને હટાવીને, ઉપયોગને નિજતત્વમાં સ્થાપિત કરવાના પુરુષાર્થ પ્રેરક પર્વને પર્યુષણપર્વ કહે છે. ચિન્મય ચિંતામણિ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની ગણન ગંભીર ગિરા લખે છે, “જિંદગી અલ્ય છે, અને જંજાળ અનંત છે; સંઘ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્ય છે, અને જિંદગી અપ્રમત છે, તેમજ તૃષ્ણા અલ્ય છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજ્ઞવન પ્રાપ્તે આવરેલું વહું જાય છે.” સાધક માટે આ વચનામૃત સુવર્ણ લકીર સમાન છે.

પરમપદ પ્રાપ્તિની જિજ્ઞાસા કોને થાય ? જે જીવ ચતુર્ગતિના પરિભ્રમણથી થાક્યો હોય, પરમપદ પ્રાપ્તિની અંતરમાં રુચિ જાગી હોય, ‘કામ એક આત્માર્થનું’ એવી દઢતા પ્રગટી હોય; તે આત્માર્થ વિચારે છે કે હું કોણ હું ? ક્યાંથી થયો ? મારું વાસ્તવિક સ્વરૂપ શું છે ? અંતરંગ પદાર્થ પામવાની તાલાવેલી લાગે છે. રુચિનું ઘર ફરે છે. જાત ફરે છે. સોળ વર્ષે લખાયેલી ‘મોક્ષમાળા’ તેના સરસઠના પાઠના શબ્દો સાધક વિચારવા લાગે છે. પરમકૃપાળુદેવના અમૃતવચનોમાં...

“હું કોણ હું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહણું ?

એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાન્તતત્ત્વ અનુભવ્યાં.”

પરમપદની પ્રાપ્તિના પર્વમાં સાધક પ્રથમ નાસ્તિ થી વિચારણામાં વહે છે. સંસારભાવો-પરિવારનાં વિચારોમાં રહ્યા કરે છે. આગળ વધતાં આત્મા છે, તે નિત્ય છે. એવા અસ્તિના ભાવો જન્મે છે. સંસારના નાસ્તિના ભાવો ગૌણ થતાં જાય છે. તેથી પ્રથમ નાસ્તિ અસ્તિ રહે છે. આગળ જતાં અસ્તિ નાસ્તિ રહે છે. પુરુષાર્થના સત્ત્વવીર્યથી અસ્તિની ખુમારી વર્તે છે. પછી તો અસ્તિની મસ્તીની મસ્તીમાં ગટાગટી રહે છે. સાધક પરમપદની પ્રાપ્તિની સમીપતા સાધે છે.

અધ્યાત્મના રાજમાર્ગ પર પગલાં પાડતો સાધક સત્પુરુષના વચનોમાં શ્રદ્ધાન્વિત થાય છે. સદ્ગુરુના વચનામૃતોમાં વિશ્વાસ જન્મે છે. આસ્થા ઉદ્ઘાટિત થાય છે. શ્રદ્ધા ધૂંટાય છે. જેમ મેંદીના માત્ર પાનને હથેળીમાં કલાકો સુધી રાખે તો મેંદીનો રંગ હથેળીમાં આવતો નથી. મેંદી જેમ જેમ ધૂંટાય છે તેમ અંદરમાંથી રંગ પ્રગટે છે. ધૂંટાયેલી મેંદી હથેળીને મેંદીરંગથી રંગિત કરે છે. તેવી રીતે વિશ્વાસ, આસ્થા અને શ્રદ્ધા સાધકને પરમપદ-પ્રાપ્તિના અણસાર આપે છે.

વ્યવહારકાર્યમાં પણ વિશ્વાસથી કાર્ય સધાય છે. મહાત્મા એક ગામથી બીજા ગામ પગપાળા-ચાલીને જતા હતા. આગળ જતાં રસ્તામાં બે માર્ગ આવે છે. ક્યા માર્ગ જાઉં તો મારું ગામ આવે ? તેથી ત્યાં કામ કરતાં બેઢૂતને પૂછે છે કે જમણા માર્ગ જાઉં તો ગામ આવશે કે ડાબા માર્ગ જાઉં તો ગામ આવશે ? બેઢૂત કહે છે કે મહાત્માજી, ડાબે રસ્તે સીધા ચાલ્યા જાઓ. તમારું ગામ આવી જશે. વ્યવહારકાર્યમાં વિશ્વાસ હોય છે તો મંજિલ સુધી પહોંચાય છે. ત્યારે અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ પામતાં સાધકને સદ્ગુરુમાં વિશ્વાસ છે. વીતરાગ પ્રષ્ટિત

શાસ્ત્રોમાં સાધકને આસ્થા છે. શાસ્ત્રોમાં જે વાત આવે છે તેનો સ્વીકાર કરતો જાય છે તથા રાજમાર્ગે આરોહણ કરે છે. સત્યમાર્ગની સાધકને પ્રતીતિ થાય છે. સાધક શ્રદ્ધાન્વિત બને છે.

સાધક સ્વભાવને પામતો, અસ્તિત્વને આરાધતો, સાક્ષીત્વમાં જીવતો, જ્ઞાતા-દંધાભાવને સેવતો આનંદમય સુપ્રભાતની લાલિમાને અનુભવે છે. કર્તૃત્વની માન્યતાથી મુક્ત થાય છે. ચર્તુર્થ ગુણસ્થાને આત્માને માણે છે. પુરુષાર્થની અંતરંગધારા વૃદ્ધિ પામતાં આત્મગુણોનું આરોહણ વધતાં દેશવિરતિ-સર્વવિરતિ - શ્રોણી આરોહણ અને સયોગીદશાને આંબી જાય છે. આ પ્રમાણેના અખંડ પુરુષાર્થથી સાધક સિદ્ધિને વરે છે. અધ્યાત્મરંગનું રંગન પર્યુષણપર્વમાં પ્રારંભાય છે. નિષાપૂર્વકની સાધના, સદ્ગુરુની કૃપાનું યોગબળ, સ્વપુરુષાર્થમાં વીર્યનું ફોરવવું પરમ આવશ્યક છે. પછી સહજ સાધના સધાય છે.

જાપાનના સમ્રાટને જેન આશ્રમ જોવાનો વિચાર આવ્યો. તેઓ જેન ગુરુ પાસે જાય છે. પોતાનો વિચાર દર્શાવે છે. જેન ગુરુ આશ્રમના જુદા જુદા વિભાગો છે તે બતાવતાં કહે છે કે અહીં સાધકો અભ્યાસ કરે છે. અહીં યોગનો અભ્યાસ થાય છે. અહીં બધા જમે છે. વચ્ચે મોટો હોલ હતો. ગુરુ સમ્રાટને ત્યાં ન લઈ ગયા. સમ્રાટની નજર ગઈ. તેઓએ પૂછ્યું, “આ હોલ શેનો છે ?” ગુરુએ સિમિત સાથે કહ્યું કે જાણી જોઈને આપણે ત્યાં નહોતા ગયા. તમે પૃથ્વા કરત કે આ હોલમાં સાધકો શું કરે છે ? ત્યારે મારે શું જવાબ આપવો તે વિર્યાર્થુ હતું. પણ તેનો જવાબ મારી પાસે ન હતો. આ ધ્યાનખંડ છે. ત્યાં કાંઈ કરવાનું નથી. સ્વભાવમાં સ્થિતિ, અસ્તિત્વનો આનંદ માણવાનો, સાક્ષીત્વમાં સ્થિરતા કરવાની કે જે સહજ હોય છે. પરમપદની પ્રાપ્તિમાં સહજતા છે. જ્ઞાતાદંધાભાવ હોય છે. પર્યુષણપર્વની ચરમ સ્થિતિ અહીં સધાય છે. સોપાન પંક્તિનું

અંતિમ સ્થાન ત્યાં ઘટે છે.

‘સમાવિશતક’માં સાધન-સાધ્ય-સાધકના વિષયમાં વાત ચાલતી હોય અને સાધક એટલે શું ? એમ પૂછાય ત્યારે પ્રત્યુત્તર પ્રાપ્ત થાય.

“જો ખિનુ ગલિત વિભાવ.”

જેના વિભાવો ખરી પડ્યા છે તે સાધક. અર્થાત્ પરમપદમાં સ્થિતિનો પુરુષાર્થ થતાં સહજ અવસ્થા તે સાધક. ખરેખર તો સાધન-સાધ્ય-સાધકની અભેદ સ્થિતિ જ વર્તે છે. ઉત્તરાધ્યયનના છત્રીસ અધ્યયન છે તેમાં મૃગાપુત્રીય અધ્યયન છે. તેમાં ભગવાનની દિવ્યધનિમાં આવે છે.

રેણું વ પડે લગં નિદ્રણિતાણં નિગઓ –
અર્થાત્ કપડાં પર લાગેલી ધૂળને ખંખેરિને કોઈ ચાલે તેમ. માતા-પિતાએ દીક્ષાની અનુમતિ આપી. મૃગાપુત્ર દીક્ષાર્થે જાય છે. કેવી રીતે ? જેમ કપડાં પર લાગેલી ધૂળ ખંખેરાય તેમ મૃગાપુત્ર વિભાવોને ખંખેરિને ચાલ્યા. સહજ સામર્થ્યમાં સધાતી આ ઘટના છે.

પર્યુષણપર્વમાં રુચિ અને વૈરાગ્યના બે પ્રબળ સફથી ભવસાગર તરી જવાય છે. જગતથી ઉદાસીનતાનું સેવન અને સત્તુસ્વરૂપ આત્માના ચરણમાં આવાસ થાય છે. સ્તુતિ-નિંદા-માન-અપમાન-વંદન-સ્તવન-પૂજન કે નમનના ભાવોથી મુક્તા રહેવાય છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજયંત્રજીની ભાવના - જે મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં ગવાતી કાવ્ય રચનામાંની દિવ્યગિરામાં લખાય છે,

“શત્રુ ભિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,

માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;

જવિત કે મરણે નહીં ન્યૂનાવિકતા,

ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?”

આવી ઉત્કૃષ્ટ દશા, ભીતરી ભાવમાં ભીજાવું, પુરુષાર્થની પરાકાણા, અલખના આંગણે પ્રવેશની પ્રારંભ ભૂમિકા મહાપર્વમાં પ્રારંભાય છે, જે પરમપદની પ્રાપ્તિમાં કૃતકૃત્ય થાય છે.

પર્યુષણપર્વનું અંતિમ ચરણ ક્ષમાભાવમાં છે, જે સંવત્સરી પ્રતિકમણમાં થાય છે. વ્યવહાર ભૂમિકાએ જૈનધર્માઓ આઠ દિવસના પર્વના સમાપ્તન દિવસે સંવત્સરી પ્રતિકમણની અંતરંગ કિયા થાય છે. “ખામેમિ સંબે જીવા સંબે જીવા ખમન્તુ મે । મિત્તિ મેં સંબેભૂએસુ વેરં મજ્જાં ન કેણી ॥”

સંબે જીવા ખામેમિ – સર્વ જીવને હું ખમાવું છું. ક્ષમા માંગું છું.

સંબે જીવા મે ખમન્તુ – સર્વ જીવ મને ક્ષમા આપો.

મિત્તિ (મિત્રતા) મે સંબે ભૂએસુ – સર્વ જીવ સાથે મારે મિત્રતા છે.

વેરં મજ્જાં ન કેણી – કોઈ સાથે મારે વૈરભાવ નથી. આવી ઉત્કૃષ્ટભાવના સાથે પરસ્પર મિચ્છા - મિથ્યા થાઓ, મિ - મારું, દુક્કદમ - દુષ્કૃત્ય - મારું વિપરીત કૃત્ય મિથ્યા થાઓ અને સમ્યક્ ભાવનો હું સ્વીકાર કરું છું. સમભાવ ધારણ કરું છું.

આવી મંગલભાવના, પૂર્ણાનંદ પ્રભુમયતા બની રહે છે. પ્રશાંત સરોવર જેવી સ્થિતિ. સરોવરના કિનારે ઊભેલા પથરર ફેંકે, એક પછી એક ફેંકે અને જળમાં તરંગોના વર્તુળો થયા જ કરે. પથર ઘણા ફેંકાય છે - વર્તુળો ઘણા થાય છે. કોઈને રોકી શકાય નહીં. પણ સરોવર સપાટીને ભાવથી સ્થિર કરી દે તો સપાટીના વર્તુળો થયા કરે અને સપાટી સ્થિર થઈ જાય. બાબ્ય ભાવની અસરથી મુક્ત સપાટી પર થતી અસરનો શાંતભાવે સ્વીકાર. શાંતભાવથી સ્વીકાર તે પર્યુષણમહાપર્વની ચરમદશા છે. અધ્યાત્મ લોકોત્તરપર્વ મહાપર્વ બની રહે છે. પરમપદની પ્રાપ્તિ સધાય છે.

પર્યુષણ મહાપર્વ - ક્ષમાપનાનું પર્વ

૧૦૦ પૂજય બહેનશ્રી ડૉ. શર્મિષ્ઠાલેન સોનેજી

“ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમા એ અંતર્શર્તુ જીતવામાં ખરૂગ છે. —શ્રીમદ્ રાજચંદ્રજી

ક્ષમા વિષેના મહાપુરુષોના અમૃતવચનોનું સંકલન - જે દ્વારા આપણા જીવનમાં ક્ષમાનું માણાત્મ્ય સમજાય.

- સામર્થ્ય હોવા છતાં મૂર્ખ અને દુષ્ટજનોના અપશબ્દો (દુર્વચન) સહન કરવા તે ક્ષમા છે.
- ન સાંભળવા યોગ્ય કર્કશ, કઠોર વચન સાંભળતા છતાં જ્યાં કલેશ નથી થતો - કોધ નથી થતો તે ક્ષમા છે.
- ક્ષમા મનુષ્યો માટે માતા સમાન હિતકારી છે. માતાને કદાચ કોધ થઈ જાય પણ ક્ષમા કદી કોધરૂપ પરિણમતી નથી.
- ક્ષમા દ્વારા પૂર્વના દુઃખ દેવાવાળા સંચિત કર્મો બણી જાય છે, તેથી ચિત્ત નિર્મણ થઈ જાય છે.
- કરોડો વખત જપ તથા ધ્યાન આદિ તપ દ્વારા જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય એક અપરાધી પ્રાણીને એકવાર ક્ષમા કરવાથી પ્રાપ્ત થઈ જાય છે.
- મનુષ્યનું આભૂષણ રૂપ છે, રૂપનું આભૂષણ ગુણ છે, ગુણનું આભૂષણ જ્ઞાન છે અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે.
- ક્ષમા મૃત્યુંજ્યી છે. ભાવમરણથી બચાવે છે.
- સમસ્ત જગત પ્રત્યે નિર્વેરબુદ્ધિ જ અધ્યાત્મ સાધનાનો આધાર છે. ધર, પરિવાર, સમાજ તથા રાષ્ટ્રજીવનમાં પણ ક્ષમા ગુણથી જ શાંતિ તથા વ્યવસ્થા બનાવી શકાય છે.
- ક્ષમા ધર્મ, અર્થ, કામ, મોક્ષની કારણભૂત છે. ક્ષમા શાંતિ છે, ક્ષમા શક્તિ છે, ક્ષમા શ્રેયસ્કર

છે, ક્ષમા ધૈર્ય છે, ક્ષમા ધન છે, ક્ષમા રક્ષાનું બળ છે, ક્ષમા માતા છે, ક્ષમા બંધુ છે, ક્ષમા લક્ષ્મી છે, ક્ષમા શોભા છે, ક્ષમા કીર્તિ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા સંતોષ, વિનય, સરળતા, ત્યાગ આદિ ગુણોની ધારક છે.

- ક્ષમારૂપી તલવાર જેના હાથમાં હોય તેનું દુર્જન લોકો કાંઈ બગાડી શકે નહીં. જેમ ઈધશ વિના અજિન સ્વયં શાંત થઈ જાય છે.
- ક્ષમા વીરસ્ય ભૂષણમ્ - ક્ષમા વીરોનું આભૂષણ છે.
- ક્ષમા સમાન તપ નહીં, ક્ષમા સમાન બીજું કોઈ સદાચરણ નહીં, ક્ષમા જેવું બીજું હિતકારી નહીં અને ક્ષમા જેવું કોઈ જીવન નહીં.

નિશ્ચય ક્ષમા :

- અજ્ઞાની, દુર્જન મનુષ્યો દ્વારા ગમે તેવા અપમાન, છેદન-ભેદન થવા છતાં અંતરથી પ્રતિકારનો ભાવ ઉત્પન્ન ન થવો - તે નિશ્ચય ક્ષમા છે. એવા મહા-મુનિરાજને ક્ષમા સ્વભાવ પ્રગટી ગયો છે, જ્યાં કોધનો પ્રવેશ જ થઈ શકતો નથી. ઉદા. ગજસુકુમાર મુનિની ક્ષમા, સુકોશલમુનિની ક્ષમા તથા ભગવાન મહાવીરની ચંડકોશિયા પ્રત્યેની ક્ષમા. (સાભાર : દસ્ધર્મ-સ્કંધ)
- દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.

— શ્રીમદ્ રાજચંદ્રજી

- આત્માનો ક્ષમા ગુણ જેનું અપ્રતિક્રિયા લક્ષણ છે, તેનું અવલંબન લઈને શુભાશુભ ભાવો પ્રત્યે ઉદાસીન થઈને જ્યારે પોતાના ‘જ્ઞાયક’ ભાવમાં સ્થિરતા થાય છે ત્યારે નિશ્ચયથી (અનુસંધાન પાના નં. ૮ પર...)

શ્રી દેવચંદ્રજી ચોવીશી

* * * * * અશોકભાઈ પી. શાહ * * * * *

ચતુર્થ તીર્થકર

શ્રી અભિનંદન સ્વામી સ્તવન પ્રારંભ

ભૂમિકા : ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ રચિત શ્રી અભિનંદન સ્વામી સ્તવન દ્વારા આપણે ભક્તિમાર્ગ દ્વારા મોક્ષમાર્ગમાં એક વધુ પગલું માંડીશું. સ્તવનના ભાવો જો હદ્યસ્થ થાય અને તેમાં રહેલી શ્રી દેવચંદ્રની ભક્તિ જો આપણી ભક્તિ બની જાય તો અવશ્ય પ્રભુમિલનરૂપ પરાભક્તિને પામીએ એવું આ સ્તવનમાં દૈવત રહેલું છે. ભક્તિમાર્ગમાં ભક્તિ તો એકપક્ષી જ રહેવાની કારણ કે પ્રભુ તો નીરાગી, નિર્વિકારી છે. એટલે આ બાજુથી, ભક્તના પક્ષેથી ભક્તની કેટલી તૈયારી છે, કેટલી પાત્રતા છે, કેટલી પ્રભુ-ગુરુ આજ્ઞા પ્રત્યે સમર્પણતા છે, કેટલો પ્રભુમિલનનો તલસાટ છે – આ સર્વે લક્ષ્ણો સ્વાભાવિક રીતે જ ભક્તમાં અપેક્ષિત થઈ જાય છે. આવી પાત્રતા ધરાવતો સાધક પોતાના સદ્ગુરુના આશ્રયે તેમના માર્ગદર્શન હેઠળ અપરાભક્તિથી પરાભક્તિ સુધીના ભક્તિમાર્ગના milestonesનો નકશો ઘડી કર્છે છે, જેમાં મુખ્ય છે : પોતાની પામરતાનો અહેસાસ, પ્રભુના અલૌકિક ગુણોને ઓળખી તેનું અતિશય માહાત્મ્ય લાવવું, પોતાની અને પ્રભુની વચ્ચેની આ અગાધ દૂરીને ઓછી કરવા નિરંતર નિજદોષદર્શન અને પ્રભુનું ગુણદર્શન, પ્રભુ જેવો પોતે થઈ શકે છે એવી સંભાવનાનો પરમ ઉલ્લાસ, પુદ્ગલપ્રેમીમાંથી પ્રભુપ્રેમી બનવાનો ઉઘમ, પ્રભુના ગુણોના નિરંતર ચિંતન-મનન દ્વારા પોતામાં ધીમે ધીમે તે ગુણોના અંશોનો આવિભિવ અને આખરે પ્રભુના અનુસંધાન દ્વારા આત્માનુસંધાન કરી આત્માનુભૂતિરૂપ પરમાનંદની પ્રાપ્તિ ! પછી તો ગુણપ્રાગટ્ય અને

પ્રસન્નતાનો સંચાર પોતામાં થતો જોઈને ભક્ત પ્રભુના ઉપકારનું વેદન કરતાં, પોતાની પ્રીતિ એકપક્ષી હોવા છતાં, ભક્તની ભાષામાં બોલી ઉઠે છે કે, “જુઓ તો ખરા, મેં પ્રભુ તરફ એક ડગ માંડયું કે પ્રભુ એક માતાની જેમ સો ડગલા મારી સામે દોડી આવ્યા !” ભક્તિમાર્ગના આ બધા અંશો આ સ્તવનમાં ગર્ભિત છે. તેને હવે આપણે શ્રી દેવચંદ્રજીની રસમય શૈલીમાં માણીએ :

કયું જાણું કયું બની આવશે, અભિનંદન રસરીતિ હો મિતા; પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મિતા.

— કયું જાણું ૧

શબ્દાર્થ : હે મિત્ર ! અભિનંદન પ્રભુ સાથે રસમય પ્રીતિ કરવાની રીત કઈ રીતે હું જાણું અને તે કઈ રીતે બની શકશે ? પુદ્ગલના અનુભવનો ત્યાગ કરવાથી જેની અર્થાત્ પરમાત્માની પ્રતીતિ કરી શકાય છે. (કયું = કઈ રીતે; જસુ = જેની)

વિશેષાર્થ : શ્રી દેવચંદ્રજીને એક બાજુ પ્રભુ – મિલનની ઉત્કટ જંખના છે; તેથી કહે છે કે હે મિત્ર ! અભિનંદન પ્રભુ સાથે રસીલી, તન્મય પ્રીતિની રીત હું કઈ રીતે જાણી શકું અને એ પરમ પારમાર્થિક બનાવ કઈ રીતે બની આવશે તે મારે માટે એક મોટો પ્રશ્ન છે. બીજી બાજુ, દેવચંદ્રજીને પોતાને પ્રાપ્ત ગુરુગમથી સ્વયં સ્હુરણા પણ થાય છે કે પુદ્ગલ પદાર્થોનો રસપૂર્વક અનુભવ કરવો, ભોગ કરવો તે જ જીવને પ્રભુથી દૂર રાખે છે. તેથી તેનો ત્યાગ કરવાથી ‘જસુ’ અર્થાત્ જેની એટલે કે પરમાત્માની પ્રતીતિ થઈ શકે છે, “પુદ્ગલ – અનુભવ ત્યાગ”થી જ પરમાત્મા સાથે રસીલી ભક્તિનો સંબંધ જોડી શકાય છે.

‘હે મિત્ર’નું સંબોધન કોઈપણ જિજાસુ, આત્માર્થી સાધક માટે છે, અથવા તો દેવચંદ્રજી સ્વરૂપ સાથે મિત્રતા કરી સ્વયંને જ મિત્ર કહીને અંતરંગ વાર્તાલાપ કરે છે એમ પણ લઈ શકાય. ‘અભિનંદન રસરીતિ’ – તે પ્રભુ સાથે રસીલી ભક્તિ, પ્રીતિની રીતનું સૂચન કરે છે. રસીલી ભક્તિ એટલે તન્મયતાવાળી પરાભક્તિ, જેમાં પ્રભુ સાથે ભાવથી એકત્વતા સધાય છે; જ્યાં ભક્ત, ભક્તિ અને ભગવાન એક થઈ જાય છે; જ્યાં પ્રભુના જેવી જ આત્માનુભૂતિ આંશિકપણે પ્રગતાત્માં સાધક હરિરસનો આસ્વાદ માણે છે. આ જ છે “અભિનંદન રસરીતિ”. પરંતુ આમ પ્રભુ સાથે રસમય, આનંદસભર અભેદતા સાધવામાં જો કોઈ મુખ્ય બાધક તત્ત્વ હોય તો તે છે પૌદ્રગલિક પદાર્થોનો મોહ. માટે પુદ્રગલ અર્થાત્ જડ પદાર્થોમાંથી રસ, રુચિ કાઢીને પ્રભુભક્તિ, સત્સંગ, તત્ત્વની સુવિચારણા આદિ સત્તસાધનોમાં રસ નાખવો જોઈએ. તો જ પ્રભુની પ્રતીતિ, નિશ્ચયનયથી નિજાત્માની પ્રતીતિ, અનુભૂતિ થાય. અર્થાત્ સમ્યગુદ્ધન પ્રગટે.

આપણા મહાભાગ્યે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ યોગાનુયોગ કોઈ મુમુક્ષુની શંકાનું સમાધાન કરતાં પત્રાંક - ૬૮૮માં ગાથાના આ ચરણનો તાત્ત્વિક અને માર્મિક અર્થ લખ્યો છે, જે અહીં પ્રસ્તુત છે :

“ ‘પુદ્રગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો’ એમ મૂળ પદ છે. એટલે વર્ણ, ગંધાદિ પુદ્રગલગુણના અનુભવનો અર્થાત્ રસનો ત્યાગ કરવાથી, તે પ્રત્યે ઉદાસીન થવાથી ‘જસુ’ એટલે જેની (આત્માની) પ્રતીતિ થાય છે, એમ અર્થ છે.’”

કૃપાળુદેવે દેવચંદ્રજીના આશયને પકડી માર્મિક વાત કરી છે કે આત્મપ્રતીતિ માટે પૌદ્રગલિક વસ્તુના ત્યાગ કરતાં તેના અનુભવનો અર્થાત્ તેના રસના ત્યાગને વધુ મહત્વ આપવું જોઈએ.

પુદ્રગલના રસનો ત્યાગ એટલે વારંવાર જીવને ક્ષણિક ભાંતિગત સુખનું પ્રલોભન આપનાર જડ પદાર્થો પ્રત્યેના મોહ, આસક્તિના ત્યાગને સાધનામાં પ્રાધાન્ય આપવું જોઈએ, કારણ કે તે મોહસક્તિ, તે પુદ્રગલનો રસ સર્વ કર્મોમાં મુખ્ય એવા મોહનીય કર્મનું સ્વરૂપ હોવાથી અનંત સંસાર પરિબ્રમણનું કારણ છે. તેથી જ કહ્યું છે ને કે “વસ્તુના ત્યાગમાં મુક્તિ જોઈ નથી, વાસના ત્યાગમાં મુક્તિ જોઈ.” અહીં વસ્તુ-ત્યાગનો નિષેધ નથી. નિમિત્તાધીન વૃત્તિ ચલિત ન થાય તે માટે ત્યાગમાર્ગ પણ ભગવાને કીધો જ છે, પરંતુ અનાદિના સંસ્કારને મૂળમાંથી ઊઝેડવા પુદ્રગલમાં રસ, રુચિનો ત્યાગ તે મુખ્ય સાધના છે. તેથી જ રસત્યાગ માટે થતું આયંબિલ તપ ઘણીવાર ઉપવાસ કરતાં ચઢી જાય છે. પુદ્રગલમાં રસ જીવને કેવું સતાવે છે તેનું એક દાંત સ્વ. શ્રી ઉત્તમકાકા પોતાના વેધક સ્વાધ્યાયમાં આપી આપણને જગૃત કરતાં કે, “આખું ચોમાસું લીલોતરીનો ત્યાગ કર્યો હોય પણ ચોમાસું પૂરું થવાના ૮ દિવસ પહેલાંથી મેથીના ગોટા યાદ આવે !” માત્ર જીબના રસની જ વાત નથી. પુદ્રગલના સ્પર્શ, ગંધ, વર્ણ-પણ આ પામર જીવને જે-તે વિષયભોગમાં બેંચી જઈ પ્રભુ સાથે એકત્વ કરવાની સાધનાને ખંડિત કરી નાએ છે. માટે મોક્ષાભિલાષી સાધક જીવે “પુદ્રગલ અનુભવ ત્યાગ” કરવો જ રહ્યો.

હવે બે ગાથાઓમાં દેવચંદ્રજી પ્રભુના અલૌકિક, મહિમાવંત સ્વરૂપનું વર્ણન કરેછે. પ્રયોજન એ છે કે પ્રભુનું પૂર્ણતા પામેલ સ્વરૂપ જોઈને સાધકને પોતાની પામરદશાનું ભાન થાય છે. પ્રભુ અને પોતાની વચ્ચેના અમાપ અંતરને ઘટાડવાનો પુરુષાર્થ ઊપે છે. પ્રભુ કેવી ભાવ-ઉંચાઈએ બિરાજે છે તે જો નજર સમક્ષ રાખે તો સાધકનો પુરુષાર્થ વેગવંતો બને. એ લક્ષથી દેવચંદ્રજી હવે પ્રભુના ગુણો અને તેમનું તાત્ત્વિક સ્વરૂપ બતાવે છે, તેને અવલોકીએ :

પરમાત્મ પરમેશ્વરુ, વસ્તુગતે તે અલિપ્ત હો મિત; દ્રવ્ય મિલે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત.

— કયું જાણું ૨

શબ્દાર્થ : અભિનંદન સ્વામી પરમાત્મા છે, પરમેશ્વર છે, વસ્તુત: અલિપ્ત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે મળી ન શકે, તેમજ એક દ્રવ્યના ભાવ કે પરિણામ અન્ય દ્રવ્યમાં વ્યાપી શકતા નથી. (વસ્તુગતે = વસ્તુના સ્વભાવથી, નિશ્ચયનયથી, સ્વરૂપદ્રષ્ટિઓ; અલિપ્ત = લેપાયા વગર; મિલે નહીં = મળે નહીં, ભળે નહીં; અવ્યાપ્ત = વ્યાપી ન શકે તેવું)

વિશેષાર્થ : અભિનંદન પ્રભુ સર્વ કર્મમળથી રહિત પૂર્ણ વીતરાગી હોવાથી અજ્ઞાની બહિરાત્મા અને છચ્ચસ્થ જ્ઞાની એવા અંતરાત્મા કરતાં પણ અનંત ગણા શુદ્ધ ગુણોના ધારક હોવાથી પરમ - આત્મા, પરમાત્મા છે. અનંત ચતુર્થ્ય આદિ આત્મિક ગુણસંપત્તિરૂપ ઐશ્વર્યના સ્વામી હોવાથી તે પરમ-ઈશ્વર, પરમેશ્વર છે. વળી પ્રભુ તો વસ્તુગતે એટલે વસ્તુત: પોતાના સ્વભાવથી જ, વીતરાગતાના ફળસ્વરૂપે સર્વ પરવસ્તુથી, પરભાવથી, જગત અને જગતના સંબંધોથી, સર્વ કર્મોથી અલિપ્ત, નિર્લેપ થઈ ગયા છે. કેટલા અલિપ્ત કે કમઠ ઉપસર્ગ કરે તો તેના પ્રત્યે દ્વેષ નથી અને ધરણેન્દ્ર સેવા કરે તો તેના પ્રત્યે રાગ નથી. માથે સગડી મુકાઈ તો પણ ગજસુકુમાર એટલા અલિપ્ત કે કેવળજ્ઞાન લઈ લીધું ! આમ, પ્રભુનું પરમાત્મપણું, ઐશ્વર્ય, અલિપ્તપણું જાણીને દેવચંદ્રજ્ઞને મૂંગવણ ઊભી થઈ છે કે પ્રભુમિલન “કયું જાણું, કયું બની આવશે ?” વળી, સિદ્ધાંત જોતાં પણ આ પ્રભુમિલન અશક્ય લાગે છે, કારણ કે ત્રિકાળ અભાવિત સિદ્ધાંત એમ છે કે “દ્રવ્યે દ્રવ્ય મિલે નહીં” — અર્થાત્ નિશ્ચયનયથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળી શકે નહીં કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. તેથી હું અને પરમાત્મા — એમ બે બિન્ન દ્રવ્યનું મિલન સિદ્ધાંત

પ્રમાણે ન થઈ શકે. તેમ વળી સિદ્ધાંતથી એક દ્રવ્યના ભાવ કે પરિણામ બીજા અન્ય દ્રવ્યના ભાવમાં વ્યાપી ન શકે. શ્રીમદ્ભાગવતે એક કાવ્યમાં કહ્યું છે કે

“જરૂર ભાવે જરૂર પરિણામે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ.”
વળી, શ્રી બનારસીદાસ ફરમાવે છે કે,
“એક પરિનામકે ન કરતા દરવ દોઈ,
દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ.”

આ ન્યાયે પ્રભુના દ્રવ્યનો શુદ્ધ ભાવ મારા દ્રવ્યના અશુદ્ધ ભાવમાં વ્યાપીને તેને શુદ્ધ ન કરી શકે. એવું બની શકત તો તો પ્રભુ એવા કરુણાસાગર છે કે સર્વ જીવના ભાવોમાં વ્યાપી સર્વને મોક્ષ અપાવી હૈ ! પણ તેવું બનતું નથી, કારણ કે બે બિન્ન દ્રવ્ય વચ્ચે કે તેમના ભાવ, પરિણામો વચ્ચે કોઈ વ્યાપક - વ્યાપક સંબંધ કદાપિ ન થઈ શકે. આમ, પ્રભુનું ઐશ્વર્ય જોતાં તેમજ સિદ્ધાંત જોતાં દેવચંદ્રજ્ઞનો ‘કયું જાણું કયું બની આવશે’ એ જટિલ પ્રશ્ન ઊભો રહે છે.

વળી, પ્રભુની પરમોતૃપૂર્ણ દરશા પણ એવી છે કે તે જોઈને પોતાની હીન દરશાનું ભાન થતાં મિલન અશક્ય લાગે છે. એવી પ્રભુની ગુણસંપત્તિ દરશાનું હવે વર્ણન કરે છે :

શુદ્ધ સ્વરૂપ સનાતનો, નિર્મલ જે નિઃસંગ હો મિત; આત્મવિભૂતિ પરિણામ્યો, ન કરે તે પરસંગ હો મિત.

— કયું જાણું ૩

શબ્દાર્થ : પ્રભુનું શુદ્ધ સ્વરૂપ સનાતન અર્થાત્ શાશ્વત છે. પ્રભુ નિર્મલ છે, નિઃસંગ છે અને આત્મવિભૂતિને વરેલ હોવાથી હે મિત ! તેઓ કદાપિ પરનો સંગ નહિ કરે. (સનાતનો = શાશ્વત, સદાય રહેનારું; આત્મવિભૂતિ = આત્મિક ગુણોરૂપી સંપત્તિ)

વિશેષાર્થ : પ્રભુને જે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ્યું છે તેમાં હવે કર્મબંધનરૂપ કોઈ અશુદ્ધતાના

અનંતાશને પણ અવકાશ ન હોવાથી પ્રભુ સનાતનપણે સદાયને માટે શુદ્ધ સ્વરૂપે રહેશે, તેમાં સદાય મળન રહેશે. વળી, પ્રભુ રાગાદિ ભાવમળથી અને જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મમળથી રહિત હોવાથી નિર્મળ છે. સર્વ પરદ્રવ્યો અને પરભાવોનો સંગ આત્માનિકપણે છૂટી ગયો હોવાથી, પ્રભુ નિઃસંગ છે, અસંગ છે. “એક પરમાણુમાત્રાની મળે ન સ્પર્શિતા” એવા પ્રભુ અસંગ છે. (ભલે આ વર્ણન સિદ્ધ પ્રભુનું છે, પરંતુ અરિહંત પ્રભુ ભાવરૂપે આવા જ અસંગ, અસ્પૃશ્ય છે.) અખંડપણે આત્માના અનંત ગુણોની સંપત્તિના ભોગવટામાં એવી પૂર્ણકામતા વર્તે છે કે હવે “ન કરે તે પરસંગ” — પરના સંગની કોઈ આવશ્યકતા જ નથી રહી. આવા સનાતન શુદ્ધ સ્વરૂપી, નિર્મળ, પરનો સંગ ન કરનાર અસંગ પ્રભુ શા માટે મારા જેવા પામરનો સંગ કરે ? તો કઈ રીતે હે મિત્ર ! હું પ્રભુ સાથે તન્મય થઈશ એવી મૂંજવણ દેવચંદ્રજી વ્યક્ત કરે છે.

ઉપરોક્ત સિદ્ધાંતથી પ્રભુ સાથે દ્રવ્ય-એક્યતા તો ન જ થઈ શકે અને આત્મારી સાધકને તેવી અપેક્ષા પણ ન હોય. પરંતુ પ્રભુ સાથે ભાવ-એક્યતા તો ચોક્કસ થઈ શકે એવા આત્મવિશ્વાસથી દેવચંદ્રજી પ્રભુમિલનની તીવ્ર પિપાસાના બળે ઉપજેલી સ્વયંસ્કૃરણાથી તે ભાવ-એક્યતાનો ઉપાય, તેની વિધિનું નિરૂપણ આગળની ગાથાઓમાં કરે છે તે અવલોકિતે :

પણ જાણું આગમબળે, મિલવું તુમ પ્રભુ સાથ હો મિત ;
પ્રભુ તો સ્વસંપત્તિથી, શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત.

— કયું જાણું ૪

શબ્દાર્થ : પ્રભુને નિજસંપત્તિ પ્રાપ્ત થતાં પોતાના જ શુદ્ધ સ્વરૂપના નાથ, સ્વામી થયા છે. પરંતુ હે પ્રભુ ! મને તમારી સાથે મિલન તો કરવું જ છે અને તેનો ઉપાય આગમના બળે હું જાણી લઈશ.

વિશેષાર્થ : શ્રી દેવચંદ્ર મહારાજની હિંમત તો જુઓ. પ્રભુ સાથેની સરખામણીમાં પોતાની પામરતા જાણવા છતાં પ્રભુમિલનની આશ હોડી હતાત્ત્સાહી થતાં નથી. કહે છે, પ્રભુ ભલે અનંત જ્ઞાનાદિ અનંત ચતુષ્ય એવી નિજસંપત્તિના સ્વામી થઈ બેઠા છે. પ્રભુ ભલે સર્વ પ્રકારના અનાથપણાથી, અપેક્ષાઓથી મુક્ત થઈ, જગતથી ઉદાસીન થઈ અખંડપણે સ્વરૂપમાં લીન થઈ શુદ્ધ સ્વરૂપના નાથ થઈ બેઠા છે, જેથી સાક્ષાત્ મિલનની કોઈ શક્યતા નથી અને તેવી અપેક્ષા પણ હું રાખતો નથી. પણ પ્રભુ સાથે ભાવ-તન્મયતા સાધવામાં તો કોઈ અડયણ નથી ને ? અને તેવી અભેદતા સાધવાનો, “મિલવું તુમ પ્રભુ સાથ” નો ઉપાય હે મિત ! હું આગમબળે અર્થાત્ તે જ પ્રભુના ઉપદેશવચનો, આપ્તપુરુષોએ બોધેલા સત્તશાસ્ત્રોના પ્રત્યક્ષ આશ્રયથી, ગુરુગમ અને ગુરુઆજ્ઞાની સહાય લઈને શોધી કાઢીશ. પ્રભુ ભલે વીતરાગી થઈ દૂર બેઠા છે પરંતુ આગમો તે પ્રભુનો જ ઉપદેશ છે. તો ગુરુગમે તેનું અવગાહન કરતા પ્રભુ પ્રત્યક્ષ ઉપદેશ આપી રહ્યાં છે એવો ભાવ લાવતાં પ્રભુ સાથેનું Connection તો જળવાઈ રહેશે ને ? તે આગમના બળથી પ્રભુના જેવી આત્માનુભૂતિ અને આત્મસ્થિરતા આંશિકપણે મને પણ પ્રાપ્ત થાય એ જ હે મિત ! મારું પ્રભુમિલન છે. એ જ મારું જીવન ધ્યેય છે અને એ ધ્યેયની સિદ્ધિ હું કોઈ પણ ભોગો, કોઈ પણ કિંમત ચૂકવીને કરવા કટિબદ્ધ થયો છું.

“ધૂટવાના કામી” એવા શ્રી દેવચંદ્રજીને પ્રભુની આવી નિજામ ભક્તિથી આત્માની નિર્મળ દશા ઉપજતાં પ્રભુમિલન માટે આગમથી પ્રાપ્ત ઉપાયોની જે સ્વયંસ્કૃરણ થાય છે તે આગળની બે ગાથાઓમાં તેઓશ્રી અવતરિત કરે છે, જે આપણે યથાઅવસરે વિચારીશું.

(કુમશઃ)

● ● ●

શ્રી ભક્તામર સ્તોત્ર

(ક્રમાંક - ૩૨)

મહેન્દ્રભાઈ કે. ખંડાર

ભયભંજક પ્રભુ આશ્રય - ૧. ગજભયભંજક

● મૂળ શ્લોક : (વસંતતિલકા)

શ્ચ્યોત્તમદાવિલ વિલોલકપોલમૂલ -

મત્તભ્રમદ્ભ્રમરનાદ વિવૃદ્ધ કોપમ् ।

એરાવતાભમિભમુદ્ધતમાપતનં,

દૃષ્ટવા ભર્ય ભવતિ નો ભવદાશ્રિતાનામ् ॥૩૮॥

● શાસ્ત્રાર્થ : શ્ચ્યોત્તમ - ઝરતા, મદ - મદ (માદક રસ)થી, આવિલ - મલિન થયેલ, વિલોલ - ડોલતો, ચંચળ, કપોલમૂલ - ગંડસ્થળ ઉપર, મત્ત - ઉન્મત થઈને, ભ્રમદ્ - ભમી રહેલા, ભ્રમરનાદ - ભમરાઓના નાદ (ગણગણાટ, ગુંજારવ) વડે, વિવૃદ્ધ - વધી રહ્યો છે (જેનો), કોપમ્ - કોધ (એવો), એરાવત - એરાવત (ઈન્દ્રજનો હાથી, કદમ્બ ધણો મોટો), આભમ્ - જેવા (સાભ્યતા), ઇભમ્ - હાથીને, ઉદ્ધતમ્ - ઉદ્ધત, બેકાબૂ, આપતનતમ્ - સામે આવતા, દૃષ્ટવા - જેઈને, ભર્ય - ભર્ય, નો - નથી, ભવતિ - ઉત્પન્ન થતો, ભવત - આપનો, આશ્રિતાનામ્ - આશ્રય લેનારને.

● સમશ્લોકી અનુવાદ : (મંદાકંતા)

જે કોષ્યો છે ભ્રમરગણના ગુંજવાથી અતિશે, જેનું માથું મદજરણથી છેક ભીનું જ દીસો; એવો ગાંડો ગજપતિ કદી આવતો હોય સામે, તોયે કાંઈ ભર્ય નવ રહે, હે પ્રભુ ! આપ નામે.(૩૮)

● ભાવાર્થ : મદ ઝરવાથી મલિન બનેલો તથા ડોલી રહેલો તેમ જ ગંડસ્થળ પર ઉન્મત થઈને ભમી રહેલા ભમરાઓના ગુંજારવ (ગણગણાટ)થી કોપાયમાન બનેલો એવો એરાવત જેવો મોટો (ભયંકર) ઉદ્ધત (બેકાબૂ) હાથી સામે આવી રહેલો (ધસી આવતો) હોય તો પણ તમારો આશ્રય લેનારામાં (તમારા

આશ્રિતને) ભર્ય ઉત્પન્ન થતો નથી.

● વિશેખાર્થ / પરમાર્થ : ભક્તામર સ્તોત્રમાં હવે વિષયાંતર થાય છે. અહીં સુધી આદિનાથ પ્રભુની દિવ્યમૂર્તિના ગુણગાન કર્યા કે જેના ચમત્કારથી (વીતરાગદર્શન - જૈન ધર્મમાં ચમત્કાર, અક્ષમાત કે અન્યાય નથી, તેથી નિમિત્ત અપેક્ષાએ સમજવું) દુઃખ નાશ પામે છે. હવે જ્યારે એક પછી એક પ્રકૃતિ કે હિંસક પ્રાણીઓના ઉપદ્રવથી મનુષ્ય નિરાધાર થઈ જાય છે ત્યારે પરમાત્માનો આશ્રય લેવાથી બધી વિપત્તિ સહજ રીતે (કરણાનુયોગના નિયમોને આધીન કર્મ પ્રમાણે) ટળી જાય છે.

કોઈ પણ પ્રાણી જ્યારે પોતાના આંતરિક ભાવોથી આશ્રાદિત થઈ જાય છે ત્યારે તેના દ્વયભાવ સાકારરૂપથી દશ્યમાન થાય છે. તેથી હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરે છે. આ શ્લોક(૩૮)માં ‘વિરુદ્ધગુણ-ઉત્પાદ’ અલંકાર છે. મદ અને ભમરા એક બાજુ છે તેથી હાથીમાં વિપરીત ગુણ પ્રગટ થાય છે. મદથી માન અને ભમરાથી કોધ. દોષશાસ્ત્રના નિયમ અનુસાર અભિમાન એ કોધનો પોષક દુર્ગુણ છે. શક્તિનું અભિમાન વ્યક્તિને કોધિત બનાવે છે (અનુકૂળ નિમિત્ત મળતા). અહીં હાથીની શક્તિને અભિમાનમાં પરિણત કરીને કોધના રૂપમાં પ્રદર્શિત કરે છે, જેના ફળ સ્વરૂપે હાથી ભયંકર અને ઉદ્ધત બનીને ભયનું વાતાવરણ સર્જે છે.

પ્રભુનું નામ-સ્મરણ-આશ્રય એક માત્ર આધાર છે. ભક્તને આ જ ઉપાય સૂજે છે, જેનાથી હાથી ફરી સૌભ્ય, દોષમુક્ત, ગુણયુક્ત બને છે. અહીં હાથી તો કેવળ એક ઉદાહરણ - નામ છે. બાકી જિનેશ્વર પ્રભુનો આશ્રય લેનાર ભક્તને કોઈ પણ પ્રકારનો ભર્ય નથી રહેતો તે હવે પછીના ૮ શ્લોકમાં

દર્શાવે છે.

શું એવું લાગે છે કે માત્ર સ્થૂળ બાધ્ય હાથીના ભયથી મુક્ત કરવા માટે આ (અને પછીના ૮ શ્લોકની રચના કરવામાં આવી છે) આ તો ભક્તિ સ્તોત્ર છે કે જેમાં છાયાવાદનો આધાર લઈને આધ્યાત્મિક ભાવો ઉત્પન્ન કરે છે. હાથી તો અંદરના પ્રચંડ વિકારી ભાવનું રૂપક છે. ‘આ હાથી’ (આંતરિક વિકારીભાવો) મનુષ્યની સાધના ભંગ કરી શકે છે. સાધના પોતે તો સાચી છે પરંતુ નિરાલંબ સાધના આ ક્ષેત્ર-કાળમાં સામાન્ય રીતે સંભવિત નથી. સાધના પણ આલંબનની અપેક્ષા રાખે છે : અને તે અવલંબન છે સાચા દેવ-ગુરુ-ધર્મ(શાસ્ત્ર) રૂપ ભક્તિ. અહંભાવના કોધની પ્રચંડતાએ ઘણા સાધકોને ભયભીત અને પરાજિત કર્યા છે, પરંતુ જે સાધકો અરિહંતદેવનું શરણ લે છે. તે ‘ભવદાશ્રિત’ આત્મા નિર્ભય બની જાય છે. બાધ્ય હાથી (સ્થૂળ, ગ્રાણી) કરતા આંતરિક હાથી (સૂક્ષ્મ, વિકારીભાવો) પર વિજય મેળવવો એ જ આ શ્લોકનું અધ્યાત્મ રહસ્ય છે.

જ્ઞાનયોગી અને કર્મયોગી સંત પૂ. રાકેશભાઈ કહે છે કે ભક્તામર એ ભક્તિનું સ્તોત્ર છે, તે ભક્તિને વધારે છે, ભક્તને અમર (બાધ્ય વહેવારથી નામ અને આંતરિક નિશ્ચયથી સંપૂર્ણ કર્મનિર્જરા મોક્ષ) બનાવે છે. ભક્તની સાધનામાં અંતરમાં આત્મા-પરમાત્મા પર દાખિ છે અને બાધ્ય ઘટના (જગત અને જીવનની) પર દાખિ નથી. ભક્તિનું પ્રયોજન બાધ્ય ઘટનાને બદલવાનું નથી પણ ઘટનાતીતા (અપ્રભાવિત, ઉદાસીન) થયું તે છે. ઘટના એ સંસાર છે અને ઘટનાતીત એ ભક્તિનું ફળ છે.

જ્ઞાન અને ભક્તિનો તથા નિશ્ચય અને વહેવારનો સુભગ સમન્વય સાધનારા સંત પૂ. આત્માનંદજી ભક્તિના નવ પ્રકાર (શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા અને એકતા)માં લઘુતા (અહંકારનો નાશ), સમતા

(વીતરાગતા) અને એકતા (ભક્ત-ભક્તિ-ભગવાન એક) પર ભાર મૂકે છે.

આપણી સમસ્યા એ છે કે આપણા જીવનમાં કષ્ટ (કર્મના ઉદ્યે બાધ્યમાં પ્રતિકૂળતા) કરતા તેનો ભય (મોહનીય) વધારે છે – રાત્રે સ્વભનમાં અને દિવસે કલ્પનામાં ! ભયના પ્રકાર અનંત છે. પ્રકૃતિના વિસ્તારથી કર્મો અને જીવો અનંત છે. તેની સામે અભયનો પ્રકાર એક જ છે – પરમાત્માનું સ્મરણ-શરણ-ભક્તિ. ભક્તિની ફળશુદ્ધિ નિર્ભયતા અને વીતરાગતા છે. પરમાત્માની સ્તુતિથી અશુભ ઘટે છે, શુભ વધે છે, પુણ્યની ઉદ્ધિરણા થાય છે, પાપની નિર્જરા થાય છે, કર્મના રસ (અનુભાગ, વિપાક)માં ફેરફાર થાય છે. ભક્તામરના પાઠ - સ્તુતિથી ભક્તિ, ભક્તિથી ભાવમાં ફેરફાર (આંતરિક ભયનો ક્ષય) અને ભાવ બદલાતા કર્મ(રસ)માં ફેરફાર થાય છે.

માનતુંગસૂરિજીના સમયમાં વાહન વહેવાર જુદા પ્રકારનો હતો. તેથી નિમિત્તો પણ જુદા હતા : ગ્રાણીઓ (હાથી, સિંહ, સર્પ), કુદરત (અજિન, સમુદ્ર) અને માનવકૃત (જેલ-બેડી, યુદ્ધનું મેદાન-યુદ્ધ, રોગ).

આ ૮ પ્રકારના ભયબંજક છે શ્લોક ત્રણ દાખિકોણથી વિચારી શકાય : (૧) બાધ્ય નિમિત્ત-હાથી, સિંહ વગેરે, (૨) આંતરિક નિમિત્ત - માન આદિ કષાય, (૩) ધટના - ભોજરાજા અને દરબારીઓ. દરેક શ્લોકમાં ગર્ભિત રીતે મંત્રોની સંયોજના છે અને દરેકનું ગુણવાચક નામ છે. જેમ કે પ્રસ્તુત શ્લોક - ઉટનું નામ ‘ગજભયબંજક સ્તુતિ’ છે. અહીં ગજ એ બાધ્ય નિમિત્ત છે, ભય એ આંતરિક નિમિત્ત છે, બંજક એ સાધના છે, ભયબંજક એ પ્રયોજન છે અને ભવદાશ્રિત (પ્રભુનો આશ્રય) એ પ્રયોજનસિદ્ધિનો અમોદ ઉપાય છે.

પિંડસ્થ ધ્યાનનું સ્વરૂપ દર્શાવતા કલિકાલસર્વજ્ઞ હેમયંડ્રાચાર્ય કહે છે કે સમવસરણમાં બિરાજમાન અને અતિશયોથી શોભતા તીર્થકર પ્રભુને જે ચિંતવે

તथા તેના નિરાકાર સ્વરૂપનું જે સ્મરણ કરે તે સાધકનો પરાભવ હાથી, સિંહ, સર્પ વગેરે ઉપસર્ગથી થતો નથી. સમવસરણના ધ્યાન (શ્લોક-૩૭) પદ્ધીના છ શ્લોકમાં (૩૮-૪૬) એ પ્રકારના ઉપસર્ગનું વર્ણન આવે છે. આ શ્લોકોમાં પ્રત્યેક ઉપસર્ગ જાણે નજર સમક્ષ - પ્રત્યક્ષ હોય તેવું સચ્ચોટ વર્ણન દરેક શ્લોકના પ્રથમ બે ચરણમાં આચાર્યશ્રી કરે છે : મદોન્મત ગજપતિ ભમરાઓના ગુંજારવથી અતિશય કોષે ભરાઈને ધસી આવતો હોય, આકમણ કરવા તત્પર ખુંખાર વનપતિ (મૃગપતિ) સિંહ તરાપ મારવા તૈયાર હોય, ભયંકર કાળા સર્પનો હુતકાર, ભભુકતા દાવાનળની અજીનિશિખાઓ, રણભૂમિમાં તુમુલ યુદ્ધમાં ભયજનક કોલાહલ વગેરેના તાદૃશ્ય વર્ણનો ઉપરાંત આ શ્લોકોમાં નાદ (ધ્વનિ) અને રૂપ (આકાર)નું સંયોજન જોવા મળે છે. શ્લોકોનું ઉચ્ચારણ સુત્તિકારના હૃદયમાં આવેશ ઉત્પન્ન કરે છે. દરેક શ્લોકમાં પ્રથમ બે ચરણમાં ઉપસર્ગભ્યથી ભાવાવેશ જાગે છે. તેના અંતિમ બે ચરણોમાં પ્રભુજ્ઞના સ્મરણ-આશ્રય-કીર્તનનો મહિમા દર્શાવીને શમન કરે છે. આ કાવ્ય-ચમત્કારમાં સાધના માટેના સંકેતો છે.

શ્લોક ૩૮-૪૧માં ૪ કષાયો : ગજપતિ દ્વારા માન, મૃગપતિ સિંહ દ્વારા કોષ, અજીની ચારે બાજુ ફેલાતી જવાળા દ્વારા માયાજાળ અને મણિધર સર્પ દ્વારા લોભનું વર્ણન અભિપ્રેત છે. આત્માને સત્તાવનારા, તેના આત્મિક ગુણોનો ધાત કરનારા (આત્માના સ્વભાવરૂપ ગુણોનો તો ધાત થઈ શકે નહીં પણ તેના પર આવરણ, વચ્ચે પડદો, વિવેકનાશક ભાંતિના અર્થમાં અહીં સમજવું) કષાયો ખરેખર ભયંકર છે અને તેનાથી ઉગરવા માટે પ્રભુજ્ઞના સંકીર્તન જેવો કોઈ ઉપાય નથી. બહારથી ઉત્પન્ન થતા આવા ભયો કરતા વધુ અકલ્યાણકારી આ આંતરશત્રુઓથી બચવાનો મ્રયાસ કરવો જોઈએ એ તેનો તાત્ત્વિક અર્થ છે.

શ્રી જિનેશ્વરદેવના સ્મરણ તથા શરણનો મોટો મહિમા એ છે કે તેનાથી સર્વ પ્રકારના ભયો નાશ પામે છે (પ્રબળ ઉપકારક નિમિત્ત અપેક્ષાએ). સ્તોત્રકાર સૂરજ હવે પદ્ધી છ શ્લોકો વડે તેની પ્રતીતિ કરાવે છે. પ્રસ્તુક શ્લોક (૩૮)માં તેઓશ્રી કહે છે કે હે ભગવન્ ! જે લોકો અંતરના સદ્ગ્રાવ (સાચી સમજણ અને શ્રદ્ધા)થી પ્રેરાઈને તમારું શરણ ગ્રહે છે તેમને સામે આવી રહેલ હાથીનો પણ ભય લાગતો નથી. આ હાથી કેવો છે ? : (૧) ઈન્દ્રના ઐરાવત જેવો મોટો છે, (૨) મદ ઝરવાથી જે મલિન થયો છે, (૩) ગંડસ્થળમાંથી જરી રહેલ મદને લીધે તે કામાતુર બનેલ છે, અથવા કામાતુર થવાથી મદ ઝરે છે, (૪) ચંચળ બનીને ઢોલી રહ્યો છે, (૫) મદથી આકષાયિલ ભમરાઓના સતત સ્પર્શ-ંખ-ગાણગણાથી જે કોધાયમાન થયો છે, (૬) ભાન ભૂલીને નિરંકુશ-બેકાબૂ બનેલ છે, (૭) ગાંડો બનીને સૂંઠ ઊંચી કરીને સામેથી ઢોડતો આવે છે, (૮) મોટા દંતૂરણ અને કોઘિત ગર્જનાઓ-ચિત્કારથી ભયનું વાતાવરણ સર્જ છે. પરંતુ શ્રી જિનેશ્વરદેવનું નામ અને તેમનો મંત્ર સ્મરતા, એટલે પ્રભુના શરણો જઈને તેમના આશ્રિત થઈએ તો મનમાં કોઈ જાતનો ભય લાગતો નથી. તાત્પર્ય એ છે કે જે પરમાત્માના સ્વરૂપને જાણી લે તેને પોતાના આત્મસ્વરૂપનું પણ જ્ઞાન થઈ જાય છે. યથા :

(૧) જે એં જાણઙ્ગ સે સંક્રં જાણઙ્ગ ।

જે સંક્રં જાણઙ્ગ સે એં જાણઙ્ગ ॥

અર્થાત્ જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું;

જેણે સર્વ જાણ્યું તેણે આત્મા જાણ્યો.

- આચારાંગ સૂત્ર ૧-૩-૪-૨

(૨) જે જાણતો અર્હતને ગુણ, દ્રવ્ય ને પર્યાપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.

- પ્રવચનસાર - ૮૦

● ● ● (કમશઃ)

મનન-મંથન-અમૃતની પ્રાપ્તિ

વલભજી હીરજી ‘કેવળ’

તું પામર છો કે પ્રભુ છો ? તારે શું સ્વીકારવું છે ? પામરપણું સ્વીકારે, પામરપણું કદી નહિ જાય ! પ્રભુપણે સ્વીકાર્યથી પામરપણું ઉભું નહિ રહે ! આત્મા હું પોતે દ્રવ્યે પરમેશ્વર સ્વરૂપે જ છું – એમ જ્યાં પરમેશ્વર સ્વરૂપનો વિશ્વાસ આવ્યો તું વીતરાગ થયા વિના રહીશ જ નહિ.

આત્માનો વિશ્વાસ આવવો જોઈએ કે હું પોતે જ જ્ઞાનાંદ સ્વરૂપ છું, હું પોતે જ પરમાત્મા સ્વરૂપ છું અને રાગાદિ સ્વરૂપે નથી, એવું અંતરથી વિશ્વાસનું બળ આવવું જોઈએ. પોતાની પરમેશ્વરતાનો વિશ્વાસ, એ વિશ્વાસનું જોર એને અંતર્ભુખ કરે છે.

આનંદના નાથ એવા શુદ્ધાત્માની પ્રેમથી વાત સાંભળો છે તેને ભાવિ નિવાણિનું ભાજન કર્યું છે, અને સાંભળતા દેહથી ભિન્ન છે, કર્મથી ભિન્ન છું, રાગથી ભિન્ન છું ને પોતાથી પરિપૂર્ણ છું એ વાત એને બેસવી જોઈએ. હકાર આવતા અંદર સંસ્કાર પડતાં જાય છે.

જેને આત્માની ખરેખર રુચિ જાગે તેને ચોવીશે કલાક એનું એ ચિંતન, ઘોલન ને ખટક રહ્યા જ કરે. ‘મારે આમ છે, તેમ છે’ તેમ કરીને અનંત કાળ ગુમાવ્યો ! હવે એનું લક્ષ છોડીને અંદરમાં ઊતરી જા ! આના વિના બીજો કોઈ સુખનો માર્ગ નથી.

પરમાત્મતાત્વની વાત સાંભળવી. સાંભળતાં હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, એવા દઢ સંસ્કાર અંદરમાં પડે તો મિથ્યાત્વનો રસ મંદ પડતો જાય છે. આ જ્ઞાયકના સંસ્કારથી મિથ્યાત્વ અભાવ થવાના સંસ્કાર પડે તો સ્વભાવનો-જ્ઞાતા-દષ્ટાનો આશ્રય લેતાં સ્વાનુભવ થતાં મિથ્યાત્વનો અભાવ થાય છે.

મને મારો આત્મા જ જોઈએ તેમ માનનાર બાદશાહ છે. આત્મા અચિંત્ય શક્તિનો ધરી છે. જે

ક્ષણે જાગે તે જ ક્ષણે આનંદસ્વરૂપ આત્મા અનુભવમાં આવી શકે છે.

જીવ પોતાના દોષથી દુઃખી થઈ રહ્યો છે. દોષ એટલો છે કે પરને પોતાનું માનવું ને પોતાને ભૂલી જવું.

જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે, અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સભ્યક્તિને પરિણમે છે ત્યાં મોહ સમૂળ નાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. આત્મા સ્વભાવે સિદ્ધસ્વરૂપ છે.

આ ચૈતન્ય તત્ત્વ બહારના વેરાજથી કે જ્ઞાનના ક્ષયોપશમથી મળી જાય એવી વસ્તુ નથી. પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી અત્યંત અભાવ છે. જેમ તેલ પાણીના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, પાણીના દળમાં પેસતું નથી, તેમ વિકાર ચૈતન્યના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે. ચૈતન્યદળમાં પેસતું નથી.

આત્માને મુખ્ય રાખતા જે દશા થાય તે નિર્મળદશાને સાધન કહેવાય છે ને તેનું સાધ્ય કેવળજ્ઞાન કરવું તે છે ને તેનું ધ્યેય પૂર્ણ આત્મા છે.

એ જ્ઞાનની દિવ્યતા છે ! એ જ્ઞાન સ્વભાવની અચિંત્યતા છે. જે અવસ્થાઓ-પર્યાયો વિદ્યમાન નથી છતાં તેને જ્ઞાન વિદ્યમાનપણે જાણે છે. તો ચૈતન્ય આત્મા તો વિદ્યમાન છે, જેમાં જ્ઞાન, આનંદ આદિ ગુણોની અનંતતાનો અંત નથી એવો આત્મા વિદ્યમાન છે તેને જાણ.

બાહ્યકિયાથી નિર્જરા થતી નથી. અકખાય પરિણામ પ્રમાણે નિર્જરા થાય છે. જ્ઞાતા-દષ્ટા સ્વભાવથી એકમેક અને રાગથી જુદો છું એવા દઢ

સંસ્કાર વડે ભેદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ જ્યાલમાં આવે નહિ અને દર્શનમોહના અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે તેવો નથી. સમ્યગ્રૂદ્ધર્ણન સહિતનું મતિ-શુતજ્ઞાન તે કેવળજ્ઞાનનો અંશ છે.

પહેલામાં પહેલા આત્માને જ્ઞાનવો, આત્માને અનુભવવો. એના વિના એક ડગલું પણ ધર્મમાં આગળ નહિ ચાલે.

જિનવાણીનું મહાન લક્ષ્ણ તો એ છે કે રાગની અને નિમિત્તની ઉપેક્ષા કરાવે. આત્મા વીતરાગી સ્વરૂપ છે, જિનસ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. તેનો આશ્રય કરવાથી સંસારનો અંત આવે છે.

હું એક અખંડ જ્ઞાયકમૂર્તિ હું, વિકલ્પનો એક અંશ પણ મારો નથી એવો સ્વાશ્રયભાવ રહે તે મુક્તિનું કારણ છે.

સ્વ-પરની બિન્નાતા ભાસવી તે જ મનુષ્યજીવનની સાર્થકતા છે.

પોતે પ્રભુત્વ, વિભુત્વ આદિ અનંત શક્તિઓથી ભરેલો ભગવાન છે – એ બેસવું કઠિન પડે. અરે ચૈતન્ય પ્રભુ ! તારી શક્તિના એક ટંકારે તું કેવળજ્ઞાન લે એવી તારી તાકાત ને તું કહે છે કે મને મારું સ્વરૂપ ન સમજાય – એ કહેતા તને શરમ નથી આવતી ?

દેહરૂપી દેવળમાં જિનસ્વરૂપ આત્મા બિરાજમાન છે તેનો વિશ્વાસ કરતાં પર્યાયમાં જિન પ્રગટ થાય છે. ચકવત્તની સંપદા કરતાં પણ જેનો એક સમય અતિ કિંમતી છે, એવો આ અતિ હુલબન્ધ મનુષ્યભવ અનંતા ભવ-ભ્રમણના અભાવ માટેનો ભવ છે.

બીજાની સાથે લડવું, જીતવું ને બીજાને પાછા પાડવા એ તો કાયરનું કામ છે. આત્મામાં ઊતરવું એ શૂરવીરતા છે.

બહારની સંપદા એ ખરેખર સંપદા નથી.

ચૈતન્યનું સ્મરણ તે જ સાચી સંપદા છે. વૈરાગ્ય તો તેને કહીએ કે પર તરફથી ખસીને જે અંદરની મહાસત્તા તરફ ફળ્યો છે. પુણ્ય-પાપથી ખસીને અંદરમાં જવું તે વૈરાગ્ય છે.

આત્મ-અનુભવ સિવાય બધાં મીંડા છે. લાખ કષાયની મંદતા કરે કે લાખ શાખ ભણે પણ અનુભવ વિના બધાં મીંડા છે, અને કાંઈ ન આવતે છતાં આત્માનો અનુભવ થયો તો બધું આવે છે.

આ આત્મા આનંદની મૂર્તિ છે. અંતરમાં આનંદ જ ભર્યો છે. એની વાત સાંભળવી એ માંગલિક છે.

જેણે આત્મા જ્ઞાયો તેણે કેવળજ્ઞાનીના પેટ જ્ઞાયા, ભાવશૂત જ્ઞાયું એને જ્ઞાનવાનું કાંઈ બાકી રહ્યું જ નથી. આખી દુનિયા જાણી લીધી.

જૈન એટલે અંતરમાં સમાય તે જૈન છે. બહારના જેટલા ઊભરા આવે એ તો બધા પ્રકૃતિના ચાળા છે. વિકલ્પ ઊઠે એ પણ બધા પ્રકૃતિના ચાળા છે. બહારનું જે બધું થાય છે એ તો બધું પુદ્ગલ - પરાવર્તન અનુસાર થયા જ કરે છે.

હું જ્ઞાયક હું.... જ્ઞાયક હું... જ્ઞાયક હું એમ અંદરમાં રટણ રાખ્યા કરવું. જ્ઞાયક સન્મુખ એકાગ્રતા કરવી. પોતાની પર્યાયને જ્ઞાયક સન્મુખ વાળવી અનંતો પુરુષાર્થ માર્ગે છે.

આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. અનંત સર્વજ્ઞતાની મોટી પાટ છે. અનંત અનંત ગુણોની પૂર્ણાંદરી ભરેલી મોટી પાટ છે. વસ્તુ છે. તે સદાકાળ એવી ને એવી જ રહી છે. એવો અંદરમાં વિશ્વાસ આવવો જોઈએ.

અંતર્મુખ અને બહિર્મુખ એ બે મોટી વાત છે. વસ્તુ આખી અંતર્મુખ પડી છે. તેમાં અંતર્મુખ થવું એ જરૂરી છે.

મિથ્યાત્વ એ જ સંસાર છે, અને સમ્યક્ત્વ એ મુક્તિ છે. આત્માનો અનુભવ થયો એટલે સમ્યગ્રૂદ્ધર્ણન થયું. મુક્તિનો માર્ગ શરૂ થયો.

● ● ●

શ્રી પર્યુષણ મહાપર્વ

પૂર્ણિમાબેન શાહ

એક મહાસતીજીએ એકવાર શ્રાવકોને સવાલ પૂછ્યો કે “બારમાંથી ચાર જાય તો બાકી શું રહે ?” બધાએ જવાબ આપ્યો, “બારમાંથી ચાર જાય તો આઠ રહે.” મહાસતીજીએ કહ્યું, “ગણિતની રીતે આ જવાબ સાચો છે, પરંતુ વર્ષના બાર મહિનામાંથી જો ચોમાસાના ચાર મહિના જાય તો કંઈ જ ન રહે ! કારણ કે, વર્ષાત્રાતુના ચાર મહિના ન હોય તો બાકીના આઠ મહિનાની કંઈ કિંમત નથી. વર્ષાત્રાતુ ન હોય તો પાણી ક્યાંથી મળે ? અને ખેતીવાડી, પાણી, અનાજ-ફળફળાદિ ન હોય તો જનજીવનનું શું થાય ? જીવવાનું જ મુશ્કેલ થાય ને ?”

ધાર્મિક દસ્તિએ પણ વર્ષાત્રાતુના આ ચાર મહિના અત્યંત મહિલાના છે. જૈનધર્મમાં આ ચાર મહિનાને ધર્મની વર્ષાત્રાતુ તરીકે જિનેશ્વર દેવોએ માન્ય કર્યા છે. એને ‘ચાતુર્મસ’ તરીકે ઓળખાય છે. ચાતુર્મસ એ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. આ ચાતુર્મસમાં સાધુભગવંતો અને સાધ્વીજીઓ ઉપાશ્રયમાં સ્થિરતા કરે છે અને શ્રાવક તથા શ્રાવિકાઓ ત્યાં ધાર્મિકકિયાઓ તથા વ્યાખ્યાનનો લાભ લે છે.

જૈન ધર્મમાં મુખ્ય બાર પર્વની ગણના કરવામાં આવે છે. તેમાં પર્યુષણપર્વને મહાપર્વની ઉપમા આપવામાં આવે છે. શ્રાવણ વદના છેલ્લા ચાર દિવસ અને ભાદરવા સુદના પહેલા ચાર દિવસ એ પર્યુષણ મહાપર્વના આઠ દિવસો છે. છેલ્લો આઠમો ભાદરવા સુદ-૪નો દિવસ સંવત્સરી પ્રતિકમણનો દિવસ હોય છે. એ વર્ષ દરમ્યાન જાણતાં-અજાણતાં થયેલા પાપોનો પ્રાયશ્ચિત્ત કરવાનો દિવસ છે. સાધુભગવંતોની નિશામાં આ સંવત્સરી પ્રતિકમણ

કરવામાં આવે છે. આમ, પર્યુષણપર્વ એ પાપનો ક્ષય કરવાનું અને પુણ્યનું ભાથું બાંધવાનું, અનોખું અને અનન્ય પર્વ છે. તો આ પાપ અને પુણ્ય શું છે એ જાણીએ. આ પાપ અને પુણ્યને જાણવાની આવશ્યકતા શું છે ? એ પણ જાણવાની જરૂર છે. આના સંદર્ભમાં એક આચાર્ય મહારાજસાહેબે શું કહ્યું છે, તે એમના જ શબ્દોમાં જોઈએ –

“મોટા માધાંતાઓને પણ એકાંતે અસાર એવા આ સંસારમાં અવનવી આફતો આવ્યા જ કરે છે. તેથી આપત્તિઓથી બચવા માટે અને સાચું સુખ પ્રાપ્ત કરવા માટે, પાપ ઘટાડીને ધર્મ વધારવો જોઈએ.”

“હે મુમુક્ષુ ! તમે ધર્મપ્રેમી છો ! છતાં આ કળિકણમાં સર્વત્ર પ્રસરેલા સ્વાર્થ અને પાપના વાતાવરણમાં તમે પણ ખરડાયા હશો. આ ભયંકર દોષો તમારું ભયંકર અહિત કરશે.”

“હે પુણ્યશાળીઓ ! આજીવિકાદિ અનેક ચિંતાઓમાં ફસાયેલા તમને આ માનવભવને સફળ કરવા માટે અને આત્મકલ્યાણ કરવા માટે, ધર્મ વધારવાની અને પાપ ઘટાડવાની ભાવના પણ ઘણીવાર થતી હશે જ. તો તમને શું લાગે છે ? તમારો આ જન્મ સંસારની યાત્રાનો જન્મ છે કે સિદ્ધત્વની યાત્રાનો ? તમારા વર્તમાન જીવનની જે અમૂલ્ય ક્ષણો પસાર થઈ રહી છે એ તમને સંસાર ભણી લઈ જઈ રહી છે કે, તમને સિદ્ધાલયની તરફ લઈ જઈ રહી છે, તે જરા વિચારો તો ખરા !”

સંસારની પ્રવૃત્તિ છૂટે અને ધર્મની પ્રવૃત્તિ વેગવાન થઈ જાય ત્યારે અનિવૃત્તિની અવસ્થા આવે છે. ધર્મ સિવાયની કોઈ પ્રવૃત્તિ થાય નહીં તેવી

(અનુસંધાન પાના નં. ૨૭ પર...)

પર્યુષણ પર્વનો પાવન સંદેશ : કર્મથી ધર્મ તરફ

પાર્શ્વલબેન જી. ગાંધી

પર્યુષણ એ દરેક ભવ્યાત્મા માટે આત્મસ્વરૂપની ઓળખાણ કરવાની પાવન પળ લઈને આવે છે. અમૃત્ય એવો માનવભવ, આયક્ષેત્ર, ઉત્તમકૃણ, સાધુ-સાધ્વીનો સત્તસંગ વગેરે તો મજ્યા જ છે ત્યારે સાચો માર્ગ જ્ઞાણી તે તરફ કદમ ભરવાથી આત્મા જરૂર પરમાત્મા બની શકશે. પર્યુષણ પર્વ એ કષાયોના કચરાને કાઢીને આત્માને ઉજજવળ બનાવવાનું પર્વ છે. અનંતકાળથી આપણો આત્મા કર્મરોગથી પિડાઈ રહ્યો છે તેની પાછળ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગોની ગાંઠો પડેલી છે તેને નિર્મૂળ કરી આત્માનું આરોગ્ય પ્રાપ્ત કરવાનું પર્વ છે. પુદ્ગલની પાછળ તો અનેક ભવો કાઢ્યા, આત્મરાજને મેળવવા પુરુષાર્થ કર્યો નહિ, હવે સમ્યક્ પુરુષાર્થ કરવાનો છે. કર્મોના કચરાને દૂર કરી આત્માને ઉજજવળ બનાવી અને પાપકર્મોની નિર્જરા દ્વારા હોળી કરવાનું પર્વ છે. આ તકે નિંદા, સ્વપ્રશંસા, ઈર્ઝિ, અસ્ફૂયા છોડીને આત્મગુણો કેળવવાનું પર્વ છે.

આ પર્યુષણમાં પુદ્ગલના ભપકા નહિ પરંતુ સાદાઈની સજાવટને આવકારીએ. તન-મનમાં તૃષ્ણાની આગ ભડકદ સળગી છે તેને સંતોષની સરવાળીથી બુઝાવીએ. બધું જ મેળવી બધું જ ભોગવવાની અદમ્ય વાસનાને ત્યાગના જળથી શાંત કરીએ. અહીં-તહીં ખૂબ ભટક્યા, હવે તે છોરી ધર્મધ્યાનમાં, તપ-ત્યાગમાં આગળ વધીએ. પર્યુષણ એ પશ્ચાત્તાપની પાવક જવાળામાં પવિત્ર બની, ક્ષમાધારણ કરી, કોધનો-પાપોનો ત્યાગ કરવાની પ્રેરણ આપે છે. આત્મતત્ત્વની આરાધનામાં પ્રવૃત્ત બની, કંજિયા-કંકાસ-ખણખોદનો ત્યાગ કરી આરાધક બની, ચોરાસીના ચક્કરમાંથી મુક્ત બની, મોક્ષસુંદરીને વરવા, આત્મીય સુખને પ્રાપ્ત કરવા જે ખોટી માન્યતા, ખોટી સમજણ છે તેને ત્યાગી મોક્ષમાર્ગ પર આગળ

વધવાની પ્રેરણ આપતું અમૃત્ય પર્વ છે.

પર્યુષણને મહાપર્વ શા માટે કહેવાય છે ? તેની પાછળ એવું કારણ છે કે કર્મબંધનના મુખ્ય પાંચ કારણ છે - મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભયોગનું સેવન. હવે જ્યારે આત્માની અમૃત્ય લક્ષ્મીને પ્રાપ્ત કરવી છે ત્યારે કર્મબંધન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે. આ માટે મિથ્યાત્વની ગાંઠોને છોડી સમ્યક્ દષ્ટિ - સાચી શ્રદ્ધા અપનાવવી પડે. અવ્રતની અવળાઈને છોડી, વિરતિધર બની, પ્રમાદને ત્યાગવાનો છે. પાંચ ઈન્દ્રિયના વિષયોને ત્યાગી કષાયભાવોથી વિરામી, પાપકારી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત આ મનરૂપી માંકડાને સંયમ દ્વારા વશમાં કરી, મન-વચન-કાયાના યોગોને ધર્મમય બનાવવાના છે. એટલું જ નહિ, હિંસા, ચોરી, જૂઠ, અબ્રથ તથા પરિગ્રહ એ પાંચને ત્યાગી અહિંસા, અચોર્ય, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની આરાધના દ્વારા જ મોક્ષમાર્ગ તરફ આગળ વધી શકાશે. તો તે વાસ્તવિકતાને સમજ તેનું આચરણ કરવાનું છે. આવી આરાધના દ્વારા જ પર્યુષણને મહાપર્વ બનાવી શકાય છે. આ પર્વની આરાધના અનેક જ્ઞાની ભગવંતો કરી રહ્યા છે. અદીક્ષીપમાં સંભ્યાતા શ્રાવક-શ્રાવિકાઓ પણ આ દિવસે ચૌવિહારો ઉપવાસ, પૌષ્ણ અંગીકાર કરી કાઉસગ્ગમાં લીન બની, દેહાધ્યાસ છોડી સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની આરાધના વડે પોતાના આત્માને ભાવિત કરી રહ્યા છે. એ બાબત જ આ દિવસની મહત્વાની સાબદી પૂરતી છે.

પર્યુષણ પર્વ એ સંદેશ આપે છે કે પામરમાંથી પરમાત્મા બનવું હોય, શૂન્યમાંથી સર્જન કરવું હોય તો મળેલ મનુષ્યભવનો ફાયદો ઊઠાવી લે. સર્વ દુઃખોનો અંત કરી મુક્તિના મહામૂલા સુખો મેળવવા હોય તો આજે જ નહિ, અત્યારે જ સાબદો થઈ જા,

કારણ દેવલોકના સુખો કરતા પણ જૈનશાસન મેળવવું અધ્યરું છે. કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન અને કામધેનુ ગાય કરતાં પણ જૈન ધર્મ ચરિયાતો છે. ચક્રવર્તીના ચક્રરત્ન કરતાં જિનશાસનના ચારિત્રરત્ન ઉંચા છે. શાસન મળ્યું છે તો તેમાં આસન જમાવી લે. આયુષ્ય બંધાય ત્યારે જીવ જો સમજણના ઘરમાં હોય, શાસન સમર્પિત હોય તો પરિત સંસારી બની શકે છે. સંસાર વધારવો કે ઘટાડવો તે આપણા હાથમાં છે. એકબાજુ પુંડરિક અને બીજી બાજુ કુંડરિક. માત્ર રાં દિવસના સંયમમાં પુંડરિકે ઉત્ત સાગરોપમની સર્વાર્થસિદ્ધ દેવતાની રિદ્ધિને પ્રાપ્ત કરી, જ્યારે કુંડરિકે રાં દિવસ રાજ્ય ભોગવ્યું અને આસક્તિને કારણે સાતમી નરકે ઉત્ત સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. જે વાવીએ તે જ ઊરો. આ ભવ મજ્યો છે તો સુખો ભોગવવાને બદલે ત્યાગીએ. ભોગવીને નહિ, ભગવાન બનીને તેને સાર્થક કરીએ. આ ભવમાં વર્તમાનને ન જોતાં ભવિષ્યને નજર સમક્ષ રાખવાનું છે. મોક્ષ આ જ ભવે સુલભ ન બને પણ તેનું રિઝર્વેશન તો થઈ જ શકે.

આપણો આત્મા જ આપણને સ્વામી કે નોકર બનાવે છે. સિદ્ધશિલામાં વસવાટ કે સાતમી નરકે નિવાસ એ આપણે જ નક્કી કરવાનું છે. જ્યાં સુધી કષાયોની ઉપશાંતતા આવે નહિ, ઈન્દ્રિયો પર સંયમ આવે નહિ, રાગ-દ્વેષયુક્ત વિચારો છૂટે નહિ ત્યાં સુધી આપણે રખડતા જ રહેવાના. સાધના કરવી, આરાધક બનવું, શાસનમાં આસન જમાવવું તે આપણા હાથની વાત છે. બહારની કોઈપણ વસ્તુ આપણી સજાગતા હોય તો આપણને નડી શકતી નથી. આપણે જગ્રત બનીશું તો જ આપણે મોક્ષમંજિલ તરફ કદમ માંડી શકીશું.

ચરમ તીર્થકર મહાવીરસ્વામીના જીવનને જોઈએ. નયસારના ભવમાં સમકિતી બની રિઝર્વેશન કરાવ્યું પણ શાસનમાં આસન ન જમાવ્યું. રહ ભવો સુધી કંઈને કંઈ ભૂલોની બ્રમજા સર્જ. પાત્રા અને રજોહરણ લઈને પણ ત્રિદંડી બન્યા અને ભવોની

શૃંખલા વધારી દીધી. માનવભવ મેળવ્યો, જિનવાણી સાંભળી, અરે ! સાધુપણું લીધું છતાં હારી ગયા. નિયાણું કરીને સાતમી નરકે પહોંચી ગયા. તેમનો જન્મ એ જ સંદેશ આપે છે કે પહેલા એવી કરણી કર કે મનુષ્યભવ મળે. એ પછી સાધુ-સાધ્વીનો સત્સંગ કરી, ત્રઠારી બની શાસનમાં આસન જમાવ. આસન જમાવ્યા પછી જો શ્રદ્ધા છૂટી ન જાય. શ્રદ્ધા દઢ બનાવ્યા પછી ચારિત્ર અંગીકાર કરીને, આરાધક બનીને, ભગવાનના માર્ગ જ ચાલવાનું છે. તેમાં જ ટકી રહેવાનું છે. ધર્મ માટે જ જન્મ ધારણ કરી અને ધર્મ માટે જ મરીશું તો જીવન સફળ બની જશે. માનવભવ મળ્યો છે ત્યારે સંસાર ઘટાડી, જન્મ મરણ ઘટાડીએ તો માનવભવ સાર્થક થઈ જશે. ■ ■ ■

શ્રી પર્યુષણ મહાપર્વ

(પાના નં. ૨૫ પરથી ચાલુ...)

અવસ્થામાં રહેવાથી આત્મા બધા કર્માને ખપાવીને પરમપદની પ્રાપ્તિ કરી શકે છે.

પરંતુ આમ ત્વરાથી થતું નથી, કેમ કે આપણે સંસારમાં જેટલા લીન થઈએ છીએ તેટલા ‘સ્વ’માં લીન થતાં નથી !

“સ્થિર થાય, તે સિદ્ધ થાય !”

‘પર્યુષણ’ એટલે ચારે બાજુથી આત્મામાં રહેવું તે.

શ્રી પર્યુષણ મહાપર્વના આઠ દિવસોમાં પુષ્યશાણી આત્માઓ મહદૂઅંશે ધારે તો આવી અનિવૃત્તિ અવસ્થા અને સ્થિરતા પ્રાપ્ત કરી શકે છે. તેથી જ પર્યુષણ મહાપર્વને માનવભવની વર્ષાત્રણતુ કહેવામાં અતિશયોક્તિ નથી ! ધર્મનિષ આત્માને સત્ત-દેવ-ગુરુ-ધર્મની અનુકૂળતા મળે તો તેનાથી તેને વધુને વધુ ધર્મધ્યાન પણ થતું જાય છે અને તે આત્મકત્યાણના પંથે આગળ વધતો જાય છે. અંતે તે સિદ્ધાલયમાં સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે અને ચિરકાળ પર્યત અનંતસુખનો ભોક્તા બને છે.

● ● ●

પર્યાષણ - આત્માની સમીપતા

ભાનુલેન ડી. શાહ

મહામૂલ્યવાન માનવજીવનમાં બદલાવ આવ્યા કરે છે. તેના માટે અનેક પર્વ છે. હોંશે હોંશે ઉજવતા પણ હોય છે, પણ પર્યુષણ પર્વ ગર્વ લેવા જેવું આધ્યાત્મિક પર્વ છે. સર્વ સામે શક્ય તેટલું પ્રભુનામ લેવા માટે પડકાર ફેરે તેવું છે. આ પર્વ માત્ર ત્યાગ, વૈરાય, સંયમને સ્વીકારવા માટેનું છે. અહીં ભોગને સ્થાન નથી. ત્યાગનું જ અતિ મહત્વ છે. નિયત ધાર્મિક અનુષ્ઠાનો અને તપ્ય દ્વારા કર્મને તોડવા માટે સંવર-નિર્જરાને પ્રથમ સ્થાન આપવાનું છે. બીજા પર્વો મોજશોખ અને ભોગને પ્રાધાન્ય આપે છે. પર્યુષણ પર્વમાં શક્ય તેટલું છોડવાને મુખ્ય ગણવામાં આવે છે. જેટલું છોડીએ તેમાંથી વધુ આપણાને મળતું હોય છે.

રોજિંદી ઘટમાળમાંથી સમય કાઢીને દેવદર્શનને જાવ તો સમયનો ત્યાગ તમારા મનને શુભ ભાવમાં રાખશે. મંદિરે આવવા માટે હોંશે હોંશે પગલાં તે ભણી ઉપડશે. દેવદર્શન દેવ વિષેની તમારી શ્રદ્ધાને મજબૂત કરશે. તેમના જીવનચરિત્ર જાણવા વિશેની તાલાવેલી જગાવશે. મનને ભક્તિમય કરી દેશે. ધાર્મિક અનુષ્ઠાનો તમારી સમતામાં વૃદ્ધિ કરશે, પાપથી પાછા વળવાની, કરેલાં પાપોની કથા માંગવાની ઉત્કૃષ્ટ ઈચ્છા જગાવશે. વ્યાખ્યાન કે જિનવાણી શ્રવણમાં ધર્મ વિશે જાણવાની આતુરતાને કારણે એકાગ્રતા કેળવાશે. તેમાં જે ન સમજાય તેનું સમાધાન પણ થઈ જશે. આમ, નવતત્ત્વની સમજા વિશે સ્પષ્ટ થયા પછી તેમાં આસ્થા ખૂબ વધશે. પુદ્ધગલની વિનશ્વર દુનિયામાંથી મન હટી જશે અને આત્માનું જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા વધશે. તેને કર્મથી હળવો કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળશે.

આપણે પ્રાતઃકાળ અને સાયંકાળની સુતિમાં દેવદર્શનની મહત્વા ગાઈએ છીએ —

“દર્શનં દેવદેવસ્ય, દર્શનં પાપનાશનં,
દર્શનં સ્વર્ગસોપાનં, દર્શનં મોક્ષ સાધનં.”

રોજેરોજ તો સંસાર આપણાને વળગેલો રહે છે, પણ સાત્ત્વિક દિવસોમાં(પર્વમાં) પ્રભુદર્શન વિનાનો એક પણ દિવસ નકામો ન જવો જોઈએ. દેવદર્શન અત્યાર સુધી કરેલાં પાપોનો નાશ કરી નાબે છે. દિલના ઊંડાશમાંથી આવતો પ્રભુભક્તિનો, શ્રદ્ધાનો, આસ્થાનો સદ્ગ્રાવ પાપકર્મનો, પાપાશ્વવનો જડમૂળથી છેદ ઉડાડી દે છે. આ સર્વશ્રેષ્ઠ દિવસો સ્વર્ગની સીરી પર પગલાં મંડાવે તેવાં છે. આત્માનું ઊર્ધ્વકરણ કરવાનું છે. આઠ દિવસોમાં કોઈ અધમ કાર્ય, આત્માને અશુદ્ધ કરતું કાર્ય ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. મનુષ્યજીવનનું ધ્યેય કર્મમુક્તિ, કર્મરહિતતા છે અને અંતે મુક્તિપદની પ્રાપ્તિ તે છે.

આઠ દિવસ આઠ કર્મનો નાશ કરવા માટે છે. પ્રવચન સાંભળો, આગમવાણીને સમજો, સામાયિકમાં ધર્મગ્રંથો વાંચો અને જ્ઞાનાવરણીય કર્મનું જોર હળવું કરો, આત્મામાં, ગુરુમાં, પ્રભુમાં ખૂબ શ્રદ્ધા વધારો. તે જ આપણા જીવનનો આધાર છે, ઉદ્ધાર છે, બેલી છે, ભવજળમાંથી જીવનનૈયા પાર ઉતારનાર છે, તે દર્શનાવરણીય કર્મનો નાશ કરશે. ધર્મ કરવાના દિવસોમાં અંતરાયો તો આવવાનાં જ, મહેમાનો આવી જાય, બીમારી શરીરને પકડી લે, ઘરડાં માણસોની સેવામાં સમય આપવો પડે, છતાં આ બધા અવરોધો મક્કમ મનથી પાર પાડી અને ભક્તિ કે અનુષ્ઠાનોને બિલકુલ ન ભૂલો. ધર્મપુરુષાર્થ ચાલુ જ રાખો. આત્મજ્ઞાન, આત્મપિદ્જાણ કરવા

માટેના પુરુષાર્થમાં વીર્ય ફોરવો. “હિંમતે મર્દા તો મદદે ખુદા.” યાદ રાખીને જે કંઈ સારું કરીએ છીએ, કરવાનો વિચાર છે તેમાંથી પાછાં પગલાં કદી ન ભરવાં. ધર્મ પ્રવૃત્તિ ચાલુ જ રાખવી. પહેલાં બહારનો કચરો ઘણો ગ્રેમથી ભર્યો છે તેથી વેદનીય કર્મો તો આવવાના. તેને શરીરનો ધર્મ સમજાને તેમાંથી પાર ઉત્તરવું. શરીરને પુનઃ સ્વસ્થ કરીને આ દિવસોમાં ધાર્યું કામ પાર પાડવું. આપણા કાર્યો ‘સર્વ સુખાય, સર્વ હિતાય’ થતાં હોય છે, તેથી નામ-ગોત્ર કર્મ પણ ઉચ્ચકક્ષાના બંધાય છે. આયુષ્ય કર્મ એક જ વાર બંધાય છે. તેથી મનને સદા અતિ ઉચ્ચ સદ્ગ્રાવોમાં રાખવું, જેથી સદ્ગતિ મળે. મોહને તો આ દિવસો દરમ્યાન કદી મનમાં આવવા જ ન દેવો, જેથી મોહનીય કર્મો આત્માને ભારે કરી નાબે. આ કર્મ જ આત્માનું બૂઝું કરનાર છે. તેથી પર્યુષણમાં તેનો નાશ કરીને કદી તેની લાલચમાં પડવું નહીં. આ જન્મમાં ધર્મબીજ વાવી દીધું હોય તો કોઈપણ જન્મે તે ફળશે. અને સતત આપણને ધર્મ કરવાની, પ્રભુની પૂજા, ભજના કરવાની સ્ફૂરણા આવ્યા કરશે. તેમાં વૃદ્ધિ થશે અને આ ધર્મબીજ વટવૃક્ષ બની જતાં તેની છાયામાં આપણું મન, આત્મા સહારો મેળવીને વધુ ને વધુ સદ્ગ્રાવી થશે. ઉત્તમ ગતિ મેળવીને સદા શાંતિ, સુખ, સમતા મેળવશું.

આ દિવસો દરમ્યાન મહાવીર જન્મ કલ્યાણક પણ ઉજવાય છે. તે દિવસે મહાવીર પ્રભુના સ્તવનો, તેમનું જીવનચરિત્રનું વાંચન થાય છે. દેરાસરમાં બોંતેર દીવડાઓ પ્રગટાવાય છે. પારણામાં પોઢાડેલા તેમને સૌ હિંચોળતાં જાય છે. અદ્ભુત આંગી કરવામાં આવે છે. ચૌદ સ્વર્ણાંઓ ઉતરે છે, દેરાસરમાં ભવ્ય વાતાવરણ સર્જય છે.

“મહાવીર મહાવીર જપતા જપતા, દુઃખ દરિદ્ર જાવે, સુખ સંપત્તિ, યશ, લક્ષ્મી, સૌ અનાયાસ પાવે.”

મહાવીરનું નામ લેતાં જ સમગ્ર ઊર્મિતંત્ર ઉર્ધ્ણના હિલોળે થઢે છે. ચેતાતંત્રમાં આનંદ,

ઉલ્લાસની છોળો ઉતે છે. આ દિવસ અતિશય ભક્તિભાવથી મહાવીરના ગુણલા ગાતા ઉજવાય છે. આવું અભૂતપૂર્વ અસ્તિત્વ ફરી આ પૃથ્વી પર જન્મ લેશે કે કેમ તેના વિશે શંકા થાય છે, વિચારમાં પડી જવાય છે. કર્મના અતિમોટા દગ સામે લડવાની અને સર્વને જગ્મૂળથી ઉભેડી નાખવાની શક્તિ માત્ર મહાવીરમાં જ જોઈ છે. મહાવીરસ્વામીના ઉપદેશની એકાદ વાત જો આચરણમાં મૂકીએ તો આપણું જીવન ધન્ય બની જાય. પૃથ્વી પરનું આવાગમન ટળી જાય.

અંતરતમને કષાયો, વિભાવો, વિષયો, રાગ-દ્રેષ, વેરઝેર વગેરેથી દૂર કરીને અરીસા જેવો સાફ-સુથરો કરનાર મહાન દિવસ ક્ષમાપનાનો છે. સંસારીઓમાં રાગ-દ્રેષ સામાન્ય થઈ પડ્યા છે. મનને રાગદ્રેષથી ખાલી ન કરીએ તો ચોખ્યું કેવી રીતે થાય ? તેથી હોઠથી માત્ર લુઝ્ખા શબ્દો ઉચ્ચારિને નહીં પણ આત્માના અતિ શુદ્ધ ભાવથી સામા માણસની ક્ષમા માણીએ, આપીએ. ક્ષમાભાવપૂર્ણ હૈયું રાખીએ તો પરિવારમાંથી વેરઝેર જતા રહે અને સૌના મન સ્ફટિક જેવા શુદ્ધ થઈને કર્મને કાપતા જાય. પ્રતિકમણથી તન, મન, આત્મા બધાનાં પાપ પશ્ચાતાપના ક્ષમાના જળમાં ધોવાઈ જઈને આપણું સમગ્ર અસ્તિત્વ શુદ્ધ થઈ જાય. સૌ રંગે ચંગે પ્રભુને યાદ કરતા આનંદથી જીવી શકે.

પર્યુષણ-આત્માની સમીપ રહેવાનું પર્વ છે. તો જેની નજીક રહીએ તેના ગુણોને અપનાવવા પડે ને ! અંતરંગ સાધના, આરાધના, ઉપાસના સતત થવી જોઈએ. શાંતિ, શાતા, સમતા વિપરીત પ્રસંગોમાં પણ આપણાથી દૂર જવી ન જોઈએ. વિષય, કષાય જેવા વિભાવો આત્માના ભાવ નથી, તેથી તેને કેમ અપનાવાય ? ભક્તિ, ભજનગાન, પૂજા, પ્રદક્ષિણા, પ્રક્ષાલન-આ બધા શુભ ભાવો છે. તેનાથી આપણું મન, આત્મા પ્રભુમય રહે છે. માત્ર આઠ દિવસ નહીં પણ રોજિંદા વ્યવહારમાં તેને અપનાવવાના છે. પ્રભુનું નામ હોઠ પર

ગણગણાટ કરતું હોવું જોઈએ. ભક્તિગીતો રસનાથી રસપૂર્જ રીતે ગવાતા રહેવા જોઈએ. મૂર્તિનું દર્શન આપણા બંને નેત્રોથી અપલકપણે થવું જોઈએ, ભક્તિસંગીતની મીઠાશ, સુમધુરતા કાનને હષણિત કરી દે તેવી હોવી જોઈએ, પ્રભુની પૂજા, પ્રતિમાજીનો સ્પર્શ હાથને આહૃલાદથી આનંદિત કરી દે તેમ થવું જોઈએ, પગ પ્રભુના વંદન, દર્શન માટે દેરાસર ભણી જવા ઉતાવળા થતાં રહે, પ્રભુજીને નમાવેલું મસ્તક અહમ્મથી ખાલી થઈને હળવાશથી અર્થના, પ્રણામ માટે ઉત્સુક હોવું જોઈએ. મન આ બધી ભાવુક, ધાર્મિક પ્રક્રિયાના સાક્ષી થઈને સમગ્ર અસ્તિત્વ ચેતનાસભર થઈ જાય, સુખાનંદથી પરિપ્લાવિત થઈ જાય, આ રીતે રોજ આત્મામય, પ્રભુમય રહી શકાય.

આત્મા દેહ નથી અને દેહ આત્મા નથી, એવી સમજણ બરાબર મેળવી લઈએ તો આત્માની પૂજના, ભજના માટે દેહને સ્વસ્થ રાખવા સિવાય, કોઈ ભોગ, ઉપભોગ માટે તેની આસક્તિ રાખવાની જરૂર નથી. દેહદેવળમાં, મનમંહિરમાં બિરાજેલા આત્માને જ મહત્વ આપો, તેની પિછાણ કરો, તેને યાદ રાખીને પ્રત્યેક નાના-મોટાં કાર્યો કરો. મનને શુદ્ધ, આભિન્દુ ભાવમાં રાખો. આઠ દિવસમાં જાગૃતિપૂર્વક કર્મો કાપવા માટે જે પુરુષાર્થ કર્યો છે, તે સર્વને પ્રત્યેક દિવસ પર્યુષણનો છે એમ માનીને ચાલુ રાખો, રોજ પર્યુષણ ઉજવો, આત્માને કર્મરહિત કરતા જાવ. પ્રભુમય થતાં જાવ. શુદ્ધ આત્માના ભાવોને સેવતા જાવ. આમ કરવાથી આપણો દરેક દિવસ ભક્તિમય, ભગવાનમય, સર્વોત્કૃષ્ટ રીતે પસાર થશે અને જીવન ધન્ય બની રહેશે.

કરો ત્યાગ અને તપ,
પ્રભુનામનો, સ્મરણનો કરો જપ.
કરો દર્શન પ્રભુશ્રીના રોજ,
મન ખુશખુશાલ, મળશે મોજ.

કરો સામાયિક, પ્રતિકમણ,
વધે સમતા, પાપનું થાય અતિકમણ.
કરો ભક્તિ, વંદના, પૂજના,
થશે નિત્ય ભગવત્તની ભજના.
કરો જિનવાણી-શ્રવણ હંમેશ,
મનમાં ગુજરી પ્રભુ-ગુરુના આદેશ.
કરો સત્કર્મની અનુમોદના,
દુષ્કર્માની નામંજૂરી, અવહેલના.
કરો પ્રભુની આરતી મંગલદીવો,
ગુણ, પ્રભુ મનમાં સદાય જીવો.
કરો કર્મ કમ આઠ દિનમાં,
ગુણ ગાઓ મનને પરોવો જિનમાં.
કર્મો છે આત્માને ચોંટાતા અદ,
આત્મા શુદ્ધ રાખો, થશે નદ.
ચોખ્ખો આત્મા પહોંચશે સિદ્ધાલય,
જ્યાં કર્મો નથી સદૈવ સુખાલય.

● ● ●

તપની આરાધનાનું પર્વ - પર્યુષણ મહાપર્વ

(પાના નં. ૩૪ પરથી ચાલુ...)

ઉપસગ્રો આવે, રોગ આવે કે શરીરને કોઈ છેદી નાખે છતાં પણ તેઓ સ્વરૂપથી ચલિત થતાં નથી..

(૧૨) ધ્યાન : ઉપયોગ એક જ્ઞેયવસ્તુમાં અંતમુર્દૂત લીન થાય - એકાગ્ર થાય તેને ધ્યાન કહે છે. આર્ત અને રૌદ્રધ્યાન તે અશુભ ધ્યાન છે, ધર્મધ્યાન અને શુકલધ્યાન તે શુભ ધ્યાન છે. ધ્યાનરૂપી અજીનથી કર્મો બળી જાય છે અને સાક્ષાત્ મોકશની પ્રાપ્તિ થાય છે.

પર્યુષણ મહાપર્વ દરમિયાન આપણે શક્તિ અનુસાર તપની આરાધના કરીએ. આ મહાપર્વનું આગમન આપણા અંતરના ઓરડાને દિવ્ય પ્રકાશથી પ્રકાશિત કરે, જીવનને મહોત્સવ બનાવે એવી મંગલ કામના.

પર્યુષણ પર્વનો મહિમા

વિભાગેન એસ. મહેતા

જૈન ધર્મચાર્યો - પૂર્વચાર્યોએ સામાન્ય જીવોને કલ્યાણના માર્ગે પ્રવર્તિવવા માટે પરમાર્થ બુદ્ધિથી આઠ દિવસના પર્યુષણ પર્વનું આયોજન કરેલ છે. જૈનો માટે આ મહાપર્વનો ભારે મહિમા છે. આ લોકોત્તર પર્વ છે. એની આરાધના મંગલરૂપ છે. આ પવિત્ર પર્વના દિવસોની મંગળતા, પવિત્રતા અને ઉચ્ચતા હૃદયમાં કોતરાઈ જાય છે. આ પર્વ સંસ્કારોને જાગૃત રાખવામાં અને પ્રગાહ બનાવવામાં અતિશય ઉત્સાહની વૃદ્ધિ કરે છે. પર્યુષણ પર્વ એ પુષ્યના પોષણનું અને પાપના પ્રતિકમણનું પર્વ છે. આરાધના અને આત્મશુદ્ધિનું અનુપમ પર્વ એટલે પર્યુષણ. ભવભ્રમણની પરંપરા ઓછી કરાવે તે પર્યુષણ. માનવજીવનને સફળતાની પરાકાણાએ પહોંચાડે તે પર્યુષણ. મિથ્યાત્વના મૂળને ઉભેડી સમ્યક્તવના બીજ રોપાવે તે જ પર્યુષણ. સંસારપરંપરા સર્જનાર કોધ, માન, માયા અને લોભ ખસી જાય અને સદ્ગુણોમાં વૃદ્ધિ કરાવી, આપણા જીવનને ધર્મ મંગલમય બનાવે તે જ પર્યુષણ. જૈન શાસનમાં એનું મહત્વ એટલું અદ્ભુત છે કે પર્વ કે મહાપર્વ નહિ પરંતુ પર્વતમાં જેમ મેરું પર્વતનું સ્થાન સૌથી વિશેષ છે, સમુદ્રમાં જેમ સ્વયંભૂરમણ સમુદ્રનું ઉચ્ચ સ્થાન છે તેમ પર્યુષણપર્વને પર્વાધિરાજ રૂપે સંભોધિત કરાય છે.

પવિત્ર પર્વાધિરાજ પર્યુષણના પાવન પગલા થઈ ચૂક્યાં છે. ધર્મસ્થાનોમાં, વાતાવરણમાં, વાયુમંડળમાં અને ધર્મજિજ્ઞનોના વિચારવર્તુળમાં એક માત્ર ધર્મ-આરાધનાનો નાદ ગૂંજુ રહ્યો છે. સામાન્યતઃ સમગ્ર વર્ષ દરમ્યાન જૈનો તપ - તપસ્યા, પ્રતિકમણ, સામાયિક, જિનપૂજા વગેરે નિત્યકમ કરી આત્મ સન્મુખ થઈ વ્યવહાર કરતાં જ હોય છે.

પરંતુ પર્યુષણ પર્વના આઠ દિવસ દરમ્યાન સણંગ પુનિતાપર્વનું ઉજવણું કરવા, સતત ધનિજ આરાધનામાં રહી, પોતાના આત્માનો ઉદ્ઘાર કરવા પ્રયત્નશીલ બને છે. સંયમપૂર્વક આત્મસાધનામાં પ્રવૃત્ત રહેવાનો, સમતાભાવ કેળવવાનો સધન પ્રયત્ન કરે છે.

પર્વ અને તહેવારો એક નથી. કારણ કે તહેવારોમાં ભૌતિક આનંદ-પ્રમોદનું મહત્વ હોય છે, જ્યારે પર્વમાં આત્મિક આરાધનાનું અનુષ્ઠાન કરવાનું મહત્વ હોય છે. તહેવારોમાં મોજ-મજા, ખાવા-પીવા, પહેરવા-ઓઢવા જેવી ભૌતિક બાબતોની પ્રધાનતા હોય છે. તપ અને ત્યાગ જે ધર્મના પાયામાં હોય ત્યાં શારીરિક શાણગાર, પોષણ કે આકર્ષણને વધારતાં પદાર્થોનું ભાગ્યે જ મહત્વ હોય છે. વૈરાગ્ય અને સંયમના આદર્શને વરેલા ધર્મમાં તો ગુણોત્કર્ષ અને સદાચારને સંપુષ્ટિ આપતા અને આત્માને સદ્ગુણવૃદ્ધિની સન્મુખ રાખતાં પર્વોનું જ માહાત્મ્ય હોય છે. ગુણોનું કભિક વર્ધન અને તેને પરમ ગ્રક્રષ્ટાની પરાકાણાએ પહોંચાડતા જ આત્મા પરમાત્માપણાને પામી જતો હોય ! ગુણ સંવર્ધન જ મહાપર્વોની ઉજવણીનો પરમ આદર્શ બની જાય છે.

આપણા આત્મામાં ક્ષમા, નમ્રતા, સરળતાદિ સદ્ગુણોમાં કોધ, માન, માયા, લોભ, વેરજેર, ઈર્ષા, દ્વેષાદિનું મિશ્રણ થઈ ગયું છે. હંસની માફક પાણી અને દૂધને જુદા પાડવાની કળા જેણો હસ્તગત કરી હશે એવા સ્વપરના ભેદ-વિજ્ઞાનને જાણનારા જીવો આ પવિત્ર દિવસોમાં આત્મા સાથે ભળી ગયેલી વૈભાવિક સ્થિતિને જુદી પાડી સ્વભાવદશામાં સ્થિર થઈ, અધ્યામના આનંદની અનુભૂતિ કરવા લાગશે.

કોધ, માન, માયા તેમજ લોભ વગેરે ભિથ્યાત્વના કારણે જન્મેલા વિભાવપરિણામો એટલે આત્માના જ પોતાની નબળાઈના કારણે થતાં દોષો છે. આ પર્વ દરમિયાન કોધને છોડી ક્ષમામાં રહેવું, રાગ-દેખને ત્યાગી ઉપશમભાવમાં રહેવું, માનને છોડી વિનયમાં રહેવું, દુર્ગુણોને છોડી સદ્ગુણોમાં રહેવું, લોભને મૂકી સંતોષમાં રહેવું, ભિથ્યાત્વનું મર્દન કરવું, પ્રમાણનું પ્રકાલન કરવું, કષાયોનું કર્તન કરવું, પરદોષ ત્યજ સ્વદોષ જોવાં, આત્માનું નિરીક્ષણ કરવું. આ બધી કિયા કરવાથી ઈન્દ્રિયો પર શું વિજય પ્રાપ્ત ન કરી શકાય? જીન એટલે જેણે બધી જ ઈન્દ્રિયો પર કાબૂ પ્રાપ્ત કર્યો છે. જૈનો સ્વાભાવિકપણે તપ, ત્યાગ, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, સંયમ, અકિંચન, શૌચ અને બ્રહ્મચર્ય જેવા ધર્મ પાળતાં હોય છે. પર્યુષણ પર્વ દરમિયાન પણ દાન, દયા, મૈત્રી, ક્ષમા, સંયમ અને સમર્પણ, ભક્તિ અને ભાવના દ્વારા આત્મનિરીક્ષણ કરી મુક્તિના પંથે વિચરવાનો અથાગ પુરુષાર્થ કરતાં રહે છે.

જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત છે-અહિંસા. મન, વચન કે કાયાથી કોઈપણ વ્યક્તિને શારીરિક કે માનસિક દુઃખ કે હાનિ પહોંચે એવી કિયા એ હિંસા જ ગણાય છે. નાનામાં નાના જીવની રક્ષા કરવાનો જૈન ધર્મમાં ઉપદેશ આપવામાં આવે છે. રોજબરોજના સાંસારિક કાર્યો દરમિયાન પણ જીણતાં કે અજીણતાં હિંસા ન થઈ જાય તેવી જ્યાળાના સિદ્ધાંતનું દરેક જૈનો પાલન કરે છે. ‘જીવો અને જીવવા દો’ના દયા ધર્મનું સૂત્ર દરેક જૈનોના હૈયે વસેલું છે. જૈન ધર્મમાં તપનો પણ અનેરો મહિમા છે. નાના બાળકથી માંડીને મોટેરાંઓ યથાશક્તિ ઉપવાસ, આયંબિલ, એકાસણાં, ચૌવિહાર જેવા તપ કરી ધર્મમાં સ્થિર થવા પ્રયાસ કરે છે. પર્યુષણ પર્વ દરમિયાન કલ્પસૂત્ર વાંચવાની પરંપરા છે. સાધુ-ભગવંતો કલ્પસૂત્રની ધર્મસ્થાનકોમાં વાંચણી કરે છે.

પર્યુષણનો આઠમો દિવસ જૈનો માટે વિશીષ માહાત્મ્ય ધરાવતો દિવસ છે. પ્રારંભના સાત દિવસ સાધનાના અને આઠમો સંવત્સરીનો દિવસ સિદ્ધિની પ્રાપ્તિનો છે. આ પવિત્ર દિવસ દરેક ધર્મજીવ માટે પરમ સુખ અને આનંદનો છે. મનુષ્યને જ્યારે પુણ્યના સાનુકૂળ સંયોગો હોય ત્યારે જ તન, મન, ધન તેમ જ સર્વ સુયોગ્યતમ સાધનો મળે છે. પરંતુ આ આત્માએ ભૂતકાળમાં ન કરવાના કામો કર્યા હોય, અસત્યના આચરણથી જે પાપકર્મો તેણે ઉપાર્જન કરેલાં છે તેને લઈને જે કોઈ પાપકર્મો બાંધ્યા હોય તેને હળવાં કરવાનો તેમજ તેમાંથી નિષ્ફલંક અને નિષ્પાપ થઈ જવા માટેનો આ સોનેરી દિવસ છે. સંવત્સરીના આ સપરમા દિવસે આલોચના કરી ગુરુભગવંતોની સામે પાપનું પ્રાયશ્ચિત્ત લેવાનું હોય છે. આલોચના એટલે પોતાની જાતને ચારેકોરથી તપાસવાનો, આત્મનિરીક્ષણ કરવાનો તથા યથાર્થ સ્વરૂપમાં પોતાની જાતને ઓળખી લેવાનો છે. મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ તેમ જ અનંતસંસારને વધારનારા માયાશલ્ય, નિદાનશલ્ય અને ભિથ્યાદર્શન શલ્ય છે. આ ત્રણે શલ્યો જે આત્માને કાંટાની માફક ખૂંચનારા, આત્મિકગુણોને અવરોધ કરનારા છે. આલોચના કરવાથી જીવ ઝજુ બને છે. આ શલ્યને આત્મામાંથી કાપી નાખવામાં મદદરૂપ બને છે.

સાંવત્સરિક પ્રતિકમણ કરી દરેક જૈન શુદ્ધ અને નિર્મળ હૃદય સાથે, અહંકાર અને કષાયથી મુક્ત થઈ સહુ જીવોની ક્ષમાપના યાચે છે. અન્ય સર્વે જીવની સદ્ગુણપૂર્વક સમતાના ભાવ સાથે ક્ષમાપના યાચીને શુદ્ધ મનથી ‘મિશ્ના મિ દુક્કં’ કરી ખમાવે છે. જૈન ધર્મની આ જ વિરલ સિદ્ધિ છે. પર્યુષણ પર્વની ઉજવણીનું હાર્દ એ જ છે કે બહારના શત્રુઓને માફ કરી ભીતરમાં રહેલાં શત્રુઓને સાફ કરવાનું. ક્ષમા રાખો, ક્ષમા માંગો, ક્ષમા આપો. હૈયામાં ગાંઠ ન રાખો. ક્ષમાનો પાઠ જ યાદ રાખો.

● ● ●

તપની આરાધનાનું પર્વ - પર્યુષણ મહિપર્વ

મિતેશભાઈ એ. શાહ

પ્રાણીમાત્રને પ્રેમનો સંદેશ આપતું પર્વ એટલે
પર્યુષણ, અહિંસાની આલબેલ પોકારતું પર્વ એટલે
પર્યુષણ, આત્માની નિકટતા પ્રાપ્ત કરવાનું પર્વ
એટલે પર્યુષણ, વિભાવથી સ્વભાવ તરફ વળવાનું
પર્વ એટલે પર્યુષણ, જીવનની સરગમ પર સ્નેહનાં
સૂર છેડતું પર્વ એટલે પર્યુષણ, જીતમાં જીવવાની
રીત બતાવતું પર્વ એટલે પર્યુષણ, સહુના પ્રત્યે
ઓંતરગ્રીત જગાડતું પર્વ એટલે પર્યુષણ. આપણે
હેતપ્રીતના તોરણ બાંધતા અને તૂટેલા દિલોના
તારોને સાંધતા આ પર્વને વધાવીએ. આ મહાપર્વની
પાવન પળોને તપ, ત્યાગ અને પ્રભુભક્તિની
ભીનાશથી મંગલમય બનાવીએ. આ લોકોત્તર
પર્યુષણ મહાપર્વનું સ્વાગત આપણે જ્ઞાનનો
મંગલદીપ પ્રગટાવીને, ધૈર્યની ધૂપસળી સળગાવીને,
આરાધનાના અભીલગુલાલ ઉડાડીને, અહિંસાના
અક્ષતના સ્વસ્તિક રચીને, સર્વ જીવને અભયદાન
આપીને, અનુંક્પાની અલખ જગાવીને કરીએ. શ્રી
પર્યુષણપર્વ એટલે ત્યાગ, તપ અને તિતિક્ષાનું પર્વ
— સંયમ, સાધના અને સદ્ગુણારોનું પર્વ —
અનુંક્પાની આરાધના અને આત્મશુદ્ધિનું પર્વ —
આત્મસાક્ષાત્કાર અને આત્મોનતિનું પર્વ, ભીતરને
બદલવાનું પર્વ, અંતરને ભક્તિથી રંગવાનું પર્વ,
સંવેદના જગાડવાનું પર્વ.

સામાન્ય માનવી વર્ષમાં ઓદ્ધામાં ઓદ્ધા આઈ
દિવસો ધર્મની- આત્માની આરાધના કરે તે હેતુથી
મહાપુરુષોએ શ્રી પર્યુષણ મહાપર્વનું આયોજન કર્યું
છે. આ દિવસોમાં અર્થ અને કામકૃપી પુરુષાર્થને
તિલાંજલિ આપી માત્ર ધર્મની આરાધના કરવાની
હોય છે. પરિ = ચારે બાજુથી, ઉસ્સ = વસવું. ચારે
બાજુથી આત્માની સમીપ રહેવાનો પ્રયત્ન કરવાનું

પર્વ એટલે પર્યુષણ. પર્યુષણ પર્વ દરમિયાન પરમાત્માની પૂજા-ભક્તિ, અમારિપ્રવર્તન, ચૈત્યવંદન, સ્વાધ્યાય, દાન, સંયમ, તપ, ક્ષમાપના, સાધમી વાત્સલ્ય જેવાં કર્તવ્યો બજાવવાં આવશ્યક છે. આ પર્વ લોકોનર પર્વ છે કે જેમાં આત્મશુદ્ધિનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પર્વ દરમિયાન આત્મશુદ્ધિ અર્થે સાધકો પોતાની શક્તિ અનુસાર તપની આરાધના કરે છે. કર્માને આત્મા તરફ આવતાં રોકવાં તેનું નામ સંવર અને આત્મા સાથે લાગેલા કર્માને એકદેશ બેરવી નાખવાં તેનું નામ નિર્જરા. ‘તપસા નિર્જરા ચ’ – તપ કરવાથી કર્માની નિર્જરા થાય છે.

‘कर्मक्षयार्थम् तप्यतः इति तपः’ – कर्मना
 क्षय अर्थे तपवुं तेने तप कहे छे. अनशन, ऊषोदरी,
 वृत्तिपरिसंज्ञान, रसपरित्याग, विविक्त शाय्यासन
 अने कायकलेश आ छ बाह्य तप हे. प्रायश्चित्त,
 विनय, वैयावृत्त, स्वाध्याय, व्युत्सर्ग अने ध्यान -
 आ छ अंतरंग तप हे. आ तपने टंकभां समજ्जुએ :

(૧) અનશન (ઉપવાસ) : વિષય, કખાય તથા આહારના ત્યાગને અનશન કહે છે. ઈન્દ્રિયોને વિષયોમાં જતી રોકવાં અને મનને આત્મસ્વરૂપમાં જોડવાં મહાપુરુષોએ ઉપવાસ કરવાના કહાં છે. અનશન દરમિયાન ખાદ્ય, સ્વાદ્ય, લેખ અને પેય-એમ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાનો હોય છે. ઉપવાસ દરમિયાન નોકરી-ધ્યાન, આરંભ - પરિગ્રહનો ત્યાગ કરીએ તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય.

(૨) ઊષોદરી : ભૂખ કરતાં ઓછું ખાવું તેને ઊષોદરી કહે છે. આહારનું પ્રમાણ એક ગ્રાસથી બત્રીસગ્રાસ સુધી કર્યું છે. તેમાં ઈચ્છાનુસાર ઘટાના

પ્રમાણમાં આહાર લેવો તેને ઊંઘોદરી કહે છે. ઊંઘોદરી કરવાથી પ્રમાદ પર વિજય મેળવી શકાય છે.

(૩) વૃત્તિપરિસંઘાન : અર્થાત् વૃત્તિઓને મર્યાદામાં રાખવી, વૃત્તિઓને કાબૂમાં લેવી. મુનિ આહાર લેવા નીકળે ત્યારે મનમાં આવી મર્યાદા કરીને નીકળે છે કે બે ધરમાં જ આહાર મળે તો લેવો, દાતાર આ પ્રમાણેની પદ્ધતિથી આહાર આપે તો લેવો, નીરસ આહાર લેવો વગેરે. ભોજનની આશાને નિરાશ કરવા માટે આ તપ કરવામાં આવે છે. આપણે પણ ભોજનમાં આજે ત્રાણ વસ્તુઓ જ લઈશ વગેરે મર્યાદા કરી શકીએ.

(૪) રસપરિત્યાગ : ખાંડ, મીહું, દૂધ, દહીં, ધી, તેલ – આ છ પ્રકારના રસોમાંથી એક, બે કે તેથી વધારે રસોનો ત્યાગ કરવો તેને રસપરિત્યાગ કહે છે. ઈન્દ્રિયોના વિષયોને જીતવાં સાધક રસ વગરનું – નીરસ ભોજન કરે છે. જૈન પરિભાષામાં તેને આયંગિલ પણ કહે છે. આ તપ કરવાથી આહાર પર વિજય મેળવી શકાય છે.

(૫) વિવિક્ત શય્યાસન : બેસવાનું સ્થાન તે આસન છે અને સૂવાનું સ્થાન તે શય્યા છે. એકાંત સ્થાનમાં બેસવું અને સૂવું તેને વિવિક્ત શય્યાસન કહે છે. જ્યાં ચિત્તમાં ક્ષોભ કરવાવાળા કોઈ પદાર્થોન હોય તેવા એકાંત સ્થાનમાં મુનિઓ સૂવે-બેસ છે. મુનિઓને પોતાનું સ્વરૂપ સાધવાનું છે, વીતરાગતા સાધવાની હોય છે.

(૬) કાયકલેશ : શરીરને કષ્ટ આપવું તેને કાયકલેશ કહે છે. ઠંડી-ગરમી સહન કરવી, ડાંસ-મચ્છરના ચટકા સહન કરવાં વગેરે. મુનિઓ ઉપસર્ગને જીતવાવાળા હોય છે. તેનાથી તેમના ચિત્તમાં જેદ ઊપજતો નથી. તેઓને કાયા અને ઈન્દ્રિયો પ્રત્યે નિર્મભત્વભાવ હોય છે.

(૭) પ્રાયશ્ચિત્ત : ‘પ્રાયઃ’ એટલે અપરાધ,

અને ‘ચિત્ત’ એટલે તેની શુદ્ધિ કરવી તેનું નામ પ્રાયશ્ચિત્ત. મન-વચન-કાયાથી, કૃત-કારિત-અનુમોદનાથી જે કંઈ પાપદોષો થઈ ગયા હોય તેનો હૃદયથી પસ્તાવો થાય, પોતાના દોષોની પ્રભુ-ગુરુ સમક્ષ માફી માગવી અને ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તે ગ્રહણ કરવું તથા ભવિષ્યમાં એવા દોષો ન કરવાની પ્રતિજ્ઞા લેવી. પ્રાયશ્ચિત્તરૂપી પુનિત જરણામાં સ્નાન કરવાથી સાધક શુદ્ધ બને છે.

(૮) વિનય : સત્ત્ર દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અંતરનો આદરભાવ તેને વિનય કહે છે. જ્ઞાનપ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય તે વિનય છે. દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઉપચાર વિનય-એમ વિનયના પાંચ પ્રકાર છે. આધ્યાત્મિક વિકાસ માટે વિનય ગુણને વિકસાવવો જરૂરી છે. ‘અહમ્’ની રાખ પર પરમાત્માના દર્શન કરી શકાય છે.

(૯) વૈયાવૃત (સેવા) : ઉપસર્ગ, વૃદ્ધાવસ્થા કે રોગાદિકથી પીડિત સાધુજનોની મન-વચન-કાયાથી, જરૂરિયાતની વસ્તુઓ આપીને સેવા કરવી. રોગી હોય તેમનો યોગ્ય ઔષધિથી ઉપચાર કરવો, વૃદ્ધ હોય તેમની શારીરિક સેવા કરવી.

(૧૦) સ્વાધ્યાય : જિનેશ્વર પ્રણીત શાસ્ત્રોનો અભ્યાસ કરવો તેને સ્વાધ્યાય નામનું તપ કહે છે. આ તપ તત્ત્વનો નિશ્ચય કરવામાં તથા ધ્યાનની સિદ્ધિ કરવામાં સહાયભૂત થાય છે. વાચના, પૂર્ણના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ - એમ સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. આ કાળનું ઉત્તમ તપ સ્વાધ્યાય છે.

(૧૧) વ્યુત્સર્ગ : કાયા પ્રત્યેની માયા છોડવાનો અભ્યાસ કરવો તેને વ્યુત્સર્ગ કહે છે. મુનિઓ કાયાથી મમત્વ છોડી, પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં શુદ્ધોપયોગરૂપ થઈ તહ્લીન થાય છે ત્યારે અનેક (અનુસંધાન પાના નં. ૩૦ પર...)

જીવાદીપ : દિવાળી પુરસ્કાર

• वि. सं. २०७४ •

- (૧) કવર સાથે 'જીવનદીપ' ગુજરાતી પુસ્તિકાની પડતર કિંમત એક નંગના રૂ. ૭/- (સાત રૂપિયા પૂરા) રાખેલ છે.
 - (૨) નામ-સરનામું છાપવા માટે ઓછામાં ઓછો ૫૦૦ પુસ્તિકાઓનો ઓર્ડર હોવો જરૂરી છે. તેનો પ્રિન્ટિંગ ખર્ચ એક નંગના રૂ. ૧/- (અંકે એક પૂરા) ચુકવવાના રહેશે.
 - (૩) ઓર્ડરફોર્મ મુજબ પુસ્તિકાની કિંમત તથા પ્રિન્ટિંગ ચાર્જ તેમજ પોસ્ટેજ ખર્ચની રકમ રૂબરૂ અથવા ડ્રાફ્ટ કે મનીઓર્ડર દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોણાંના સરનામે ઓર્ડરફોર્મ સાથે જ મોકલવાની રહેશે. ઓર્ડરફોર્મ સાથે જેમનું પેમેન્ટ આવશે, તેમના ઓર્ડર જ સ્વીકારવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.
 - (૪) તા. ૩૦-૮-૨૦૧૭ સુધીમાં ઓર્ડરફોર્મ મોકલી આપવા વિનંતી છે. નામ અને સરનામું અંગેજુ કે ગુજરાતીમાં જે રીતે છાપવાનું હોય તે પ્રમાણે જ ફોર્મ ભરવું. સંપર્ક : શ્રી વિજયભાઈ પટેલ : મો. ૯૮૨૭૦૮૦૩૮૩, ૭૬૮૮૭૫૭૩૧૮

દિવાળી પુસ્તિકા માટેનું ઓર્ડરફોર્મ

કેટલા નંગાનો ઓર્ડર છે ? _____ નામ છાપવાનું છે ? _____ હા / _____ ના
નામ/એડ્રેસ જે પ્રમાણે છાપવાનું હોય તેની વિગત આ બોક્સમાં બની શકે તો ટાઈપ કરીને આપો.

તમારું ઈ-મેલ એડ્રેસ : _____ ફોન: _____

નીચેના સેવાભાવી મહાનુભાવો પાસેથી દિવાળી પુસ્તિકાઓ પ્રાપ્ત થઈ શકશે.

સંપર્કસૂત્રો :

AHMEDABAD

- (૧) શ્રી મુકેશભાઈ આર. શેઠ
શેઠ સન્સ : ફોન : (ઓ) ૨૫૩૫૬૬૪૬
(ધર) ૨૬૪૦૧૨૪૧
મો. ૯૮૨૪૫ ૧૮૮૦૦

(૨) ડૉ. રાજેશભાઈ સોનેજી, સોનેજી હોસ્પિટલ
ફોન : ૨૫૩૨૩૪૫૪, ૯૮૨૪૦ ૪૭૬૨૧

(૩) શ્રી જયેશભાઈ શાહ, શાલિભદ્ર સ્ટેશનર્સ
ફોન : ૨૫૬૨૧૪૮૭, ૨૫૬૨૧૭૪૮
મો. ૯૮૦૮૦ ૦૬૦૪૮

- (૪) શ્રી સદગુરુપાસાં - પુષ્પવીલા, મીઠાખળી.
ફોન : ૨૬૫૬૮૪૨૩

MUMBAI

- (૧) શ્રી કાંતિભાઈ કારાણી (રૂપમ ડ્રાયફુલ્સ)
 મોબાઈલ : ૮૦૦૪૦ ૪૪૪૦૫
 ફોન : (૦૨૨) ૨૮૮૨૬૨૪૬ / ૨૮૮૮૭૩૮૦

(૨) શ્રી દીનાબેન નગીનભાઈ પંચમિયા
 વિનોદ ટી સેન્ટર, મો. ૦-૯૨૨૨૦૭૭૬૩૮
 ફોન : (૦૨૨) ૨૫૦૧૧૮૮૭
 મો. ૦-૯૨૨૪૪૯૧૨૪૧૨

- (3) શ્રી પુનિતભાઈ એસ. મહેતા
C/O. મહેતા બ્રાહ્મસ એન્ડ કંપની
ફોન : (૦૨૨) ૨૨૬૭૪૮૪૦
મો. ૦-૯૮૨૦૪ ૦૦૨૬૭
- (4) શ્રી નીતિનભાઈ પારેખ
ફોન : (૦૨૨) ૨૪૦૭૬૨૦૦
મો. ૦-૯૮૨૦૩ ૨૮૨૭૭

BANGLORE

શ્રી જ્યેશભાઈ જૈન (સુજય એન્ટરપ્રાઇઝ)
ફોન : (૦૮૦) ૨૨૮૭૨૮૮૮,
મો. ૦-૯૩૪૧૦૪૯૮૪૭
૦-૯૮૪૫૮ ૨૨૮૫૬, ૦-૯૮૮૦૭ ૨૪૬૧૮

CHENNAI

શ્રી નવનીતભાઈ પી. શાહ
ફોન : (૦૪૪) ૨૮૩૪૦૭૩૦
મો. ૦-૯૮૪૦૮ ૮૫૦૮૮

HIMATNAGAR

શ્રી જયંતીભાઈ કે. શાહ
ફોન : (૦૨૭૭૨) ૨૩૪૬૪૮, મો. ૯૩૭૭૪ ૬૭૬૫૬

KOLKATA

શ્રી અચ્છિનભાઈ ભાનુભાઈ દેસાઈ
૩૫-૧, જવાહરલાલ નહેરુ રોડ,
કેલાસ બિલ્ડિંગ, ફ્લેટ નં. ૧૧એ, કોલકાતા.
મો. ૦-૯૩૩૧૦ ૮૫૮૪૮/૪૭

LAXMIPURA

શ્રી લાલજીભાઈ પટેલ - ફોન : (૦૨૭૭૫) ૨૪૧૩૭૪
મો. ૯૮૨૪૭૪૨૨૭૫, ૭૬૮૮૨૮૪૭૪૫

LIMBDI

શ્રી ડૉ. હેમંતભાઈ ડગલી
ફોન : (૦૨૭૫૩) ૨૬૦૨૮૮૦
મો. ૯૩૭૬૬૫૭૦૧, ૯૩૭૬૬૫૫૦૨

PUNE

શ્રી શૈલેષભાઈ પ્રતાપભાઈ મહેતા
ફોન : (૦૨૦) ૨૪૪૫૪૪૬૪, ૦-૯૭૬૩૭૨૮૮૮૮

RAJKOT

શ્રી નરેન્દ્રભાઈ વૃજલાલ શાહ
ફ્લેટ નં. ૨, કૃતિ ગોપ એપાર્ટમેન્ટ,
૪, બાલમુકુંદ પ્લોટ, નિરમલા કોન્વેન્ટ રોડ,
રાજકોટ. ફોન : (૦૨૮૧) ૨૫૮૫૧૬૦
મો. ૯૪૨૭૨ ૫૪૫૫૮

RAKHIAL

શ્રી રામજીભાઈ પટેલ (લોકનાદ શિક્ષણ સંકુલ)
ફોન : (૦૨૭૧૬) ૨૬૭૬૩૩, ૯૮૨૪૪૮૪૭૫૫

SURENDRANAGAR

શ્રી અપૂર્વભાઈ સુરેશભાઈ શેઠ
વર્ધમાન મૂળજી એન્ડ સન્સ
ફોન : (૦૨૭૫૨) ૨૩૨૩૦૬, ૨૮૫૧૭૮
મો. ૯૮૨૫૩ ૫૫૮૨૧, ૯૪૨૬૭ ૫૫૧૬૬

VADODARA

શ્રીમતી શિલ્પાબેન પુલકિતભાઈ મહેતા
C/O. ભારત ઉદ્યોગ હાટ
ફોન : (૦૨૬૫) ૨૪૨૬૭૫૭,
(ઘર) ૨૪૮૧૭૩૮, મો. ૯૩૭૬૨ ૧૬૨૬૬

OVERSEAS

U. K. (0044)

1. Mrs. Shrutiben Malde - Ph. 208-668-3057
2. Mr. Vinaybhai K. Shah
Ph. 208-951-5424, 740-711-9456
3. Mr. Harshadbhai Sanghrajka
Ph. 208-954-9632, 192-324-9898
M. 0044-796-972-2109

U.S.A. (001)

4. Mr. Prafulbhai Lakhani
Ph. 631-423-9647, (0) 516-679-1200
M. 516-901-9368
5. Mr. Mahedrabhai Khandhar
Ph. 714-894-2930, 714-376-5112
6. Mr. Birenbhai Pravinbhai Mehta
Ph. 714-389-3672

KENYA

7. Mr. Manubhai S. Shah, Ph. 254-2375-1679

CANADA (Toronto)

8. Mr. Jyotindrabhai Soneji, Ph. 905-669-5318

સમાજ-સંસ્થા દર્શન

શ્રી પર્યુષણ મહાપર્વ દરમિયાન આયોજિત
ઘનિષ સત્સંગ-સ્વાધ્યાય શિબિરમાં પદ્ધારવા ભાવભર્યું આમંત્રણા

આપણી સંસ્થામાં પૂજયશ્રી આત્માનંદજીના પાવન સાત્ત્વિધમાં તા. ૧૮ થી ૨૫ ઓગસ્ટ દરમિયાન શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના થશે. મહાપર્વ દરમિયાન સંસ્થામાં ઘનિષ સત્સંગ-સ્વાધ્યાય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના આમંત્રણને માન આપીને દેશ-વિદેશમાં પ્રખ્યાતિ પામેલ વિદ્વાન દંપતી આદ. ડૉ. શ્રી ઉજ્જવલાબેન શાહ અને પંડિતશ્રી દિનેશભાઈ શાહ (સાયન, મુંબઈ) આપણા સાધનાકેન્દ્રમાં પદ્ધારીને જૈન તત્વજ્ઞાન તેમની રસપ્રદ અને સરળ શૈલીમાં પીરસશે. પૂ. કાન્છસ્વામી તથા અન્ય પંડિતજનોથી પ્રેરિત થઈને આ ધાર્મિક દંપતીએ પોતાના વ્યવસાયમાંથી ઘણા સમય પહેલા નિવૃત્તિ લઈને લગભગ દરેક જૈન શાક્યોનો ઘણો ઊંડો અને વિસ્તૃત અભ્યાસ કર્યો છે. ડૉ. શ્રી ઉજ્જવલાબેન શાહ કરણાનુયોગનો તથા પંડિત શ્રી દિનેશભાઈ શાહ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરાવશે. તેઓ બંને રોજના લગભગ ૩-૩ કલાક સ્વાધ્યાયનો લાભ આપી પોતાના વિષયનો પૂરો કોર્સ કરાવશે.

સ્વાધ્યાય ઉપરાંત જિનપૂજા, જિનાભિષેક, શ્રી બૃહદ્દ આલોચના જેવા કાર્યક્રમો યોજાશે. સૌ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને પર્યુષણની આરાધના માટે પદ્ધારવા ભાવભર્યું આમંત્રણ છે. આપના આગમનની જાણ સંસ્થામાં અગાઉથી કરવા વિનંતી; જેથી આપની સુવિધાઓ સાચવી શકાય.

સંસ્થામાં ગુરુપૂર્ણિમા નિમિત્ત આયોજિત શિદ્વિવસીય આધ્યાત્મિક શિબિર સાનંદ સંપન્ન

સંસ્થામાં શ્રી ગુરુપૂર્ણિમા નિમિત્ત તા. ૮-૭-૨૦૧૭થી તા. ૧૦-૦૭-૨૦૧૭ દરમિયાન પૂજયશ્રીના પાવન નિશ્ચામાં આધ્યાત્મિક શિબિર સાનંદ સંપન્ન થઈ. શિબિરમાં સારી સંઘ્યામાં મુમુક્ષુ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. શિબિરનું સફળ સંચાલન પ્રજ્ઞાવંત મુમુક્ષુ શ્રી શરદભાઈ તેલીવાળાએ કર્યું હતું. મહાનુભાવોના વરદ હસ્તે દીપ-પ્રાગટ્યથી શિબિરનો શુભારંભ થયો.

● સ્વાધ્યાય : પૂજયશ્રી આત્માનંદજીએ હિતશિક્ષા આપતા જ્ઞાયું કે જીવનમાં ચીલાચાલુ ધર્મ ન કરતાં આત્મકલ્યાણ અર્થે ધર્મ કરવો. ‘મોક્ષ કષ્યો નિજ શુદ્ધતા, જે પામે તે પંથ.’ પ્રથમ તો અશુભમાંથી શુભ ભાવમાં જવાનું છે અને અંતે શુદ્ધભાવની પ્રાપ્તિ કરવાની છે. આત્માની ઉન્નતિ માટે સાધનાનો ક્રમ સેવવો પડશે. શ્રી કુંદકુંદસ્વામીએ નાની ઊમરે દીક્ષા લીધી ને જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવા પૂર્ણ પ્રયત્નો કર્યા. તેનો ચોથો ભાગ પણ આપણે કરી શકીએ તોય ઘણું. દેવપૂજા, ગુરુપાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન- આ છ કર્તવ્યોનું પાલન દરેક ગૃહસ્થે કરવું જોઈએ. સદ્ગુરુને સર્વ પ્રકારે અર્પણ થવું અને પોતાનો અહ્મુ ઓગાળી દેવો. સદ્ગુરુ કહે છે કે હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ એ જ સર્વનો ઉપાય છે. શુદ્ધાત્માની શ્રદ્ધા અને જ્ઞાન પ્રાપ્ત કરી તેમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો. નથી ગમતું તે કરવું એ મોક્ષમાર્ગ છે. સમય નથી તો પણ સમય કાઢીને ધર્મની આરાધના કરવી. ગમે તેમ કરીને મનને પરમાત્મામાં લગાડવું અને આખરે પરમાત્મામાં સ્થિર કરવું. આત્માની શુદ્ધિ વધારવા સતત પ્રયત્નશીલ

રહેવું. આ કાળમાં પ્રાર્થના એ ઉત્તમ સાધન છે, જેથી પોતાનો અહ્મુ ઓગળે. જગતની વિસ્મૃતિ કરવી અને સત્તના ચરણમાં રહેવું. તરાથી આત્મા પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરવાનો છે. આ કાળે ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. ભક્તિ દ્વારા ચિત્તની શુદ્ધિ કરતા રહેવું. સાધકે દૈનિક રોજનીશી લખવી જોઈએ.

પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ સ્વાધ્યાય આપતા જણાવ્યું કે ગુરુના અંતરમાં વસે તે અંતેવાસી. ગુરુના અંતરમાં વસવું હોય તો કર્મસિદ્ધાંતમાં દઢતા, સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા જરૂરી છે. ધનની ઝકમજોળવાળા સમાજમાં ધર્મનો દીપક પ્રગટાવવા પૂજયશ્રી આત્માનંદજીએ પુરુષાર્થ કર્યો. લોકોને ધનના સિંહાસન પરથી ઉઠાવીને ધર્મના સિંહાસન પર બેસાડવાનું કામ તેઓશ્રીએ કર્યું. પરિગ્રહના કીચડ વચ્ચે અધ્યાત્મનું ફૂલ ખીલવવા સંતોષે કેટલી વેદના સહી હશે ! પૂજયશ્રીને સંતત્વનો અનુભવ છે. તેઓએ છાશ વલોવીને આપણને નવનીત આપ્યું છે. પૂજયશ્રીએ સમાજના ચરિત્ર ઘડતર માટે યુવાશિબિરો, ગુરુકુળની સ્થાપના, દિવાળી પુસ્તિકાનું પ્રકાશન કરાવ્યું. લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવાના પૂજયશ્રીએ પ્રયાસો કર્યો.

ઈતિહાસ એ ભવિષ્યનો બોધપાઠ છે. ગુરુ શિષ્યને જાગૃત કરવાનું કાર્ય કરે છે, જીવનમાં વાપેલા અંધકારને દૂર કરે છે, ભીતરમાં પરિવર્તન કરે છે, આપણા અહંકારને નમાવે છે, સીમામાં જીવતા માનવીને અસીમ તરફ લઈ જાય છે. છટકણા પદાર્થ સમાન પરમાત્માની પ્રાપ્તિ ન થાય ત્યારે નિરાશ થતા શિષ્યની ગુરુ પીઠ થાબડે છે અને તેનો હાથ પકડે છે. ગુરુ પરમ તત્ત્વને પામવાની પાત્રતા આપે છે. ગુરુ આપણી દાખિમાં પરિવર્તન લાવે છે. વિધેયાત્મક દાખિ આવતાં વૃત્તિના તોફાનો શાંત પડે છે. ગુરુ આપણા જીવનપરિવર્તનનું કાર્ય કરે છે, સત્પાત્ર જીવો પર અહેતુકી કૃપા વરસાવે છે, ચિત્તવૃત્તિનું રૂપાંતરણ કરે છે, આપણી આસક્તિને નિયોગી કરે છે.

ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજ્ના ડાયરેક્ટર, જૈન ધર્મના ઊંડા અભ્યાસી, પ્રખર સ્વાધ્યાયકાર આદ. ડૉ. જિતેન્દ્રભાઈ શાહે ઉપા. યશોવિજયજી મહારાજ કૃત ‘જ્ઞાનસાર’ અંતર્ગત ‘કર્મવિપાક અષ્ટક’ વિષયના આધારે અનેક દાખિંતો સહ રોચક શૈલીમાં સ્વાધ્યાય આપતા જણાવ્યું કે ગુરુ આપણા ભવિષ્યને જોઈ શકે છે, અંતરની શક્તિ પિછાણી શકે છે. માટીના પિંડ જેવા શિષ્યને એવો આકાર આપે છે કે તેનો બેડો પાર થઈ જાય છે. અવિવેકથી કોધ જન્મે છે. કોધ અને અહંકાર એ સાધનામાર્ગમાં પરમ બાધક છે. ભારતીય દર્શનશાસ્ત્રનો કેન્દ્રીય વિચાર તે કર્મવિચાર છે. કર્મવિપાકના ચિંતનની સાથે કર્મક્ષય અંગે વિચારણા જરૂરી છે. જૈનધર્મનું કર્મવિજ્ઞાન અત્યંત સૂક્ષ્મ અને અદ્ભુત છે. પ્રભુની વાણી ફટકડીના ચૂર્ણ સમાન છે, તેનાથી મનનો કચરો શમી જાય છે, મન શાંત અને પવિત્ર બને છે. કર્મબંધનના કારણે જન્મમરણ અને દુઃખની પરંપરા છે. દુઃખમાં દીન ન બનવું કારણ કે તે આપણા કરેલા કર્મોનો વિપાક છે. ‘બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદ્યે શો સંતાપ ?’ શાન પ્રકૃતિવાળા જીવો નિમિત્તને દોષ દે છે, જ્યારે સિંહવૃત્તિવાળા જીવો નિમિત્તને દોષી ન માનતાં ઉપાદાનને શોધે છે. તેઓ જ્ઞાતા-દષ્ટા ભાવને કારણે આત્મમસ્તીની મોજ માણતાં હોય છે. જેના કેન્દ્રસ્થાને ધન આવી જાય છે તેને આત્મતત્ત્વનું વિસ્મરણ થાય છે. ‘નિઃસ્પૃહત્વમ્ભુ મહાસુખમ્ભુ’. કર્મો બાંધતી વખતે સજાગ રહીએ તો ઉદ્યે સંતાપ સહન ન કરવો પડે. જે એક આત્માને જાણે તે સર્વને જાણે છે. આત્મતત્ત્વ શ્રેષ્ઠ તત્ત્વ છે, તેને પ્રાપ્ત કરવા સાધક સંસારનો ત્યાગ કરે છે. અજ્ઞાન-કષાયરૂપી વાદળો વરસી જાય તો ગુરુપૂર્ણિમાનો પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થશે.

કર્મના ઉદ્ય વખતે કર્મનું ચિંતન ભુલાઈ જાય છે અને આપણે નિમિત્તોમાં અટવાઈ જઈએ. કર્મની પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ વગેરે કર્મ બાંધતી વખતે નક્કી થઈ જાય છે. કર્મના અભાધાકાળ દરમ્યાન જીવ જો જાગૃત થઈ જાય તો તે કર્મની નિર્જરા કરી શકે, પાપકર્મનું અપકર્ષણ, પુણ્યનું ઉત્કર્ષણ તથા પાપનું પુણ્યમાં સંકમણ કરી શકે. ‘ગહના કર્મણો ગતિ ।’ કિયા એક હોવા છતાં કર્મના ‘ભાવ’ બિન્ન હોવાના કારણે કર્મબંધ બિન્ન બિન્ન પ્રકારે થાય છે. સાધકે પોતાના ‘ભાવ’ની ચોકી કરવાની છે.

આદ. બા.બ્ર. સુરેશજીએ શ્રી પદ્મપુરાણ(રામચરિત) અંતર્ગત કથાના પ્રકારો, કાળયક, હત શલાકા પુરુષો, રામનો વનવાસ, દંડકવનમાં નિવાસ, ખરદૂષણ, શૂર્પણાખાનો પ્રસંગ, કુંભકર્ણ-ઈન્દ્રજિત-મેઘનાદની દીક્ષા, ચાર ગતિ, ભરતજીનો વૈરાગ્ય, રામ-લક્ષ્મણાનો વૈભવ, સીતાનો અપવાદ, રામ દ્વારા સીતાનો ત્યાગ, સીતાનો રામને સંદેશ, લક્ષ્મણનું મૃત્યુ, રામનો વૈરાગ્ય અને દીક્ષાગ્રહણ તથા મોક્ષ વગેરે મુદ્ધાઓનું રસપ્રદ શૈલીમાં વર્ણન કર્યું હતું.

- **ભક્તિસંગીત :** શિબિર દરમિયાન યુવાભક્તિ ગ્રૂપે (કોબા) ભાવવાહી ભક્તિસંગીત પીરસીને સૌને પ્રભુ-ગુરુમય બનાવ્યા હતા.

- **संस्था प्रस्तावित ‘साधकनिवास’नुं भूमिपूजन :** शिबिर दरभियान पूज्यश्रीना सानिध्यमां संस्था प्रस्तावित ‘साधकनिवास’नुं भूमिपूजन करवामां आयुं. ते अगाउ प्रोजेक्टर द्वारा ‘साधकनिवास’ अंगे माहिती आपवामां आवी हती. आ प्रसंगे पूज्यश्री उपरांत पूज्य बहेनश्री संस्थाना प्रमुखश्री तथा ट्रस्टीगण, त्यागी साधको तथा मुमुक्षु भाई-बहेनो उपस्थित रह्या हता. आ प्रसंगे जलाभिषेक, मंत्रोच्चार वगेरे विधि करवामां आवी हती. आ प्रसंगे संस्थाना भूतपूर्व प्रमुखश्री श्री ज्यंतभाई शाह तथा साधकविशेष आद. डॉ. राणिषीबेनना वरद हस्ते संस्थाना प्रांगणमां वृक्षारोपण करवामां आयुं हतुं.

- પ્રકીર્ણ :** શિબિર દરમિયાન જિનાભિષેક, જિનપૂજા, પ્રાતઃકાળની ભક્તિ, બૃહદ્દ આલોચના જેવા કાર્યક્રમો યોજાયા હતા. સ્વ. ભોગીભાઈ શાહ પરિવાર તરફથી નોટબુક અને પેનની તથા આદ. શ્રી દિનેશભાઈ બાવીશી પરિવાર (રાજકોટ) તરફથી ફુલસ્કેપ ચોપડા તથા પેનની પ્રભાવના કરવામાં આવી હતી. શિબિર પ્રસંગે સંસ્થાના વિકાસમાં યશસ્વી યોગદાન આપનાર સંસ્થાના પ્રથમ પ્રમુખ સ્વ. ચંદુલાલ છોટાલાલ મહેતાની રૂપમાં પુણ્યતિથિ નિમિત્તે તેઓએ આપેલ પ્રશંસનીય સેવાઓ તથા તેઓના સદ્ગુણોની સંસ્થા દ્વારા અનુમોદના કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થાને જમીનનું દાન આપનાર સ્વ. શ્રી રસિકભાઈ શાહની દાનભાવનાને બિરદાવી તેઓના સુપુત્ર આદ. શ્રીપાળભાઈ શાહનું અભિવાદન કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન નીચેના દાનવીર મહાનુભાવોએ સ્વામિવાત્સલ્યનો લાભ લીધો હતો :

(૧) આદ. શ્રી તરલાબેન દિનેશભાઈ બાવીશી પરિવાર (રાજકોટ), (૨) સ્વ. ચંદુભાઈ મહેતાના પરિવારજનો શ્રી પલ્લવીબેન નિરુંજભાઈ મહેતા (અમદાવાદ), (૩) શ્રી જ્યોત્સનાબેન પ્રવીણચંદ્ર મોદી પરિવાર(રાજકોટ) હસ્તે : શ્રી રશ્મિકાતભાઈ અને પારસભાઈ મોદી

સંસ્થામાં થાઈરોઇડ નિદાન કેમ્પ સંપન્ન

સંસ્થા સંચાલિત મેડિકલ સેન્ટરના ઉપકમે Abbot કંપનીના સહયોગથી તા. ૮-૭-૧૭ના દિવસે રાહત દરે થાઈરોઇડ કેમ્પ યોજાઈ ગયો. કેમ્પનો શુભારંભ પૂજ્યાશ્રી આત્માનંદજી અને મહાનુભાવોના વરદ

હસે દીપમાગઠથી થયો. ૧૧૮ જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો; જેમાંથી પછના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હતા. સંસ્થા સંચાલિત ગુરુકુળના બાળકોનો CBC અને બ્લડગ્રૂપ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કેમ્પની સફળતામાં યશસ્વી યોગદાન આપનાર ટ્રસ્ટીશ્રી આદ. ડૉ. રાજેશભાઈ સોનેજી, આદ. શ્રી દિનેશભાઈ બાવીશી તથા શ્રી નીતાબેન લોટિયાને સાભાર ધન્યવાદ પાઠવીએ છીએ. કેમ્પ માટે આર્થિક યોગદાન આપનાર શ્રીમતી તરલાબેન દિનેશભાઈ બાવીસી પરિવાર (રાજકોટ)નો સંસ્થા હદ્યપૂર્વક આભાર માને છે.

ભારતમાં ચાતુર્મસ દરમિયાન બિરાજમાન જૈન સાધુ-સાધી ભગવંતોની યાદી

અમને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ચાતુર્મસ દરમિયાન બિરાજમાન જૈન સાધુ-સાધીઓ ભગવંતોની યાદી નીચે મુજબ છે :

- પૂજ્ય આચાર્યશ્રી વિદ્યાનંદજી મહારાજ શ્રી કુંદુંદભારતી, ન્યૂ દિલ્હી
- પૂજ્ય આચાર્યશ્રી વિદ્યાસાગરજી મહારાજ રામટેક(નાગપુર) મહારાષ્ટ્ર
- પૂજ્ય આચાર્યશ્રી વર્ધમાનસાગરજી મહારાજ શ્રવણબેલગોલા, કર્ણાટક
- પૂજ્ય આચાર્યશ્રી વિરાગસાગરજી મહારાજ દિલ્હી
- પૂજ્ય આચાર્યશ્રી પુષ્પદંત સાગરજી મહારાજ બેંગલોર (કર્ણાટક)
- પૂજ્ય આચાર્યશ્રી ગુપ્તિનંદીજી મહારાજ ધર્મતીર્થ, ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
- પૂજ્ય આચાર્યશ્રી વિશુદ્ધિસાગરજી મહારાજ ઇન્દોર (મ.પ્ર.)
- પૂજ્ય આચાર્યશ્રી અનેકાંતસાગરજી મહારાજ પૂના (મહારાષ્ટ્ર)
- પૂજ્ય આચાર્યશ્રી કનકનંદીજી મહારાજ ચીતરી (રાજસ્થાન)
- પૂજ્ય આચાર્યશ્રી વિમદ્દસાગરજી મહારાજ શાહપુર, અમદાવાદ
- પૂજ્ય આચાર્યશ્રી સૂરદેવસાગરજી મહારાજ તલોદ (બનાસકાંઠા)
- ગચ્છાવિપતિ આચાર્ય વિજ્ય જ્યધોષસૂરીશ્વરજી મહારાજ સાબરમતી, અમદાવાદ
- પૂ. આચાર્યશ્રી જ્યસુંદરસૂરીશ્વરજી મહારાજ સાબરમતી, અમદાવાદ
- ગચ્છાવિપતિ આચાર્ય વિજ્ય પુષ્પપાલસૂરીશ્વરજી મ.સા. પાલી, અમદાવાદ
- પૂજ્ય આચાર્ય વિજ્ય શીલરત્નસૂરીશ્વરજી મ.સા. વાસણા, અમદાવાદ
- પૂજ્ય આચાર્યશ્રી યોગતિલકસૂરીશ્વરજી અંકુર, નારણપુરા, અમદાવાદ
- પૂજ્ય આચાર્યશ્રી વિજ્ય મહાપદ્મસૂરિજી મ.સા. સેટેલાઈટ, અમદાવાદ
- રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા. મહેસાણા
- પૂજ્ય આચાર્યશ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. બારડોલી
- પૂજ્ય આચાર્યશ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. નારણપુરા, અમદાવાદ
- પૂજ્ય આચાર્યશ્રી રાજહંસસૂરીશ્વરજી મ.સા. આંબાવાડી, અમદાવાદ
- પૂજ્ય આચાર્યશ્રી બા. બ્ર. શ્રી વિરેન્દ્રજી સ્વામી (દરિયાપુરી સંપ્રદાય) સુરેન્દ્રનગર

- ગચ્છાવિપતિ આચાર્ય પૂજ્ય ભાવચંદજી મ.સા. (અજરામર સંપ્રદાય) ફોર્ટ, મુંબઈ
- ગચ્છાવિપતિ શ્રી અમીયંદજી મહારાજ (બોટાદ સંપ્રદાય) વડોદરા
- પૂજ્ય આચાર્યશ્રી બા. બ્ર. નવીનાંધિજી મ.સા. (ખંભાત સંપ્રદાય) ખંભાત
- બા. બ્ર. પૂજ્ય ઉત્તમમુનિ મ.સા. (ગોપાલ સંપ્રદાય) અંધેરી, મુંબઈ
- બા. બ્ર. પૂજ્ય સરદાર મુનિ મ.સા. (બરવાળા સંપ્રદાય) અબુદ્ધિનગર, વડોદરા
- બા. બ્ર. પૂજ્ય ધીરજમુનિ મહારાજ (ગોંડલ સંપ્રદાય) મુંબઈ
- બા. બ્ર. પૂજ્ય નારમુનિ મહારાજ (ગોંડલ સંપ્રદાય) પાવનધામ, કાંદીવલી, મુંબઈ
- પૂજ્ય ઉપાધ્યાય શ્રી અનુભવસાગરજી મહારાજ સોલા, અમદાવાદ
- પૂજ્ય ઉપાધ્યાયશ્રી મયંકસાગરજી મહારાજ વાઘોડિયા જિ. વડોદરા
- કાંતિકારી મુનિશ્રી તરુણસાગરજી મહારાજ સિકર (રાજસ્થાન)
- પૂજ્ય મુનિશ્રી પ્રમાણસાગરજી મહારાજ ઉદ્ધેપુર, (રાજસ્થાન)
- પૂજ્ય મુનિશ્રી સુધાસાગરજી મહારાજ કિસનગઢ (અજમેર) રાજસ્થાન
- પૂજ્ય મુનિશ્રી સુયશગુપ્તિજી મહારાજ શ્રવણબેલગોડા, કાર્ણાટક
- પૂજ્ય મુનિશ્રી ચંદ્રગુપ્તજી મહારાજ શ્રવણબેલગોડા, કાર્ણાટક
- બા. બ્ર. પૂજ્ય રાજેન્દ્રમુનિ મ.સા. (દરિયાપુરી સંપ્રદાય) વાલકેશ્વર, મુંબઈ
- પૂજ્ય અપૂર્વમુનિ મહારાજ (દરિયાપુરી સંપ્રદાય) શાહપુર, અમદાવાદ
- પૂજ્ય આર્થિક શ્રી જ્ઞાનમતિ માતાજી પોદનપુર, બોરિવલી, મુંબઈ
- પૂજ્ય આર્થિક શ્રી સ્વસ્તિભૂપણમાતાજી જહાજપુર (ભીલવાડા) રાજસ્થાન

સંસ્થાના વિવિધ વિભાગોમાં આર્થિક સહયોગ આપનારા દાનવીર મહાનુભાવો

સંસ્થાના વિવિધ વિભાગોમાં આર્થિક સહયોગ આપનારા નીચેના દાનવીર મહાનુભાવોને સંસ્થા સાભાર ધન્યવાદ પાઠવે છે :

- ‘સાધક નિવાસ’ના સહયોગી દાતાશ્રીઓની યાદી :

(૧)	શ્રી જ્યંતભાઈ એમ. શાહ, મુંબઈ	રૂ. ૧૫,૦૦,૦૦૦/-
(૨)	શ્રી અધ્યભાઈ એન. શાહ, મુંબઈ	રૂ. ૧૧,૦૦,૦૦૦/-
(૩)	શ્રી પ્રકાશભાઈ એચ. શાહ, અમદાવાદ	રૂ. ૫,૦૦,૦૦૦/-
(૪)	શ્રી રાજેન્દ્રભાઈ ભક્તા, યુ.એસ.એ.	રૂ. ૫,૦૦,૦૦૦/-
(૫)	શ્રી ચેનાઈ મુમુક્ષુમંડળ, હસ્તે શ્રી કિરણભાઈ તુરભિયા, શ્રી બહુલભાઈ પારેખ, શ્રી કમલેશભાઈ ગોસલિયા, ચેનાઈ	રૂ. ૩,૦૦,૦૦૦/-
(૬)	શ્રી દિનેશભાઈ એસ. બાવીસી, રાજકોટ	રૂ. ૨,૦૦,૦૦૦/-
(૭)	શ્રી ઉખાબેન કિશોરભાઈ શેઠ, કોણા	રૂ. ૨,૦૦,૦૦૦/-
(૮)	શ્રી ડૉ. રાજેશભાઈ સોનેજી પરિવાર, અમદાવાદ	રૂ. ૧,૦૦,૦૦૦/-

(૮) શ્રી શાંતિલાલ સી. શાહ, મુંબઈ	રૂ. ૧,૦૦,૦૦૦/-
(૯૦) એક મુમુક્ષુ ભાઈ તરફથી, હસ્તે શ્રી નીતિનભાઈ પારેખ, મુંબઈ	રૂ. ૫૧,૦૦૦/-
(૯૧) એક મુમુક્ષુ બહેન તરફથી, અમદાવાદ	રૂ. ૫૧,૦૦૦/-
(૯૨) શ્રી અશોકભાઈ પી. શાહ, મુંબઈ	રૂ. ૫૧,૦૦૦/-
(૯૩) શ્રી જ્યંતિભાઈ કોદરભાઈ શાહ, હિમતનગર	રૂ. ૫૧,૦૦૦/-
(૯૪) શ્રી ઈલાબેન મહેતા, અમદાવાદ	રૂ. ૫૧,૦૦૦/-
(૯૫) શ્રી વિમલભાઈ આર. શાહ, ગાંધીનગર	રૂ. ૩૧,૦૦૦/-
(૯૬) શ્રી ચંપકલાલ માણેકલાલ પરમાર્થી, વડોદરા	રૂ. ૧૫,૦૦૦/-

આ ઉપરાંત ‘સાધક નિવાસ’ માટે અનેક મુમુક્ષુઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે, તે સૌને સંસ્થા તરફથી સાભાર ધન્યવાદ પાઠવીએ છીએ.

● ભોજનાલય :

(૧) શ્રી જ્યંતભાઈ એમ. શાહના જન્મદિવસ નિમિત્તે કાયમી તિથિ (શ્રાવણ સુદ પૂનમ - રક્ષાબંધન)	રૂ. ૧,૫૧,૦૦૦/-
(૨) શ્રી ઈન્દ્રાભેન જ્યંતભાઈ શાહના જન્મદિવસ (૧૨ માર્ચ) નિમિત્તે કાયમી તિથિ	રૂ. ૧,૫૧,૦૦૦/-
● ઓડિયો-વિડિયો : શ્રી શાંતિલાલ સી. મહેતા પરિવાર, મુંબઈ	રૂ. ૫૮,૦૦૦/-
● દિવ્યધનિ સહાય : શ્રી શાંતિલાલ સી. મહેતા પરિવાર, મુંબઈ	રૂ. ૪૨,૦૦૦/-
● ત્યાગી ભોજનાલય : શ્રી દિનેશચંદ્ર એસ. બાવીસી પરિવાર, રાજકોટ	રૂ. ૩૦,૦૦૦/-
● મેડિકલ સેન્ટર : શ્રી દિનેશચંદ્ર એસ. બાવીસી પરિવાર, રાજકોટ	રૂ. ૨૫,૦૦૦/-
● છાશકેન્દ્ર : શ્રી જ્યંતભાઈને કાંતિલાલ શાહ, મલાડ, મુંબઈ	રૂ. ૧૮,૦૦૦/-
● પૂરગ્રસ્ત સહાય :	
(૧) શ્રી કુમુદભાઈ એસ. મહેતા, મુંબઈ	રૂ. ૨૦,૦૦૦/-
(૨) શ્રી દિનેશચંદ્ર એસ. બાવીસી પરિવાર, રાજકોટ	રૂ. ૧૦,૦૦૦/-

આ ઉપરાંત સંસ્થા દ્વારા પૂરચસ્તોને સહાય અર્થે અનેક મુમુક્ષુ ભાઈ-બહેનોનો આર્થિક સહયોગ સાંપડ્યો છે, તે સર્વેને સંસ્થા તરફથી સાભાર ધન્યવાદ.

સાભાર સ્વીકાર

સંસ્થામાં રહીને સેવા-સાધના કરતા સ્વાધ્યાયકાર, પ્રજ્ઞાવંત મુમુક્ષુ આદ. શ્રી અનુપમભાઈ શાહના જન્મદિન નિમિત્તે તથા શ્રી નીતાબેન અનુપમભાઈ શાહના માતુશ્રી સ્વ. સુશીલાબેન પૂનમચંદ વખારિયાની પુષ્યતિથિ નિમિત્તે તા. ૨-૮-૨૦૧૭ના રોજ સંસ્થા સંચાલિત ગુરુકુળના સર્વ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ આપવામાં આવી હતી; જેનો સંસ્થા સાભાર સ્વીકાર કરે છે.

સંસ્થામાં પ્રસ્તાવિત 'સાધકનિવાસ' ના ભૂમિપૂજન વેળાએ



સંસ્થામાં યોજાયેલ થાઈરોઇડ નિદાન કેમ્પ (તા. ૬-૭-૨૦૧૭)



સંસ્થા દ્વારા પૂરગ્રસ્તોને સહાય વેળાએ



સંસ્થા સંચાલિત ગુરુકુળના ભાગકોને સ્કૂલભેગ અપદાનિધિ (તા. ૨-૮-૨૦૧૭)



Registered under RNI No. : GUJGUJ/2008/25883

Permitted to post at Ahmedabad PSO on 15th of every month under Postal
Regd. No. : GAMC - 309/2015-2017 issued by SSP Ahmedabad valid upto 31-12-2017
Publication Date 15th of every month



સંસ્ક્યા પ્રકાશિત દિવાળી પુસ્તિકા **'જીવનદીપ'** નું મુખપૃષ્ઠ



આ અંકના વિશિષ્ટ સહયોગી દાતા

- ① 'દિવ્યધ્યાન' ઓગસ્ટ - ૨૦૧૭ના અંક માટે રૂ. ૨૧,૦૦૦/-નો આર્થિક સહયોગ
શ્રી રાજેન્ડ્રભાઈ ભક્તા પરિવાર (યુ. એસ. એ.)
તરફથી પ્રાપ્ત થયેલ છે. સંસ્કા તેઓશ્રીના આ 'જીવનદીપ'ની અનુમોદના કરે છે.
- ② 'દિવ્યધ્યાન' ઓગસ્ટ - ૨૦૧૭ના અંક માટે રૂ. ૨૧,૦૦૦/-નો આર્થિક સહયોગ
સ્વ. શ્રી કાંતિલાલ કાળીદાસ ખંધારની સ્મૃતિમાં,
હસ્તે : શ્રી પંકજભાઈ તથા ભિહિરભાઈ કાંતિલાલ ખંધાર (બોડકદેવ, અમદાવાદ) પરિવારજનો
તરફથી પ્રાપ્ત થયેલ છે. સંસ્કા તેઓશ્રીના આ 'જીવનદીપ'ની અનુમોદના કરે છે.

Printed & Published by Smt. Dr. Sharmisthaben M. Soneji on Behalf of
Shrimad Rajchandra Adhyatmik Sadhana Kendra, Koba - 382 007.
Dist. Gandhinagar (Gujarat). Printed at Bhagwati Offset, 16/C, Bansidhar Estate,
Bardolpura, Ahmedabad - 380 004. Editor : Shri Mitesh A. Shah



દિવ્યધ્યાન (ઓગસ્ટ - ૨૦૧૭)